

# વાતો, શુદ્ધિ અર્થમય લભાવિષો



શ્રી. એમ. પી. પટેલ ફાઉન્ડેશન પ્રકાશન

## મંગલ પ્રાર્થના

દિવસના પરિશ્રમનો ગ્રારંભ કર્યા પહેલાં અને પરિશ્રમને અંતે, પ્રભુ !

હું તારા દ્વાર પર આવું છું, અને મારી પ્રાર્થનારૂપી નૈવેદ્ય તારા ચરણમાં  
ધરું છું.

મારી કોઈ એવી મોટી માંગણી, મહત્વાકંક્ષા, લાલસા કે અતૃપ્તિંભના  
મને સત્તાવતી નથી કે જે તારી પાસે વ્યક્ત કરતાં મને સંકોચ થાય !  
પ્રભુ !

હું તારી પાસે શું માંગું ?

મને સારી સોબત આપ, કંઈ ને કંઈ નવું જાણવાની જિજાસા આપ,  
દુઃખમાં બીજાને મદદરૂપ થવાની સહાનુભૂતિ આપ,  
બીજાના સુખમાં ભાગ લેવાનો ઉત્સાહ આપ.

ધનથી નહિં તો મનથી, પ્રેમાળ શબ્દોથી અને સહાયરૂપ  
કિયાથી બીજાનાં દુઃખ હળવાં કરી શકું એવું મન આપ,  
ગમ ખાઈ જવા જેટલી ઉદારતા આપ, અને આઘાતથી અભેદ રહેવા  
માટે ખેલદિલી આપ.

પ્રભુ, જીવનમાં મને પ્રકાશ આપ, જેમાં મારો આત્મા સત્ય જોઈ શકે.  
માત્ર મારી આંખોને નહિ, મારા મનને અજવાણું બતાવ જેમાં હું મારી  
ભૂલોને જોઈ શકું,

સત્ય અને અસત્યને પારખી શકું. પ્રભુ ! જ્યારે સૂર્ય પોતાનાં કિરણો  
સંકેલી લે અને અંધકાર આ પૃથ્વી અને આકાશને ગળી જાય,

(અનુસંધાન ટાઈટલ ત્રીજા પર)

# યાલો, જીવનને આનંદમય બનાવીએ

લેખિકા : જ્યોતિ થાનકી

સ્નેહી શ્રી .....

જીવનને આનંદમય કેમ બનાવવું તેનું માર્ગદર્શન આપતું આ  
પુસ્તક આપનું સાથી બની રહે, તેવી શુભ કામનાઓ સહ .....

સાધેમ  
મંગળભાઈ પી. પટેલ  
મૂકેશ એમ. પટેલ



શ્રી એમ. પી. પટેલ ફાઉન્ડેશન પ્રકાશન

૩-૪, 'વિઠલભાઈ ભવન',  
સરદાર પટેલ કોલોની રેલવે કોસિંગ પાસે,  
અમદાવાદ ૩૮૦ ૦૧૩  
ફોન નં. : ૭૫૫ ૧૫૬૪ - ૭૪૫ ૪૩૧૦

શ્રી. એમ.પી.પટેલ ફાઉન્ડેશન  
 જીવનધરતર પ્રકાશન-શ્રેષ્ઠીનું એકત્રીસમું પુસ્તક  
 ચાલો, જીવનને આનંદમય બનાવીએ

- \* લેખિકા : જ્યોતિ થાનકી
- \* © જ્યોતિ થાનકી
- \* પ્રકાશન-વર્ષ : ઓગસ્ટ, ૨૦૦૦
- \* પ્રકાશક : શ્રી એમ. પી. પટેલ ફાઉન્ડેશન વતી  
 મુકેશ એમ. પટેલ  
 ૩-૪, 'વિષુલભાઈ ભવન',  
 સરદાર પટેલ કોલોની રેલવે કોસિંગ પાસે,  
 અમદાવાદ - ૩૮૦ ૦૧૩
- \* મૂલ્ય : સદ્ભાવ-સુવાચન-સદુપ્યોગ
- \* પ્રકાશન-આયોજન : મુકુન્દ શાહ, ફોન નં. : ૬૬૦ ૦૮૫૮
- \* આવરણ : જ્ય પંચોલી, ફોન નં. : ૬૬૧ ૪૬૭૮
- \* મુદ્રણશુદ્ધિ : જ્યંતીભાઈ જાની, ફોન નં. : ૬૬૧૨૭૨૮
- \* આવરણ મુદ્રણ : ઉમા ઓફ્સેટ, અમદાવાદ - ૩૮૦ ૦૦૪.  
 ફોન નં. : ૫૬૨૬૩૨૪
- \* લેસર કંપોઝ : મિનળ ગ્રાફિક્સ, અમદાવાદ - ૩૮૦ ૦૦૯.  
 ફોન નં. : ૭૪૭૫૫૧૮
- \* મુદ્રક : ઉદ્ય ઓફ્સેટ, અમદાવાદ - ૩૮૦ ૦૦૪.  
 ફોન નં. : ૫૬૨ ૧૫૬૭

## પ્રસ્તાવના

આજના યુગમાં મનુષ્યે પોતાની બુદ્ધિક્રિતથી ઘણી જ પ્રગતિ સાધી છે. વિશ્વને તેણે નાનું બનાવી દીધું છે. પૃથ્વી ઉપર બનતા સઘળા બનાવોને તે પોતાના ઘરમાં બેસીને જોઈ શકે છે. પૃથ્વીના બીજા છેડે આવેલા પોતાના સ્વજન સાથે પોતાના જ ઘરમાં બેસીને એક સેકંડમાં વાત પણ કરી શકે છે. વિજ્ઞાનનાં સાધનો દ્વારા તેનું જીવન ઘણું જ સુખ-સગવડ બર્યું બન્યું છે. મનોરંજનનાં સાધનો વધ્યાં છે. પણ તેમ છતાં મનુષ્ય દુઃખી છે. કોઈને તનનું દુઃખ છે, તો કોઈને મનનું દુઃખ છે, તો કોઈને અભાવનું દુઃખ છે, તો કોઈને ધનનું પણ દુઃખ છે. આમ સાચી રીતે કોઈ સુખી નથી. વળી આજના ઝડપથી પરિવર્તન પામતા જતા યુગમાં જીવન ખૂબ જટિલ બનતું જાય છે. તનાવ, સંઘર્ષ, અભાવ, મુશ્કેલીઓ, અવરોધો - આ બધાંનો એક યા બીજા પ્રકારે આજના મનુષ્યને સતત સામનો કરવો પડે છે. આથી જીવનમાંથી તેની શ્રદ્ધા ઊરી ગઈ છે. ધર્મો તેની સમસ્યાઓનો સાચો ઉકેલ આપી શક્યા નથી, એટલે ધર્મમાં પણ તેને શ્રદ્ધા રહી નથી. આથી જીવનની સાચી શાંતિ તેને ક્યાંયથી મળતી નથી. આવી પરિસ્થિતિમાં જેમણે પોતાના જીવનમાં સત્યદર્શન કર્યું છે, સાચી શાંતિ અને આનંદનો અનુભવ કર્યો છે, તેવા દ્રષ્ટાઓ, મનીષીઓ, સંતોની અનુભવવાણી જરૂર માર્ગદર્શક બની શકે છે. જેમને પોતાના જીવનમાં ખરેખર શાંતિ જોઈએ છે, સાચો આનંદ જોઈએ છે, તેમને આવી અનુભૂતિની વાણી, આવા જીવનદર્શનનું એકાદ વાક્ય કે એકાદ પ્રસંગ પણ દિશાદર્શન માટે પર્યાપ્ત બની જાય છે. આ પુસ્તક પોંડિયેરીના શ્રીઅરવિંદ આશ્રમનાં શ્રીમાતાજીએ ત્યાંના સાધકોને સાચી રીતે જીવન કેવી રીતે જીવી શકાય એ માટેનું જે વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું, તેને આધારે, તેમ જ અધ્યાત્મપથના અન્ય યાત્રિકોની અનુભૂત વાણીને આધારે તૈયાર કર્યું છે. મને શ્રદ્ધા છે કે

પોતાના જીવનને આનંદમય બનાવવા ઈચ્છિતા સહુ કોઈને આમાંથી યત્કિચિત્ત પાથેય જરૂર મળશે.

શ્રી. એમ. પી. પટેલ ફાઉન્ડેશન પ્રકાશન દ્વારા આ પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે, તેનો આનંદ અનુભવી રહી છું. અગાઉ પણ આ શ્રેષ્ઠીમાં મારું પુસ્તક - 'પ્રભાતનાં ડિરણો' પ્રકાશિત થયું હતું. આ ફાઉન્ડેશને એમનાં પ્રેરણાદાયી અને જીવનને ઉધ્વર્ગામી બનાવનારાં પુસ્તકોની સ્તુત્ય અને ઉમદા યોજનામાં પુનઃ સહભાગી થવાની તક આપી એ માટે હું શ્રી. એમ. પી. પટેલ ફાઉન્ડેશનનો અને તેના મુખ્ય ટ્રસ્ટી શ્રી. મંગળભાઈ પટેલનો હાર્દિક આભાર માનું છું.

અંતમાં, પરમાત્માનો દિવ્ય કૃપાસ્પર્શ સર્વને મળે અને સર્વને માટે આનંદમય જીવનની દિશા ખૂલે એ પ્રાર્થના સાથે

૭, સ્ટાફ ક્વાર્ટર્સ,  
ગુરુકુળ - બોખીરા,  
પોરબંદર - ૩૬૦ ૫૭૮

- જ્યોતિ થાનકી



## અનુક્રમણિકા

|    |  |    |
|----|--|----|
| ૧. | જીવન છે, પ્રભુની અણમોલ ભક્ષિસ .....        | ૩  |
| ૨. | આનંદમય જીવનનો પાયો - સ્વસ્થ શરીર .....     | ૬  |
| ૩. | પ્રાણશક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ .....           | ૨૭ |
| ૪. | મનની શક્તિ અને તેનો ઉપયોગ .....            | ૩૪ |
| ૫. | સાચા માલિકનો મેળાપ .....                   | ૪૪ |
| ૬. | આનંદમય જીવન માટે અપનાવવા યોગ્ય બાબતો ..... | ૪૮ |
| ૭. | આનંદમય જીવન માટે ત્યાગ કરવાની બાબતો .....  | ૭૧ |



## જીવન છે, પ્રભુની આણમોળ બાક્ષિસ

પ્રભુએ આપણાને અતિ સુંદર જીવન આપ્યું છે. આ જીવન પ્રેમ, આનંદ અને શક્તિથી બંરેલું છે. પૃથ્વી ઉપર જન્મેલો કોઈપણ મનુષ્ય એવો નહીં હોય કે જેના અંતરમાં આ પ્રેમ, આનંદ અને શક્તિના સોત રહેલા ન હોય. આ કંઈ સ્થળ ભૌતિક વસ્તુઓ નથી કે જેના ઉપર કોઈ એક વ્યક્તિ માલિકીનો દાવો કરી શકે કે તેનો ઈજારો મેળવી પોતે જ તેનો ઉપયોગ કરી શકે. આ તો પ્રભુ તરફથી દરેક મનુષ્યને મળેલી બાક્ષિસ છે. પણ બહુ ઓછા મનુષ્યો એને જાણો છે. જેઓ એ જાણો છે, તેઓ તેનો સુંદર ઉપયોગ કરી પોતાના જીવનને પ્રેમ, આનંદ અને શક્તિથી ભર્યું ભર્યું બનાવે છે. જેમને ખબર નથી તેઓ તેનાથી વંચિત રહીને જીવનના આનંદની અમૂલ્ય તકો ગુમાવી દે છે. તેમનું જીવન વિકસેલા સુગંધિત પુષ્પ જેવું બનવાને બદલે મૂરજાયેલી કળી જેવું બનીને ખરી પડે છે.

પૃથ્વી ઉપર જ્યારે મનુષ્ય આવે છે, ત્યારે પ્રભુ એને એના વિકાસ માટેની અનંત શક્યતાઓ આપે છે. પ્રભુ પોતાના દરેક સર્જનને સુંદર અને પૂર્ણ બનાવવા ઈચ્છે છે. જેમનું જીવન ફક્ત એક જ દિવસ માટે છે, એવું નાનકડું ફૂલ કે નાનકડું જીવનું જોઈએ તો તે કેવું સુંદર, વિવિધ રંગોની અદ્ભુત ગોઠવણી વાળું, એની ચેતનાની રીતે પૂર્ણ હોય છે ! તો મનુષ્ય પ્રભુનું શ્રેષ્ઠ સર્જન છે, તે અસુંદર, અપૂર્ણ કે દુઃખમય કેમ હોઈ શકે ? કેટકેટલી ઉત્તમ વસ્તુઓ પ્રભુએ મનુષ્યને આપી છે, જે બીજાં કોઈ પ્રાણીઓને આપી નથી. વિચાર કરવા માટેનું શ્રેષ્ઠ સાધન મન, ભગવાને મનુષ્યને આપ્યું છે. લાગણીઓ અને સંવેદનાઓ અનુભવવા માટે હદય આપ્યું છે. વિચારો અને સંવેદનાઓને વ્યક્ત કરવા માટે ચાલો, જીવનને આનંદમય બનાવીએ

વાણીનું વરદાન આય્યું છે. વળી કામ કરવા માટે સુંદર શરીર આય્યું છે. આ બધાથી પણ વધારે તેમણે પોતાનો તેજોમય અંશ મનુષ્યના અંતરમાં મૂકી આય્યો છે અને પાછો મનુષ્ય તેને જાણી શકે, તેની સાથે એકરૂપ બની શકે એવી પ્રેરણાશક્તિ પણ તેમણે એને આપી છે. આવું કોઈ ગ્રાણીઓમાં નથી અને છતાં બધાં કરતાં મનુષ્ય સહૃદ્યી વધારે દુઃખી છે !

આધુનિક યુગમાં મનુષ્યનું જીવન ખૂબ જ જટિલ બની ગયું છે. ઝડપથી પરિવર્તન પામતા યુગમાં જીવવાની દોટમાં માણસે પોતાના આંતર સ્વરૂપનો સંપર્ક ગુમાવી દીધો છે. પરિણામે તેની અંદર રહેલાં પ્રેમ, આનંદ અને શક્તિનાં જરણાંઓનો પ્રવાહ રૂધાઈ ગયો છે. તેથી તેને જીવનનો ભાર લાગે છે. સંઘર્ષ, તનાવ, અજંપો અને અભાવોથી ઘેરાયેલો આજનો મનુષ્ય ક્યાંય શાંતિ મેળવી શકતો નથી. વિટેબણાઓ, અવરોધો અને મુશ્કેલીઓ સામે તેને સતત ઝગ્ઝવું પડે છે. આથી તેનું જીવન નિરાશામાં, ચિંતા અને ઉદ્વેગમાં પસાર થાય છે. આવા જીવનમાં સ્થિરતા નથી જોવા મળતી, સલામતી પણ નથી હોતી તો પછી એમાં આનંદ તો હોય જ ક્યાંથી ? પણ છતાં એના અંતરમાં જંખના તો આનંદને મેળવવાની જ હોય છે અને તેથી એ મેળવવા તે દોડતો જ રહે છે. પણ મૃગજળ જેવો આનંદ તેના હાથમાં આવતો નથી. અને એ દોટમાં જ મૃગલાંઓની જેમ જ એનું જીવન પૂરું થઈ જાય છે. અંતે તેને પારાવાર વેદના થાય છે કે જીવનમાં ખરેખર જે કરવા જેવું હતું, જે મેળવવા જેવું હતું તે બધું જ રહી ગયું. પણ ત્યારે તો ઘણું જ મોડું થઈ ગયું હોય છે. આમ દુઃખથી બરેલા જીવનનો અંત પણ દુઃખમાં જ આવે છે.

આવું ન થવા દેવું હોય તો માણસે પોતાને આ જીવન શા માટે આપવામાં આય્યું છે, તે વિશે વિચાર કરવો જોઈએ અને પોતાના

જીવનનો હેતુ શોધી કાઢવો જોઈએ. આમ તો દરેક આત્મા પૃથ્વી ઉપર  
 વિકાસ માટે દેહ ધારણ કરીને આવે છે. એટલે જીવનની પરિભાષા  
 આપવી હોય તો એમ કહી શકાય કે જીવન એટલે ચેતનાનો વિકાસ.  
 પરમ પ્રભુમાંથી છૂટો પડેલો આત્મા અનેક જન્મોમાં અનુભવો દ્વારા  
 વિકાસ પામતો પામતો પાણો પરમાત્મામાં ન ભળે ત્યાં સુધી તેનો સતત  
 વિકાસ થતો જ રહે છે. વિકાસના માર્ગમાં અનેક અવરોધો તો આવતા  
 જ રહે છે, જેમ નદીના માર્ગમાં પહાડો આવે, મોટા કાળમીઠ પથ્થરો  
 આવે તોપણ તે પોતાનો માર્ગ કાઢીને સતત આગળ ધપતી જ રહે છે  
 અને અંતે મહાસાગરમાં લીન થઈ જાય છે. આવું જ આપણી ચેતનાનું  
 પણ છે. પરમાત્મામાંથી છૂટી પડેલી ચેતના અવરોધો, મુશ્કેલીઓ  
 વચ્ચેથી માર્ગ કાઢતી કાઢતી અનેક જન્મોને અંતે તે વિરાટ ચેતનામાં  
 લીન થઈ જાય છે, ત્યારે જ આ યાત્રા પૂરી થાય છે. દરમિયાનમાં  
 મુશ્કેલીઓ અને વિરોધોની વચ્ચે થતા વિકાસમાં આનંદ હોય છે. પ્રગતિ  
 કરવામાં, મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધવામાં આનંદ હોય છે.  
 પ્રયત્નમાં આનંદ છે અને પ્રયત્નને અંતે પ્રાપ્ત થતી સફળતામાં આનંદ  
 છે. આ રીતે જોતાં સતત ગતિ, પ્રગતિ અને પદ્ધી પ્રાપ્તિ એ જીવનનું  
 લક્ષ્ણ છે. બંધિયાર પાણીમાં જેમ લીલ બાળી જાય અને તેમાં દુર્ગધ  
 આવી જાય તેમ સ્થગિત જીવનમાં પણ જડતાની લીલ બાળી જાય છે  
 અને ચેતનાનો પ્રવાહ રૂધાઈ જતાં તે બોજો બની જાય છે. આથી  
 જીવનને જો સદાય તાજું, પ્રકુલ્પિત અને હળવુંકૂલ જેવું રાખવું હોય તો  
 તેનો એકમાત્ર ઉપાય છે, જીવનમાં નિરંતર પ્રગતિ કરતાં રહેવું. આ  
 પ્રગતિ કેવી રીતે કરવી, એને માટેનાં આપણી પાસે કયાં કયાં સાધનો  
 છે, એ સાધનોનો ઉત્તમ ઉપયોગ કેવી રીતે કરવો - આ વિશે હવે આપણે  
 જોઈએ.



## આનંદમય જીવનનો પાયો -

### સ્વર્ણ શરીર

મનુષ્ય એ પ્રભુનું લાડકું સંતાન છે. એટલે જ તેમણે તેને સુંદર મુલાયમ શરીર, માણશક્તિ, મન જેવાં ઉત્તમ સાધનો આધ્યાત્મિક જીવનને શ્રેષ્ઠતમ બનાવી શકે છે. અને જો ઉપયોગ કરતાં ન આવડે તો સુંદર જીવન વેડજાઈ પણ જાય છે. આથી આ સાધનો અંગેની સમજજ્ઞા જો મેળવી હોય તો પોતાના જીવનનું ઘડતર ઉત્તમ રીતે કરી શકાય છે.

ઉત્તમ કલાકારને જો તૂટેલા તારવાળું વાજિંત્ર આપવામાં આવે તો તે તેમાંથી સંગીતની સૂરાવલિ જરૂર છેડી શકશે, પણ જો તેને ઉત્તમ વાજિંત્ર આપવામાં આવે તો તે અદ્ભુત સંગીત સર્જ શકશે. એવું જ આપણા આત્માનું છે. આત્માની શક્તિઓ અમાપ છે. પણ જો તેને વ્યક્ત કરવા માટેનું શરીર નબળું હશે તો એ શક્તિઓની અભિવ્યક્તિ ઉત્તમ રીતે નહીં કરી શકે. આત્માની શક્તિઓના પ્રાગટ્ય માટે શરીર સુદૃઢ અને શક્તિવાળું હોવું જોઈએ,

જીવનની ગતિ, પ્રગતિ અને સિદ્ધિઓનો આધાર શરીરના આરોગ્ય ઉપર રહેલો છે. એ જ રીતે મનુષ્યના આનંદનો આધાર પણ પ્રબળ સંકલ્પશક્તિવાળા અપવાદરૂપ મનુષ્યોને બાદ કરતાં, સામાન્ય રીતે મનુષ્યના શારીરિક સ્વાસ્થ્ય પર રહેલો છે. દુર્બળ અને રોગિઓ શરીરથી સારી રીતે કાર્યો થઈ શકતાં નથી. સારી રીતે કાર્યો ન થવાથી તેમાં સફળતા મળતી નથી. તેથી માણસ નિરાશ થઈ જાય છે. તેના જીવનમાં આનંદ, ઉત્સાહ રહેતાં નથી. એ ઉપરાંત પણ જો શરીરમાં

રોગ હોય, તેમાં પીડા થતી હોય તો ગમે તેટલાં આનંદ પ્રમોદનાં સાધનો સામે હોય, પણ કોઈ જ વસ્તુ આનંદ આપી શકતી નથી. વેદનાગ્રસ્ત શરીર હોય તો દુનિયાની કોઈ વસ્તુમાં આનંદ આવતો નથી. આમ સ્થૂલ ભોગ ભોગવવા માટે, ચીજવસ્તુઓના ઉપભોગ માટે, સ્વાદની તૃપ્તિ માટે - એટલે કે સ્થૂલ આનંદની પ્રાપ્તિ માટે પણ શરીર સારું અને નીરોગી હોવું જરૂરી છે. તો સૂક્ષ્મ આનંદની પ્રાપ્તિ માટે, યોગસાધના કરવા માટે, પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે પણ શરીર સ્વસ્થ અને સુદૃઢ હોવું જોઈએ. આપણાં શાસ્ત્રોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ કહ્યા છે. આ ચારેયની પ્રાપ્તિ સ્વસ્થ શરીર વગર થઈ શકતી નથી. આમ કોઈપણ પ્રકારનું કાર્ય કરવા માટે, કોઈપણ પ્રકારના આનંદના ઉપભોગ માટે શરીર એ મુખ્ય આધાર છે. માટે શરીરને સંપૂર્ણપણે સ્વસ્થ રાખવા અને લાંબા સમય સુધી કામ આપતું રહે તેવી સ્થિતિમાં રાખવા માટે દરેકે જાગૃતપણે પ્રયત્ન કરવા જોઈએ.

## શરીરની સ્વસ્થતા માટેની આવશ્યક બાબતો

શરીરને સ્વસ્થ અને નીરોગી રાખવા માટે ખોરાક, ઊંઘ, આરામ, નિયમિત વ્યાયામ અને શરીરની સારી ટેવો જરૂરી છે.

### સંતુલિત ખોરાક :

અત્યારે મનુષ્યનું શરીર જે રીતે રચાયેલું છે તેમાં શક્તિ મેળવવા માટે બહારથી ખોરાક લેવો પડે છે. શરીર પોતાની મેળે સૂક્ષ્મમાંથી શક્તિ મેળવી શકતું નથી. પરંતુ સામાન્ય રીતે લોકો આ વાત ભૂલી જાય છે કે આપણે શક્તિ મેળવવા ખોરાક લેવાનો છે. તેઓ તો સ્વાદને ખાતર પેટમાં ઠાંસી ઠાંસીને વાનગીઓ નાંખતા જ રહે છે. જાણો જીવનનો હેતુ માત્ર ખાવાનો જ ન હોય ! આપણે જીવવા માટે ખાવાનું છે, પણ લોકો એથી ઊલટું આચરણમાં મૂકે છે - ‘ખાવા માટે જવે છે.’ અને તેથી

બિચારા નાજુક પેટ પર રોજેરોજ અત્યાચાર થતો રહે છે. તીખા તમતમતા, મસાલાવાળા, તળેલા ભારે પદાર્થો પચાવવાની જઈને ભારે તકલીફ પડે છે. તેમાં ઘણી બધી શક્તિઓ ખરચાઈ જતી હોય છે. વળી આવી ભારે વાનગીઓથી શરીરમાં ચરબીના થર જમા થતા રહે છે. અને તેથી 'હાઈ બ્લડપ્રેસર', 'ડાયાબિટીસ' જેવા કાયમી રોગો થાય છે. રોગિએ શરીર પછી નથી સ્વાદનો આનંદ લઈ શકતું કે નથી કાર્યનો આનંદ લઈ શકતું. આથી શરીરને આનંદમાં રાખવા માટે સ્વાદ ઉપર લગામ મૂકવી જ જોઈએ.

ખોરાક બાબતમાં સામાન્ય રીતે બીજો એક અનુભવ એવો પણ થતો રહે છે કે પાર્ટીઓ, મહેફિલો, જમણવારોમાં, સમૂહમાં ભોજન કર્યા પછી શરીરમાં બેચેની, અસુવિધા કે જડતા અનુભવાતાં હોય છે. શા માટે એવું થતું હોય છે ? એ અંગે શ્રીમાતાજીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, ત્યારે તેમણે કહ્યું કે "જ્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે ખોરાકની સાથે સાથે આપણે આપણી અંદર ભયંકર પ્રમાણમાં અચેતના, તમસ, ભાર અને જડતા લઈએ છીએ." શ્રીઅરવિંદે પણ આ સંદર્ભમાં એમ કહ્યું હતું, 'આધ્યાત્મિક રીતે જોતાં મારે કહેવું જોઈએ કે ખોરાકની અસરનો આધાર ખોરાકમાં રહેલી કોઈપણ ચીજ કરતાં ખોરાકની સાથે જે ગુણ વાતાવરણ અને અસરો આવે છે, તેના ઉપર વિશેષ રહેલો છે.' જ્યારે સામૂહિક જમણવારો થતા હોય છે, ત્યારે તેમાં અનેક લોકોની ઈચ્છાઓ, વૃત્તિઓ, કામનાઓ ખોરાકની સાથે ભળેલાં હોય છે. એવો ખોરાક પાછો વધારે પ્રમાણમાં આગ્રહ કરીને ખવડાવવામાં આવે છે, એટલે ભૌતિક અને સૂક્ષ્મ એમ બંને રીતે તે ભારત્રૂપ બને છે. તેથી તમસનો ઓથાર ચડી આવે છે. તેને પચાવવા માટે જઈને પણ ખૂબ મહેનત કરવી પડે છે. જેઓ સૂક્ષ્મ કામ કરતા હોય, સર્જનાત્મક કાર્ય કરતા હોય કે સાધના કરતા હોય, તેમને આવા પ્રકારના ભોજનથી

કાર્યમાં આળસ અને પ્રમાણનો અનુભવ થાય છે. બે ત્રાણ દિવસ સુધી આ તામસિકતા શરીરમાં રહેલી જોવા મળે છે. શરીરમાં સુસ્તી, આળસ, તંત્રા અને નિદ્રાનો ઓથાર આવે છે. પડ્યા રહેવાની વૃત્તિ પ્રબળ બને છે. આ સ્થિતિમાં કાર્યમાં વિલંબ ઊભો થાય છે. તો પછી કરવું શું ?

પ્રથમ વાત તો એ કે જેમણે પોતાના જીવનધ્યેયને પ્રાપ્ત કરવું છે, એમણે આવી મિજબાનીઓમાં ભોજન ન લેવું. તો પ્રશ્ન એ ઉઠે છે કે મિત્રોને, સગાંસંબંધીઓને એથી ખોટું લાગે છે. જો તેઓ ખરેખર આપણા સાચા મિત્રો અને સગાંઓ હોય તો, તેમને ખોટું નહીં લાગે, તેઓ આપણી પરિસ્થિતિ સમજી શકશે. નિખાલસપણે કરેલી રજૂઆતથી ગેરસમજૂતી પછી રહેતી નથી. ઊલટાનું તેઓ આપણને સાથ-સહકાર આપે છે. એમ છતાં એવી પરિસ્થિતિ હોય કે કશુંક લેવું જ પડે તો આપણા શરીરને માફક આવે તેવી થોડી વાનગી ખાઈ લેવી. પરંતુ બીજા કરતાં પોતે ઘણા મહાન છે, ક્યાંય કશું ખાતા નથી એવો દેખાવ કે પ્રચાર કરવો એ આત્મશ્લાઘા છે અને તે તો આવાં ભોજન કરતાં પણ વધારે ખતરનાક છે. એટલે કોઈપણ જાતનો દેખાવ કર્યા વગર - પોતાના શરીરને અનુકૂળ આવે તે રીતે વર્તવું જોઈએ.

ખોરાકની બાબતમાં ધ્યાન રાખવાની બીજી એક બાબત એ છે કે ખોરાકની સાથે જળેલી સૂક્ષ્મ વસ્તુઓને જોદૂર કરવી હોય તો બધું જ ભગવાનને ધરાવીને, તેમને પ્રાર્થના કરીને પ્રસાદ રૂપે લેવું. આપણામાં એટલે જ સર્વમધ્યમ ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. આ સંદર્ભમાં શ્રીમાતાજી કહે છે, “ખોરાક વિશે તમારા મનને વ્યગ્ર કરો નહીં. યોગ્ય પ્રમાણમાં લો. જરૂર કરતાં વધારે પણ નહીં તેમ જ ઓછો પણ નહીં. તેના માટે લોભ કે અણગમો ન સેવો. શરીરના પોષણ માટે ભગવાને ખોરાક આપ્યો છે, એમ સમજીને સાચી ભાવનાથી તમારી અંદર રહેલા ભગવાનને અર્ધ્ય તરીકે અર્પણ કરીને ખોરાક લો.” આ

રીતે જો ખોરાક લેવામાં આવે તો તે ખોરાક શરીરને ખૂબ શક્તિ આપે છે અને પ્રસાદરૂપ બની ગયેલા ખોરાકમાં પછી તમસ રહેતું નથી.

ત્રીજું, ખોરાકની બાબતમાં એ ધ્યાન રાખવાનું છે કે તેની પાછળ વૈજ્ઞાનિક દસ્તિબિંદુ રહેલું હોવું જોઈએ. આપણા શરીરના બંધારણ અંગેનું આપણાને જ્ઞાન હોવું જોઈએ. શરીરને કયાં કયાં તત્ત્વોની જરૂર છે, તે કઈ રીતે મળશે, કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ, આવું જ્ઞાન ખરેખર કેટલા લોકોને હોય છે? મોટાભાગના માણસો ખોરાક પ્રત્યે અજ્ઞાન જ હોય છે. શ્રીમાતાજી કહે છે કે “બધા જ માણસો, મોટામાં મોટા બુદ્ધિશાળી માણસો પણ જે ભૂલ વિના અપવાદ કરે છે, તે છે ખોરાક પ્રત્યેના આપણા દસ્તિબિંદુની. કઈ વાનગી ખાવી, તેને કેમ બનાવવી, તેને કઈ રીતે ખાવી આ બાબતોમાં સહુ કોઈ પારાવાર રસ લે છે. પરંતુ આ રસને સ્થાને ખોરાક પ્રત્યે એક શાસ્ત્રીય દસ્તિબિંદુ અપનાવવું જોઈએ કે શરીરને કઈ વસ્તુની જરૂર છે. આનું રાસાયણિક જ્ઞાન મેળવી લઈને એ પ્રમાણે ખોરાક લેવો જોઈએ.” ખોરાક સુપાય્ય, શરીરને પોષણ આપે, શક્તિ આપે તેવો, માફકસર હોવો જોઈએ. વળી શરીરની જરૂરિયાત પ્રમાણે હોવો જોઈએ. શરીરની જરૂરિયાતોનું ભલા કોણ ધ્યાન રાખે છે? ભાવતી વાનગી ત્રણગણી ખવાઈ જાય છે, અને ન ભાવતી વાનગીની સામે પણ જોવામાં આવતું નથી. તેથી શરીરમાં અમુક તત્ત્વો વધી જાય છે, અમુકનું પ્રમાણ ઘટી જતાં અસમતુલા ઊભી થાય છે અને રોગને પ્રવેશવા માટેના દરવાજા ખુલ્લા થાય છે.

ચોથું, શરીરનાં સૂચનોને ધ્યાનમાં લેવાં જોઈએ.

શરીર પણ બોલતું હોય છે, એને પણ પોતાનો અવાજ છે. પરંતુ એનો અવાજ કોઈ સાંભળતું નથી. માંદા પડતાં પહેલાં શરીરે અનેકવાર ચેતવણી આપી હોય છે. સૂચનો કર્યાં હોય છે. પણ તેની ચેતવણી કે સૂચનોને ધ્યાનમાં જ લીધાં ન હોવાથી પછી તે બળવો પોકારીને હડતાલ

ઉપર ઉત્તરી જાય છે. માંહું પડી જાય છે. આપણે કહીએ છીએ કે અચાનક જ 'હાર્ટએટેક' આવી ગયો. પણ હાર્ટએટેક ક્યારેય અચાનક આવતો નથી. મહિનાઓ અગાઉ શરીર અનેક સૂચનો આપતું રહેતું હોય છે. પણ એ સૂચનો સાંભળવાની પણ ફુરસદ નથી. પછી શરીર બિચારું શું કરે ? જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી ચૂપચાપ સહન કર્યા જ કરે છે. જ્યારે સહનશક્તિની હદ વટી જાય ત્યારે પછી પડી જાય છે, બેબાન થઈ જાય છે કે હાર્ટએટેક આવી જાય છે.

ભગવાને આપણા શરીરનું યંત્ર એવું અદ્ભુત બનાવ્યું છે કે જો તેને સંભાળપૂર્વક ઉપયોગમાં લેવામાં આવે તો તે સો વર્ષ સુધી કામ આપી શકે તેવું છે. વળી નાનીમોટી બીમારીઓ પણ તે પોતે પોતાની મેળે જ સુધારી શકે તેવી શક્તિ પણ તેનામાં રહેલી છે. પણ તેની આ કુદરતી શક્તિ હવે કુંઠિત થઈ રહી છે. મનુષ્યો આહાર-વિહાર - વિચાર અને વિકાર દ્વારા શરીર પર સતત જીવભ ગુજરતા રહે છે અને તેથી શરીરની સમતુલા ભાંગી પડે છે. તે પછી પોતાની મેળે સાજું થઈ શક્તનું નથી. તે માંદલું અને અશક્ત બની રહે છે. પછી સો વર્ષ જીવવાની શક્તિ પણ ગુમાવી બેસે છે. શ્રીમાતાજી કહે છે કે "જો માણસ પ્રાણમય આવેગો કે મનના વિચારોથી દોરવાતો ન હોય તો શરીરને જેટલા ખોરાકની જરૂર છે તેટલો જ ખોરાક તે ગ્રહણ કરે છે. પછી શરીર સૂચન કરે છે કે હવે સહેજ પણ વધારે નહીં, ત્યારે અટકી જવું જોઈએ." જો માણસો શરીરના આ સૂચનને ધ્યાનમાં લે તો તેમનો કેટલો બધો આંતરિક અને બાહ્યશ્રમ બચી જાય છે અને ખોરાકમાંથી પણ તેને ખૂબ શક્તિ મળી જાય છે. પણ શરીરના સૂચનને ગણકાર્ય વગર સ્વાદને સંતોષવા માણસ ખાધા કરે તો પછી એક સ્થિતિ એવી આવે છે કે શરીર ખોરાકનો એક કણ પણ સ્વીકારવા તૈયાર થતું નથી અને પછી તેને મહિનાઓ સુધી માત્ર પ્રવાહી પર જ રહેવું પડે છે ! શ્રીમાતાજી કહે છે,

“જ્યારે માણસ પ્રાણની લાલસાથી કે મનના વિચારોથી ખોરાક લેતો નથી, ત્યારે શરીર બહુ જ સારું સૂચક બની રહે છે, એને જ્યારે ભૂખ લાગશે ત્યારે તે તમને જરૂર કહી દેશે. એને પોતાની અંદર કશુંક લેવાની જરૂર લાગશે ત્યારે તે તમને સંકેત આપશે અને જ્યારે શરીરને ખોરાકની જરૂર હોતી નથી ત્યારે તે ખોરાકનો વિચાર પણ કરતું નથી.” આમ જો આપણે જાગૃત બનીને શરીરના સંકેતો પ્રત્યે ધ્યાન આપીએ તો શરીર લાંબા સમય સુધી આપણું વફાદાર સેવક બનીને કામ આપતું રહે છે.

પાંચમી બાબત માંસાહાર અંગેની છે. ઘણા લોકો એવું માને છે કે માંસાહાર કરવાથી શરીરની શક્તિ વધે છે, શરીર તંદુરસ્ત રહે છે. એથી લોકો વધારે પ્રમાણમાં માંસાહાર કરતા રહે છે. પરંતુ માંસાહારથી જે શક્તિ મળે છે, તે મનુષ્યની નહીં પણ પશુની હોય છે. માંસાહાર મનુષ્યને પશુની ચેતના આપે છે. આ સંદર્ભમાં શ્રીમાતાજીએ કહ્યું હતું, “તમે માંસાહાર લો છો, તેની સાથે સાથે એવું બને છો કે તમે જે જાનવરનું માંસ ખાતા હો છો, તેની ચેતનાને પણ થોડે ઘણે અંશે તમે તમારી અંદર પચાવો છો. અલભતા આ કોઈ કંઈ ગંભીર બાબત નથી પણ તે આનંદદાયક નથી. આ વસ્તુ તમને પશુ જેવા બનાવી દે છે. માનવ જેવા બનાવામાં મદદ કરતી નથી.” પશુની ચેતના આપનારો ખોરાક મનુષ્યને કઈ રીતે આનંદ આપી શકે? જેમણે મનુષ્યનું જીવન જીવવું હોય, પોતાની ચેતનાને માનસિક સ્તરથી પણ ઊંચે ઉઠાવવી હોય તેમણે પશુની ચેતનામાં લઈ જનારો આવો ખોરાક બિલકુલ ન લેવો જોઈએ. ખોરાક એવો જ લેવો જોઈએ જે શરીરને નિર્મળ રાખે, સ્વસ્થ રાખે, તાજગી બક્ષે અને શક્તિ આપે.

ઇછી બાબત વ્યસનો અંગેની છે. ઘણા માણસોને તમાકુ, ગુટકા, કેફી પીણાંના સેવનથી, ભારે આનંદ મળતો હોય છે. અને તેથી તેઓ

આવા નશીલા પદાર્થોનું સેવન વારંવાર કરતા રહે છે. પણ આ આનંદ નથી; એની બ્રમજા છે. નશામાં કલ્પનાઓ વાસ્તવિક જણાતાં આનંદનો બ્રમ ઊભો થાય છે. પણ નશો ઊતરી જતાં વાસ્તવિકતા સામે આવતાં દુઃખ વધી જાય છે. ને શરીર શિથિલ થઈ જાય છે. જ્ઞાનતંતુઓ નબળાં પડી જતાં સહનશક્તિ ઓછી થઈ જાય છે. તન, મન અને ધનની બરબાદી કરનારાં વસનો તો મનુષ્યના જીવનનો આનંદ હરી લે છે. શ્રીમાતાજી કહે છે, “તમાંકું ને દારુ એ તો ધીમું જેર છે, એનું સેવન બંધ કરવું જ જોઈએ. આ વસ્તુનું સેવન કરતાં કરતાં માણસોને માટે તે પછી જીવનની અનિવાર્ય જરૂરિયાત બની જાય છે. તેના વગર પછી માણસને ચાલતું નથી. આ વસ્તુઓ તેનું સેવન કરનારની સંકલ્પશક્તિ અને સ્મૃતિશક્તિનો ધીમે ધીમે નાશ કરી નાખે છે.” વસનોથી માણસનું પોતાનું જ નહીં પણ પરિવારજનોનું જીવન પણ બરબાદ થઈ જાય છે. તેનાં બાળકોનું ભવિષ્ય પણ અંધકારમય બની જાય છે. આથી મનુષ્યે વસનના પડછાયાથી પણ દૂર રહેવું જોઈએ. જો વસનની ચુંગાલમાં ફસાઈ ગયા હો તો દદ સંકલ્પ કરી તેમાંથી મુક્ત થઈ જવું જોઈએ. આ વિશે શ્રીમાતાજી કહે છે, “બસ, આ હવે છેલ્લીવાર એમ કહીને તમારે નિયમોનો અપવાદરૂપ ભંગ કરવો જોઈએ નહીં. કેમ કે, આવા અપવાદરૂપ નિયમભંગો માત્ર છેલ્લીવાર કહેવાથી અટકી જતા નથી. એ વારંવાર થયા કરે છે એથી તમારી સંકલ્પશક્તિ શિથિલ થઈ જાય છે. અને પછી તમે ક્યારેય વસનમાંથી છૂટી શકતા નથી. નિર્બળતા-માત્ર સામે તમારે દાંત ભીસીને આગળા વાસી દેવા જોઈએ. તમારા જઠરની કુદરતી કિયાઓને ખલેલ પહોંચાડે એવી મિજબાનીઓ, જ્યાફિતો, ઠાંસી ઠાંસીને ખાવું આમાંનું કશું જ થવા દેવું જોઈએ નહીં.”

આ રીતે ખોરાકની બાબતમાં જગૃતિ રાખવામાં આવે તો શરીરના મોટા ભાગના રોંગોમાંથી બચી શકાય છે, એટલું જ નહીં પણ

શરીર સ્હૂર્તિવાળું રહે છે અને ખૂબ સારી રીતે કામ આપે છે.

## નિદ્રા :

ખોરાક પછી શરીરને માટે આવશ્યક એવી વસ્તુ છે નિદ્રા. પ્રભુએ આપણું આ અદ્ભુત યંત્ર આપોઆપ આરામ મેળવી લે, તેના કોષો પુનઃ શક્તિ પ્રાપ્ત કરી લે તે માટે નિદ્રાની બક્ષિસ આપી છે. પ્રાણીમાત્રને માટે નિદ્રા જરૂરી છે. ઉંઘમાં માણસ તનનાં, મનનાં, અભાવનાં બધા જ પ્રકારનાં હું: ખો ને પીડા ભૂલીને જુદી જ દુનિયામાં ચાલ્યો જતો હોય છે. એ દુનિયા કેવી છે, ત્યાં કેવી રીતે જાય છે ને શું કરે છે, એ બધું જ રહસ્યમય છે. પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકોએ અનેક સંશોધનો કર્યા હોવા છતાં નિદ્રાવસ્થાનો પ્રદેશ અને તેનાં રહસ્યોનો પાર પામી શકાપો નથી. નિદ્રાથી માણસનો થાક ઉત્તરી જાય છે. હું: ખ હળવું થઈ જાય છે. નિદ્રામાં શરીર આરામ અનુભવતાં રોગમાંથી પણ જલદીથી સાજું થાય છે. નિદ્રા પોતે જ એક અદ્ભુત ઔષધ છે. તેના જેવી પીડાશામક દવા બીજી એકેય નથી. આથી ડોક્ટરો પણ જે દરદીઓને ઉંઘ ન આવતી હોય તેમને ઉંઘની ગોળીઓ આપી સુવડાવી દેતા હોય છે. સાજો સારો માણસ પણ જો બે રાત ઉંઘે નહીં તો તે બેચેન બની જાય છે. ઉંઘ માટે ફાંઝાં મારે છે.

જો માણસના મનના વિચારો અને પ્રાણના આવેગો દખલ ન કરે તો શરીરમાં એવી રચના છે કે તે જ્યારે થાકે ત્યારે આપોઆપ ઉંઘમાં સરી પડે છે. નાનાં બાળકો થાકી જાય ત્યારે તેઓ ગમે ત્યાં હોય તો પણ ઉંઘી જતાં હોય છે. પણ મોટાં થતાં મનનો વિકાસ થતાં, તેઓ પોતાની ઉંઘી જવાની આ સહજ શક્તિ ગુમાવી દે છે. જેમ મન વધારે ને વધારે પ્રવૃત્ત બને તેમ ઉંઘ ઓછી થતી જાય છે. પણ અપૂરતી ઉંઘ હોય તો શરીર અને મન બંને સ્વસ્થ રહેતાં નથી. જે રાતે સારી ઉંઘ ન આવી હોય તેનો બીજો દિવસ ભારે સુસ્તીમાં અને આણસમાં વીતે છે. કામમાં

મન બરાબર લાગતું નથી. કશાયમાં મજા પડતી નથી. આથી હંમેશાં સ્ફૂર્તિવાળા, પુષ્પ જેવા તરોતાજા રહેવા માટે નિયમિત અને પૂરતી ઊંઘ અનિવાર્ય છે.

## કેવી રીતે ઊંઘવું જોઈએ ?

સામાન્ય રીતે તો માણસ રાત્રે પથારીમાં પડે છે અને ઊંઘી જાય છે. ઊંઘવા માટેની પણ પદ્ધતિ હોય છે, એનો ઘ્યાલ બહુ ઓછા લોકોને હોય છે. મોટેભાગે તો મનુષ્યો જ્યારે સૂવા જાય છે ત્યારે તેમના મનમાં દિવસનાં કરેલાં કાર્યો, વિચારો, લાગડીઓ આ બધું ચાલતું હોય છે. ઘણી વખત તો દિવસમાં બનેલા બનાવો કે કોઈ સાથે થયેલો વાર્તાલાપ મનમાં ટેપરેકોર્ડરની જેમ સતત ચાલતો રહે છે. દિવસ દરમિયાન કરેલી પ્રવૃત્તિઓ, મનમાં રહેલી ચિંતા - ઉપાધિ - આ બધાંની સાથે માણસો ઊંઘી જાય છે ત્યારે તેમના અચેતન મનમાં આ વસ્તુઓ જાગૃત રહે છે. શરીર ભલે પથારીમાં પડેલું હોય, પણ અચેતન મન જાગૃત હોતાં તેને પૂરો આરામ મળતો નથી. ઘણી વખત તો ઊંઘમાંથી ઊઠ્યા પછી જાણે આપણે ખૂબ થાકી ગયાં હોઈએ એવું અનુભવાય છે. આની પાંછળનું કારણ એ જ છે કે અશાંત મનથી ઊંઘમાં સરી પડવાથી, જે શાંતિ જોઈએ તે મળતી નથી. શ્રીમાતાજી કહે છે કે “કઈ રીતે ઊંઘવું, તેનું માણસને જ્ઞાન નથી. તેના પરિણામે માણસ ઊંઘવા જાય ત્યારે સારો હોય છે અને ઊઠે ત્યારે થાકેલો અને માંદો હોય છે. એનો અર્થ એ કે ઊંઘમાં તે અચેતનાનાં આકમણોનો ભોગ બન્યો હોય છે.”

જો ઊંઘ દ્વારા ભરપૂર તાજગી અને શક્તિ મેળવવાં હોય તો પદ્ધતિસર ઊંઘવું જોઈએ. શ્રીમાતાજીએ એ પદ્ધતિ આ રીતે બતાવેલી છે. તેઓ કહે છે, “તમે જ્યારે ખૂબ થાકી ગયાં હો ત્યારે થાકેલા શરીરે તમારે ઊંઘવું નહીં. કેમ કે, એનાથી તમે અચેતનામાં સરી પડો છો. પણ તમારે પથારીમાં લાંબા થઈને પડ્યા રહેવું. શરીરનાં બધાં અંગોને ચાલો, જીવનને આનંદમય બનાવીએ

શિથિલ કરતાં જવું. જાણે તેમાં હાડકાં અને માંસપેશીઓ છે જ નહીં, એવું ઢીલું શરીર થઈ જવું જોઈએ. શરીરને નરમ રજાઈના વીંટા જેવું કરીને પડ્યા રહેવા દેવું. બિલકુલ હલનયલન કરવું નહીં કે શરીર થોડો પણ થડકાટ અનુભવે. પછી મનને શાંત અને નિષ્ઠિય કરી દેવું. મનમાં કોઈ જ વિચાર ન રહેવા દેવો. કોઈ સમયા કે ગુંધનો વિચાર ન કરવો. દિવસ દરમિયાન કરેલાં કાર્યોને વાગોળવાં નહીં. વિચારોને સક્રિય રીતે અનુસરવા નહીં. કોઈ જાતનો માનસિક પ્રયત્ન ન કરવો. મસ્તક પર શાંતિ અને મૌન સ્થાપી દેવાં. પછી પ્રાણમય સ્વરૂપ ઉપર કામ કરવું. બધી લાગણીઓને શાંત કરી દેવી. આ બધું થઈ જાય પછી તમારા સ્વભાવ પ્રમાણે તમારે પ્રાર્થના કરવી. અભીષ્ટા કરવી. એકાગ્રતા કરવી. નિદ્રા દરમિયાન સર્વ વિરોધી બળોથી રક્ષા કરવા ભગવાનની કૃપાને પ્રાર્થના કરવી કે “હે ભગવાન, મારી નિદ્રા દરમિયાન તમે ચાંપતી નજર રાખજો.” પછી ધીમે ધીમે ઊંઘમાં ચાલ્યા જવાનું. આ છે ઊંઘ માટેનાં શ્રેષ્ઠ પદ્ધતિ. જો દરેક રાત્રિએ તમે આ પ્રમાણો કરવાનું ચાલુ રાખશો તો થોડા જ સમયમાં તમારી નિદ્રા સચેતન બની જશે. પછી તમે અનુભવશો કે ત્યાં એક પ્રકાશ રહેલો છે. જે તમને ધીમે ધીમે દિવ્યજીવન પ્રત્યે લઈ જઈ રહ્યો છે. એ સમયે જો તમને ઊંઘ આવી જાય તો તે ઊંઘ સારામાં સારી હશે. અંધકારના ગર્તમાં ઊતરી પડવાને બદલે પછી તમે પ્રકાશના ધામમાં નિદ્રા લેશો. પછી જ્યારે તમે સવારમાં જાગૃત થશો ત્યારે અત્યંત તાજગીભર્યા ચૂસ્ત અને સંતુષ્ટ હશો.”

આ રીતે સચેતન બનીને ઊંઘ લેવાથી ઊંઘ વધારે સ્ફૂર્તિ અને તાજગી આપે છે. ઊંઘતી વખતે મન અને પ્રાણમય સ્વરૂપને શાંત કર્યા પછી મનુષ્ય સભાન હોય તો તે સ્થૂલ શારીરિક ચેતનામાંથી બહાર નીકળીને વધારે સૂક્ષ્મ ચેતનામાં પ્રવેશે છે. સૂક્ષ્મ સ્તરો પાર કરતાં કરતાં તે નામરૂપથી પર સચ્ચ્યેદાનંદ જ્યાં રહેલા છે, ત્યાં પહોંચે છે.

શ્રીમાતાજી કહે છે કે “અહીં આ સ્થિતિમાં તમે ફક્ત ત્રણ જ મિનિટ રહેશો, તો પણ જ્યારે તમે પાછા તમારી શારીરિક ચેતનામાં આવશો ત્યારે તમે સંપૂર્ણપણે આરામમય, તાજગીસભર અને પ્રકૃતિકત હશો કે જાણે તમે કલાકો સુધી ઉંઘ્યા ન હો !” પણ એ સ્વરૂપમાં ફૂદકો મારીને એમ ને એમ પહોંચી જવાતું નથી. એક જ રાતમાં એ બની શકે નહીં, એ માટે અત્યાસ કરવો જોઈએ. ખંતપૂર્વક રોજેરોજ પ્રયત્ન કરવો જોઈએ. પણ એમાં એકવાર સફળતા મળ્યા પછી પ્રત્યેક રાત્રિ પ્રકાશમય અને આનંદમય બની રહે છે અને ઉંઘ નવજીવન બક્ષનારી બની જાય છે.

## ક્યારે ઉંઘવું જોઈએ ?

સામાન્ય રીતે તો પ્રકૃતિનાં બધાં સત્ત્વો સૂર્યાસ્ત થાય ત્યારે શાંતિમાં ચાલ્યાં જતાં હોય છે. પશુ, પક્ષી, વનસ્પતિ પણ સૂર્યાસ્ત પછી ઉંઘી જાય છે. અને સૂર્યાદ્ય પહેલાંના એક કલાક અગાઉ બધાં જાગી જાય છે. માત્ર નિશાચરો રાત્રે જાગે છે ને દિવસે ઉંઘે છે. અને મનુષ્યો ? મનુષ્યોએ તો જળહળતી રોશનીથી રાત્રિને દિવસમાં પલટાવી નાંખી છે. ઉંઘવા માટેનો ઠંડકલર્યો અંધકાર વીજળીના દીવાઓના તાપમાં ફેરવાઈ જતાં જાણે ઉંઘ માટે ભગવાને કરેલી વ્યવસ્થા તૂટી પડી છે. આથી તનના અને મનના રોગીઓથી હોસ્પિટલો ભરાતી રહે છે. સતત પ્રવૃત્તિઓ, ભારે કામનું દબાણ, મન પરનો તનાવ-આ બધાંને લઈને વ્યક્તિને રાત્રિના ઉજાગરા કરવા પડેછે. વિદ્યાર્થીઓનો ભારે અત્યાસક્રમ, કસોટીઓ, પરીક્ષાઓ, કેરિયર બનાવવા પાછળની દોટ - આ બધાંને લઈને તેમને પણ રાત્રિના ઉજાગરા કરવા પડે છે. આ ઉપરાંત ટી.વી.ની વિવિધ ચેનલોમાં આવતા લોભામણા કાર્યક્રમો, સિનેમાઓ, મહેફિલો, ડાન્સપાર્ટીઓ, રંગારંગ કાર્યક્રમોને લઈને પણ ઉજાગરાઓ થતા રહે છે અને મોટે ભાગે તો મોડી રાત્રે જ સૂવાનું થતું હોય છે. આ સમયે તંગ

મનોદર્શામાં થાકેલા શરીરે અને વગ્ર મને પથારીમાં આળોટ્યા પછી મોડી મોડી ઊંઘ આવતી હોય છે. આથી સ્વાભાવિક છે કે સવારે પણ મોડા જ ઉઠવાનું થાય. આમ રોજેરોજ પ્રકૃતિની વિરુદ્ધ આચરણ કરવાથી પછી તેનો બદલો અસ્વસ્થ શરીર અને અસ્વસ્થ મન રૂપે મળે છે. આ સંદર્ભમાં શ્રીમાતાજી કહે છે, “જો તમારે પ્રકૃતિમાંથી શાંતિ અને શક્તિ મેળવવાં હોય તો વહેલા સૂઈને વહેલા ઉઠવાની આપણી પ્રાચીન પરંપરાને અનુસરો. પૃથ્વી રસાયણ શાસ્ત્રમાં રસ ધરાવનારા વૈજ્ઞાનિકો પાસેથી મેં સાંભળ્યું હતું કે અમુક પ્રકારનાં સૂર્યકિરણો મધ્યરાત્રિ સુધી સક્રિય હોય છે અને મધ્યરાત્રિ પછી બીજા પ્રકારનાં કિરણો સક્રિય બને છે. પ્રથમ પ્રકારનાં કિરણો તમને શક્તિ આપે છે, બીજા પ્રકારનાં કિરણો તમારી શક્તિને હરી લે છે... પ્રતીકાંત્મક રીતે જોતાં આ વાત સાચી લાગે છે, કે મધ્યરાત્રિ સુધી સૂર્ય આથમતો જતો હોય છે અને જ્યારે સૂર્ય આથમે છે, ત્યારે પૃથ્વી પર શાંતિનું અવતરણ થાય છે અને આ શાંતિ ઊંઘ માટે ખૂબ સહાયક હોય છે. મધ્યરાત્રિના પહેલા કલાકથી જ સૂર્ય ઉગતો જાય છે અને જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે પૃથ્વી ઉપર જોરદાર શક્તિ ઉત્તરી આવે છે. અને એ શક્તિ કામ કરવા માટે સહાય કરે છે. તમે જ્યારે મોડા સૂઈને મોડા ઉઠો ત્યારે કુદરતના કાયદાની વિરુદ્ધ વર્તન કરો છો એ સ્થિતિ યોગ્ય નથી.” આમ શાંતિ અને શક્તિ બંને પ્રાપ્ત કરવા માટે વહેલા સૂઈને વહેલા ઉઠવું જોઈએ.

## કેટલો સમય ઊંઘ લેવી જોઈએ ?

પ્રભુએ દરેક મનુષ્યના શરીરમાં ઊંઘ, ભૂખ, તરસ, નિદ્રા માટેની એક ઘડિયાળ મૂકેલી જ છે. જો માણસ કુદરતના કાયદાઓનું ઉલ્લંઘન કરતો ન હોય તો આ ઘડિયાળ નિયમિતપણે મનુષ્યને ઊંઘ અને ખોરાક માટેનાં સૂચનો કરતી જ રહે છે. શરીરને જેટલી જરૂરી ઊંઘ હોય તેટલી તે લઈ જ લેતું હોય છે. પણ મનુષ્યે શરીરની ઊંઘની ઘડિયાળ

અસ્તબ્ધસ્ત કરી નાંખી છે એટલે પ્રશ્ન ઊઠે છે કે શરીરને ઊંઘ માટે કેટલા સમયની જરૂર રહે છે ? આ સંદર્ભમાં શ્રીમાતાજીએ કહ્યું હતું કે “જો માણસ સભાનપણે ઊંઘ લઈ શકતો હોય અને તે પોતાના પ્રકાશમય કેન્દ્રમાં પહોંચી શકતો હોય તો તેની ઊંઘ થોડી મિનિટોમાં જ પૂરી થઈ શકે છે. તે પોતાની ઊંઘની સઘળી અવસ્થાઓ થોડી મિનિટોમાં જ પસાર કરી શકે છે. અને ભરપૂર તાજગી મેળવી શકે છે.” પણ બધા કંઈ એવું કરી શકતા નથી. સામાન્ય મનુષ્યોને પૂરતા આરામ માટે છ થી સાત કલાકની ઊંઘ જરૂરી રહે છે. નાનાં બાળકોને આથી વધારે ઊંઘની જરૂર પડે છે. પણ શરીર અને મનની સ્વસ્થતા માટે ઓછામાં ઓછી છ કલાકની ઊંઘ તો હોવી જ જોઈએ.

## બિહામણાં સ્વખાંઓમાંથી કેવી રીતે મુક્ત બનવું ?

ઊંઘમાં બનતી જો કોઈ રહસ્યમય પ્રવૃત્તિ હોય તો તે સ્વખાંઓ છે. માણસને અનેક પ્રકારનાં સ્વખાંઓ આવતાં હોય છે. કેટલાંક સ્વખાંઓ ભાવિનો નિર્દેશ કરનારાં પણ હોય છે. ઘણીવાર તો એવાં બિહામણાં સ્વખાંઓ હોય છે કે માણસ બયબીત થઈ જાય છે. દિવસના સમયે પણ એવાં ભયાનક સ્વખાંઓની અસર રહેતી હોય છે. આવાં સ્વખાંઓમાંથી મુક્ત થવા માટે શું કરવું ? આપણામાં સૂતાં પહેલાં પ્રાર્થના કરવાની કે ઈષ્ટદેવના નામનો જપ કરવાની વિધિ રહેલી છે, તેની પાછળનું કારણ આ જ છે કે ઊંઘમાં આસુરી શક્તિઓ હેરાન ન કરે અને ભગવાનની શક્તિ રક્ષણ કરે. શ્રીમાતાજી કહે છે કે “સૂતાં પહેલાં તીપ્રભાવે એવી અભીષ્ટા કરવી કે ‘નિદ્રા અંધકારમાં લઈ જવાને બદલે પ્રકાશમાં લઈ જાય.’ સાથે સાથે ભગવાનને પ્રાર્થના કરવી કે તેમની દિવ્યશક્તિઓ ઊંઘમાં પણ રક્ષણ કરે.” દરરોજ નિયમિત - સાચા દિલથી આવી પ્રાર્થના કરતા રહેવાથી એનું પરિણામ ચોક્કસ આવે જ છે. કદાચ તાત્કાલિક એક બે દિવસમાં પરિણામ ન આવે તો પણ

આટલું નિયમિત કરતા રહેવું. તો ઊંઘમાં સતાવતાં ભયાનક દશ્યો, સ્વખાંઓ ચાલ્યાં જશે. અને શાંત ને મીઠી ઊંઘ આવી જશે. શ્રીમાતાજી કહે છે, “ઊંઘવા જતાં પહેલાં તમારી જતને શાંત, નિષ્ટરંગ સમુદ્ર જેવી વિશાળ બનાવી દો. તમારા મનને શાંત અને નિર્ઝંપ બનાવી દો અને તમને ખૂબ સરસ ઊંઘ આવી જશે.”

## આરામ :

શરીરના સાધનને લાંબા સમય સુધી સંકિય રાખવા આરામની પડા જરૂર રહે છે. આજે બાળકો, યુવાનો, પ્રૌઢો અને વૃદ્ધો બધાં પોતપોતાની રીતે કામમાં એવાં પ્રવૃત્ત હોય છે કે કોઈનેય આરામ માટે કુરસદ નથી. દરેકને કંઈક મેળવવું છે, કંઈક બનવું છે, ક્યાંક પહોંચવું છે. તે માટે શરીરના ધોડાને ધોડાવ્યે જ જાય છે. ધોડો થાકી ગયો હોય, હાંફી ગયો હોય તો પડા તેને ધોડાવતા જ રહે છે. જ્યાં સુધી એ થાકીને પડી ન જાય ત્યાં સુધી એની લગામ બેંચાયેલી જ રાખે છે. મોટાભાગના લોકો બુડી કુહાડીથી લાકડાં કાપી રહેલા પેલા કઠિયારા જેવા હોય છે. કઠિયારાને કોઈ શાણા માણસે સલાહ આપી કે “ભાઈ, તારી કુહાડીની ધાર બરાબર સજાવી લે તો તું આટલા સમયમાં બમણાંથી પણ વધારે લાકડાં કાપી શકીશ.” ત્યારે તેણે કહ્યું, “જોતા નથી, આટલો મોટો ઢગલો પડ્યો છે, ધાર કઠાવવા જેટલો સમય જ ક્યાં છે? બસ તે તો નીચું જોઈને, પરસેવે રેબજેબ થતો, હાંઝતો લાકડાં કાપ્યે જ જાય છે. આપણી પડા આવી જ દશા છે. આપણા શરીર રૂપી સાધનને સતેજ કરવા, એની ધાર કાઢવા થોડો સમય તેની અંદર એકાગ્રતા કરવાની, શક્તિનો સંચય કરવાની જરૂર છે. એ ભૂલીને થાકેલાં શરીરથી કામ કર્યે જ જઈએ છીએ. પડા થોડો સમય શરીરને આરામ માટે આપીએ તો તે ધણું વધારે કામ કરશે, એ આપણે જાણતાં નથી.

શરીરને જ્યારે જરૂર હોય ત્યારે આરામ આપવો જ જોઈએ. તો

પછી આ આરામ કેવી રીતે આપવો ? સામાન્ય રીતે મોટાભાગના મનુષ્યો જ્યારે થાકી જાય ત્યારે હળવા થવા મનોરંજન પ્રત્યે વળે છે. સિનેમા જુએ, મિત્રો સાથે ગપ્યાં મારે, ઉતેજક પીણાંઓ પીવે, નાચગાન કરે અને માને કે તેઓ હળવા થઈ ગયા છે. પણ એથી શરીરને સાચો આરામ મળતો નથી. ઉલટાનો થાક લાગે છે. સાચો આરામ કેવી રીતે મેળવવો એ અંગે માર્ગદર્શન આપતાં શ્રીમાતાજી કહે છે, “સાચો આરામ મેળવવા માટે માણસે પોતાની ચેતનામાં નીચે ઉત્તરવાને બદલે ઉંચે ચડવું જોઈએ. પોતાની જાતથી પર થવું જોઈએ. અવચેતનાનો બોજો હઠાવીને ચેતનાની સીડીનાં પગથિયાં ચડીને ત્યાં આરામ કરવો જોઈએ. ત્યાં આરામમાં રહેવાથી માણસ થોડી જ ક્ષણોમાં તાજગી મેળવી શકે છે.” આ રીતે સાચો આરામ માણસને બહારથી નહીં પણ પોતાની અંદર ઉત્તરવાથી મળી શકે છે. એ માટેનો સાવ સરળ રસ્તો એ છે કે જ્યારે શરીરને થાક લાગે ત્યારે બધું છોડીને લાંબા થઈને જમીન પર ચત્તાપાટ સૂઈ જવું અને શબાસન કરવું. શરીરને ઢીલું છોડી દેવું. હાથ ગોઠણ તરફ નીચે રાખવા. મનમાં ત્યારે વિચારો ન કરવા પણ આવે તો તેની ચિંતા કર્યા વગર શાસોશાસને અનુસરવું. એના ઉપર એકાગ્રતા કરવી તો આપોઆપ મન શાંત થઈ જશે. ફક્ત દશ જ મિનિટ આ રીતે કરવાથી શરીર ફરીથી તાજું બની જશે. શરીરને કલાકોનો આરામ આ રીતે થોડી મિનિટોમાં જ મળી જાય છે. અને જો ધ્યાન કરવાની ટેવ હોય તો શબાસનની મુદ્રામાં પાંચ મિનિટ ચિત્તની બધી વૃત્તિઓને શાંત કરી હૃદયમાં ધ્યાન કરવું તો થોડી ક્ષણોમાં જ શરીર ફરીથી શક્તિશાળી બની કામ કરવા સજજ બની જાય છે.

### વ્યાયામ :

સ્વસ્થ શરીર માટે જેમ પૌષ્ટિક આહારની જરૂર છે, યોગ્ય ઉંઘની જરૂર છે, એમ નિયમિત વ્યાયામની પણ જરૂર છે. શરીર જડ છે.

ચેતનાના વિકાસની સાથે તે તાલ મિલાવી શકતું નથી. કેમ કે શરીરની બહુ મંદ પ્રગતિ છે. આથી તે પાછળ રહી જાય છે. પાંત્રીસ વર્ષ પછી તો શરીરનો આકાર સ્થાનિક થઈ જાય છે. પછી આકારમાં ખાસ પરિવર્તન થતું નથી. શરીરની માંસપેશીઓ અક્કડ થઈ જાય છે. બાળકના જેવી મુલાયમતા અને નમનીયતા મોટા માણસોના શરીરમાં રહેતી નથી. એથી અસમતુલા સર્જાતાં રોગનો ભોગ બને છે. પરંતુ યોગ્ય કસરતો અને યોગાસનો દ્વારા શરીરને મુલાયમ ને નમનીય રાખી શકાય છે. આથી આપણાં શાસ્ત્રોમાં યોગાસનો ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. વિવિધ આસનો દ્વારા શરીરના પ્રત્યેક અવયવોને ગતિ મળે છે. રુધિરાભિસરણ સારી રીતે થાય છે. દરેક કોષોને ભરપૂર પ્રાણવાયુ મળતાં તે ચેતનવંતા બની રહે છે. આ ઉપરાંત વિવિધ આસનોથી નાડીતંત્ર શુદ્ધ થાય છે. અંતરનાં સૂક્ષ્મ ચક્કો ખૂલે છે અને આંતરશક્તિઓ પ્રવાહિત થતાં માણસ થોડા સમયમાં ઘણું કામ કરી શકે છે. પરંતુ આ આસનો યોગ્ય ગુરુના માર્ગદર્શન હેઠળ શીખવાં જોઈએ, સિદ્ધ કરવાં જોઈએ. નહીંતર શરીરની સમતુલામાં વિક્ષેપ પડતાં ઘણી મુશ્કેલીઓ પડા સર્જાય છે. દરરોજ નિયમિત રીતે થોડી સાદી કસરતો તો દરેક માણસ કરી શકે છે. શ્રીમાતાજી કસરતને કોષોમાં ચેતના ભરવાની પ્રક્રિયા કહે છે. ફક્ત અર્ધો કલાક કસરત કરવાથી કોષો ગતિમાન બને છે અને તેમાં ચેતના કાર્યરત બને છે. આજના શરીર વિજ્ઞાનીઓ પડા કોષોના ઘસારાને અટકાવવા માટે, એના ક્ષયની પૂર્તિ માટે કસરત કરવા પર ભાર મૂકે છે. દરરોજ કસરત માટે ફાળવેલો અર્ધો કલાક માંદગીમાં ભરબાદ થતા, થાક, આપસ ને નિરાશામાં ગુમાવાતા અનેક કલાકોને બચાવી લે છે અને શરીરની સ્વસ્થતાનો કાયમી આનંદ આપે છે.

## સારી ટેવો :

શરીર ટેવોનું બનેલું છે. તેને જેવી ટેવ પાડવામાં આવી હશે તેવું

તે બને છે. શરીરને સારી ટેવો પડે તે માટે જાગૃતપણે પ્રયત્ન કરવો પડે છે. પણ એક વખત વહેલા ઊંઘવાની ટેવ પડી જાય છે, પછી શરીર અચૂક વહેલું ઊઠી જ જાય છે. પછી એને પથારીમાં પડ્યા રહેવું ગમતું નથી. કદાચ રાત્રે મોડે સુધી સંજોગોવશાત્ જાગવું પડ્યું હોય તો પણ એ સવારે વહેલું જાગી જ જાય છે. એ જ રીતે તેને સવારે કસરત કરવાની કે ખુલ્લામાં ફરવા જવાની ટેવ પાડી હોય તો તે નિયત સમયે તેનું પાલન કરવા તત્પર રહે છે. વહેલા ઊઠીને નિત્યકર્મ પતાવીને સ્નાન-ધ્યાન કરીને પછી જ નાસ્તો કરવાની ટેવ પાડી હશે તો નહાયા પહેલાં શરીર ક્યારેય નાસ્તો કરવા તૈયાર નહીં થાય. જો પથારીમાં બેઠા થયા પછી તરત જ ચા પીવાની ટેવ પાડી હશે, તો જ્યાં સુધી ચા નહીં મળે, ત્યાં સુધી ઊભા નહીં થઈ શકાય. એવું ચાનું ગુલામ શરીર બની જશે. અને ચા નહીં મળે તો આખો દિવસ ખરાબ જશે. શરીરને એકવાર પાઢેલી ટેવ પછી સહેલાઈથી ધૂટતી નથી. માટે શરીરને હમેશાં સારી ટેવો પાડવી જોઈએ. શરીરને સ્વચ્છ રાખવું, સુધડ રાખવું, નીરોગી રાખવું - આ બધી પણ શરીરની ટેવો જ છે. નિયમિત સમયે ખાવું, પીવું, ઊંઘવું, આ ટેવોથી શરીરને ઓછી તકલીફ પડે છે. એની શક્તિઓ ન કામી વેદ્ધાતી નથી. એ શક્તિઓનો ઉત્તમ ઉપયોગ થતાં શરીર સામાન્ય રીતે કામ આપી શકે તેના કરતાં અનેકગણું વધારે કામ આપે છે. નિયમિતતાની ટેવને લઈને પછી શરીર એ સમયે આપોઆપ એ કાર્યો કરતું રહે છે. શરીરનાં કાર્યોમાં એક જાતનો લય જળવાય છે. એને જેમતેમ, ઉતાવળે, વ્યગ્ર બનીને કાર્યો કરવાં પડતાં નથી. એ સહજ ભાવે આનંદથી કાર્યો કરતું રહે છે. એટલે તેમાં સ્વિરતા અને શાંતિ હોય છે.

પરંતુ ખરાબ ટેવો જલદી પડી જાય છે. પણ સારી ટેવો પાડવામાં શરૂઆતમાં શરીરને અને મનને ભારે કષ્ટ પડે છે. એ માટે દફ સંકલ્પ અને સતત પ્રયત્ન જરૂરી છે. થોડો સમય સંકલ્પને વળગીને એ પ્રમાણે

કર્યા કરવાથી સારી ટેવો ચોક્કસ પડે છે અને સારી ટેવો પડતાં શરીર પણ પ્રસન્ન રહે છે. મન પણ પ્રસન્ન રહે છે. અને તેથી જીવન પણ પ્રસન્નતાથી ભરપૂર બની જાય છે.

## શું વૃદ્ધાવસ્થાને આવતી રોકી શકાય ?

શરીરની બાબતમાં એક પ્રશ્ન આ પણ ઉઠે છે કે શું વૃદ્ધાવસ્થાને આવતી રોકી શકાય ? માથે ધોળા વાળ, બોખું મોં, મુખ પર કરચલીઓ, અશક્ત શરીર, આંખે ઝાંખ, કાને બહેરાશ, શરીરમાં અનેક રોગો - આવી વૃદ્ધાવસ્થા કોઈને ગમતી નથી. અને ઇતાં દીર્ઘાયુષી બનવું હોય તો પ્રત્યેક મનુષ્યને આ અવસ્થામાંથી પસાર થવું જ પડે છે. બહારના પ્રયત્નો દ્વારા મનુષ્ય એને દૂર રાખવાનો પ્રયત્ન તો કરે છે, પણ તેમાં તેને સફળતા મળતી નથી. લાંબા આયુષ્ણની આ કિમત દરેકને ફરજિયાત ચૂકવવી પડે છે. કેમ કે શરીરનો એ ધર્મ છે. બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા એ મનુષ્યના જીવનની સ્થિતિ છે. એને કોઈ ઉવેચ્છી શકતું નથી. અત્યારનું શરીર જે દ્રવ્યનું બનેલું છે, એ દ્રવ્ય જ્યાં સુધી પૂરેપૂરું બદલાય નહીં, પ્રભુની પૂર્ણ શક્તિથી ચાલતા કોષોવાળું નવું શરીર જ્યાં સુધી રચાય નહીં, ત્યાં સુધી અવસ્થા અને મૃત્યુ શરીરને માટે અનિવાર્ય છે. પરંતુ માણસ મનથી વૃદ્ધત્વનો સ્વીકાર કરી નિર્ણય બની બેસી રહે, તે સ્થિતિ શરીરના વૃદ્ધત્વને વહેલું જેંચી લાવે છે. વૃદ્ધાવસ્થા પહેલાં મનમાં આવે છે અને પછી જરૂરી શરીરમાં દેખાવા લાગે છે. તેથી શરીરમાં આવતી વૃદ્ધાવસ્થાની ગતિને જો ધીમી પાડી દેવી હોય તો મનમાં વૃદ્ધાવસ્થાનો પ્રવેશ બિલકુલ થવા દેવો નહીં. શ્રીમાતાજી કહે છે, “તમે કેટલાં વર્ષો જીવ્યા છો, એ વર્ષોની સંખ્યા તમને વૃદ્ધ બનાવતી નથી, પણ જ્યારે તમે પ્રગતિ કરવાનું બંધ કરો છો, ત્યારે જ તમે વૃદ્ધ બનો છો.”

પરંતુ જેમ વર્ષો પસાર થતાં જાય છે, અને માણસ મોટો થતો જાય

છે, તેમ તેમ તેને વીતેલાં વર્ષોનો ભાર લાગે છે. એને ચિંતા થવા માટે છે કે હવે આયુષ્યનાં વર્ષો બહુ જ ઓછાં રહ્યાં. આ સંદર્ભમાં શ્રીમાતાજી કહે છે કે “વીતેલાં વર્ષોનો ભાર ત્યારે જ લાગે કે જ્યારે તમે એ નિરર્થક વિતાવ્યાં હોય. જ્યારે તમને એમ લાગે કે જે કામ કરવાનું હતું, તે તમે કરી લીધું છે. હવે તમારે કંઈ જાણવાની જરૂર નથી. હવે નિરાંતે બેસીને કરેલાં કર્માનું ફળ ભોગવીશું એ જ ક્ષણે તમે વૃદ્ધ થઈ જાઓ છો. તમારામાંથી જુસ્સો ઓસરવા લાગે છે.” પરંતુ માણસ જો એમ માને કે હજુ તો મેં ભણવાની શરૂઆત જ કરી છે. હજુ તો મારે ભવિષ્યમાં કરવાનું ઘણું ઘણું બાકી છે અને જીવન તો અગણિત શક્યતાઓથી ભરપૂર છે, તો પછી ગમે તેટલાં વર્ષ થયાં હોય તોપણ તે યુવાન જ હોય છે. યુવાનીનો આધાર વર્ષોની સંખ્યા પર નથી, તેનો આધાર જીવનની પ્રગતિ ઉપર છે. શ્રીમાતાજી કહે છે, “પ્રગતિ એ જ યુવાની છે. સો વર્ષની વયે પણ મનુષ્ય યુવાન હોઈ શકે. એક સુખી અને કાર્યસિદ્ધ જીવન માટે માણસમાં સત્યનિષ્ઠા, વિનમ્રતા, જંત અને પ્રગતિ માટેની અદ્ય તરસ હોવાં જરૂરી છે. તમને ખાતરી થવી જોઈએ કે પ્રગતિ કરવી હોય તો એને માટેની શક્યતાઓનો કોઈ અંત જ નથી.” આથી શરીરની ઉમરનો વિચાર કર્યા વગર સતત પ્રવૃત્તિ કરનાર અને જીવનને પૂર્ણ બનાવવા માટે સતત પ્રયાસ કરનારને માટે હંમેશાં યુવાની હોય છે. પણ શરીરની શક્તિઓનું શું ? તે તો ક્ષીણ થતી જ રહે છે. આ શક્તિઓને પણ જાળવી શકાય છે. શ્રીમાતાજી કહે છે, “જો તમારી ઈચ્છા એવી હોય કે તમારું શરીર દગ્ધો ન હે અને તમને પ્રગતિમાં સાથ આપતું રહે તો તમારી શક્તિઓનો તમે વર્થુ ઉશ્કેરાટમાં બગાડ ન કરશો. તમે જે કંઈ કરતા હો તે એક શાંત ઠાવકાઈભરી રીતે કરો.”

માનવશરીર અપાર શક્તિઓથી બરેલું એક અદ્ભુત સ્વયંસંચાલિત યંત્ર છે. એની અદ્ભુતતા તો એ છે કે એને બનાવવનારો

કારીગર પાછો એ યંત્રમાં જ છુપાઈને બેઠેલો છે. જો એ કારીગરને શોધીને એના હાથમાં યંત્ર સોંપીને, એની ઈચ્છા પ્રમાણે ચલાવવા દેવામાં આવે તો યંત્ર બગડતું નથી. પણ એની અવધિ સુધી ઉત્તમ રીતે કામ આપતું રહે છે. કાર્યો દ્વારા તેનો આનંદ પ્રગટ થતો રહે છે. એ આનંદ છે પ્રગતિનો, પ્રાપ્તિનો અને તૃપ્તિનો.



“હરકોઈ માણસની એવી ઈચ્છા હોય છે કે તે સો વરસથી વધારે જીવે. જિંદગીના પ્રત્યેક વરસને તે દુઃખરહિત અને ચિંતારહિત બનાવવા ઈચ્છે છે. તે જિંદગી સુખમય અને આનંદમય બનાવવા ઈચ્છે છે. હરકોઈ માણસની જિંદગી તેની પોતાની મૂઢીમાં છે. તે કોઈ પણ સમયે પોતાની જિંદગી શરૂ કરી શકે છે. આ જીવન-ધનની સાચવણી તરફ આપણે બહુ જ ઓછું ધ્યાન આપીએ છીએ. આપણે ‘સો શરદ(જતુ)ની જિંદગી’થી આગળ વધીને સવાસો વરસ કે તેનાથી પણ વધારે આગળ વધવાનું છે. આપણી પાસે સારી તંદુરસ્તી અને સ્કૂર્ટિ હોય તો જ આપણો આટલા લાંબા જીવનનો હક મેળવી શકીએ છીએ.”

- પોલ સી. બ્રેગ

## પ્રાણશક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ

આપણાં બધાં કાર્યો શરીર દ્વારા થાય છે, પણ શરીર એ તો માત્ર સાધન છે. એ પોતાની મેળે કંઈ કરી શકતું નથી. એને કાર્યમાં પ્રેરનાર શક્તિની જરૂર રહે છે. જો એ શક્તિ ન હોય તો એ ઢગલાની જેમ પડ્યું રહે છે. શરીરને કાર્યમાં પ્રેરનારની શક્તિ છે એ પ્રાણશક્તિ છે. આ પ્રાણ અને આપણો આત્મા એ બંને એક નથી. આપણો આત્મા એ તો પરમાત્માનો અંશ છે. દિવ્ય તેજોમય સ્કુલ્પ્ટિંગ છે. જે આપણા સમગ્ર અસ્તિત્વનો સ્વામી છે. જે આપણા સૂક્ષ્મ હૃદયની ગુફામાં રહેલો છે અને અનેક પ્રકારનાં આવરણોથી ઢંકાયેલો છે. જ્યારે આ પ્રાણતત્વ એ સઘળાં પ્રાણીઓને કાર્યમાં પ્રેરતી શક્તિ છે. જેને પ્રાણમય પુરુષ પણ કહેવામાં આવે છે. આ પ્રાણતત્વમાં બળ, શક્તિ, ઉત્સાહ અને અસરકારક કિયાશક્તિ રહેલાં છે. ઈચ્છાઓ, લાલસાઓ, ભૂખો, આવેગો, ઈર્ષા, દ્રેષ, રાગ આ બધું પ્રાણતત્વમાં આવે છે. પ્રાણની લાક્ષણિકતા એ છે કે તેને કોઈ જ ચીજ સંતુષ્ટ કરી શકતી નથી. એની માગણીઓ સતત વધતી રહે છે. આથી જેમનામાં પ્રાણતત્વ પ્રબળ હોય તેવા મનુષ્યોને કદી સંતોષ મળતો નથી. આ સંદર્ભમાં ટોલ્સ્ટોયની એક વાર્તા છે કે એક માણસને એમ કહેવામાં આવ્યું કે સાંજ સુધીમાં જેટલી જમીન તેના પગ નીચેથી પસાર થઈ જશે, તેટલી તેની માલિકીની બની જશે. વધુ ને વધુ જમીન મેળવવા માટે તે દોડતો જ રહ્યો. આટલી વધારે, આટલી વધારે, એમ મેળવવાની લાલસામાં સાંજ સુધી દોડ્યો ને જ્યારે સૂર્યાસ્ત થયો ત્યારે જમીન પર પડ્યો ને મરી ગયો ત્યારે સાડા છ ફૂટ જમીન એને મળી !

આ વાર્તા પ્રતીકાત્મક છે. સત્તા, વૈભવ, સંપત્તિ મેળવવા માટે ચાલો, જીવનને આનંદમય બનાવીએ

માણસો દોડતા જ રહે છે પણ પછી એ બધું ભોગવવાનો સમય હોય છે ખરો ? પ્રારંભમાં બધું મેળવવાની દોટ હોય છે ત્યારે તો વિચારવાની પણ કુરસદ હોતી નથી. અને પછી શરીર સાથ આપતું નથી. આમ જીવનનો સાચો આનંદ માણસ મેળવી શકતો નથી. આ પ્રાણમય પુરુષમાં રહેલી પ્રચંડ ઈચ્છાઓ, જંખનાઓ, મહત્વાકંશાઓ, માણસને જરૂરિયાત હોય કે ન હોય, કાર્ય કરાવે જ જાય છે. પણ આ બધું શા માટે ? કોને માટે ? આથી એને અંતે મળશે શું ? આવા પ્રશ્નો પ્રાણપ્રધાન રજોગુણી સ્વભાવવાળા મનુષ્યોને ઉકૃતા નથી. કર્મના પ્રચંડ પ્રવાહમાં તેઓ તણાયે જતા હોય છે. જ્યારે તેમને ભાન થાય છે કે ‘આટલું બધું જીવનમાં કર્યું તોય સુખશાંતિ કેમ મળ્યાં નહીં ?’ પણ ત્યારે સમય ચાલ્યો ગયો હોય છે. આવી પરિસ્થિતિ ન સર્જય, પાછળથી પસ્તાવાનો સમય ન આવે તે માટે વ્યક્તિએ પ્રાણશક્તિને પણ કેળવવી પડે છે. પરંતુ શરીર ભૌતિક છે. તેને જોઈ શકાય છે. તેથી તેને કેળવવું, તાલીમ આપવી પ્રમાણમાં સહેલું છે. પ્રાણ તો સૂક્ષ્મ છે, જોઈ શકતો નથી તો એને કેવી રીતે તાલીમ આપવી ? કેવી રીતે નિયમનમાં રાખવો ? આ માટે મનુષ્યે સર્વપ્રથમ પોતાની અંદર જાગૃત બનવું જોઈએ અને પછી આત્મપ્રભુત્વ મેળવવું જોઈએ. આ કેવી રીતે કરી શકાય તે વિશે આપણે જોઈએ.

### સત્તમાન બનવું :

આપણે આપણા રોજિંદા જીવનનું નિરીક્ષણ કરીશું તો મોટેભાગે આપણે પંત્રવત્ત કાર્યો કરી નાંખતાં હોઈએ છીએ. આપણાં કાર્યોની પાછળ પ્રેરનાર બળો કયાં હોય છે, તેની આપણાને બિલકુલ ખબર હોતી નથી. કેટલાંક કાર્યો ટેવથી, કેટલાંક સામાજિક રૂઢિઓથી, કેટલાંક અન્યના દબાણથી, એમ આપણાં કાર્યો થતાં જ રહે છે. અને ઘણીવાર તો એવું પણ બને છે કે આપણે કોઈ કામ કરવું ન હોય તોય થઈ જાય છે. કંઈ બોલવું ન હોય તોય બોલાઈ જાય છે, અથવા બોલવું કંઈક હોય

ને બોલાઈ જાય છે બીજું, આવું કેમ થાય છે? અનું કારણ એ છે કે આપણે સભાન નથી હોતાં એટલે બહારનાં પરિબળો આપણી પાસે કાર્ય કરાવી જાય છે. શ્રીમાતાજી કહે છે, “મોટેભાગે માણસો પોતાના જીવન વિશે જાગૃત હોતા નથી. પોતે શું છે, પોતે શું કરી રહ્યો છે, શા માટે કરી રહ્યો છે, એની જાણ વગર જ માણસ અભાનપણે કાર્ય કરતો રહે છે અને એમ જ એનું જીવન પૂરું થઈ જતું હોય છે.”

માણસ પોતે તો એમ જ માને છે કે એ પોતે વિચારીને આ કાર્ય કરે છે. પણ વાસ્તવમાં એ વિચારો પણ એના હોતા નથી. તે તો પ્રકૃતિનાં બળોના હાથનું રમકું બની રહે છે. આ શક્તિઓ તેને જેમ દોરે છે, તેમ તે કાર્યમાં પ્રેરાતો હોય છે. આ વિશે શ્રીમાતાજી કહે છે, “ચેતનાની એક એવી અવસ્થા આવે છે, કે એમાં જાણો આખા જગતનો ભાર તમારા ઉપર બળજબરીથી લાદી દેવામાં આવેલો હોય છે. તમારી આંખો ઉપર ડાબલા પહેરાવવામાં આવ્યા હોય છે. અને તમે કયાં જઈ રહ્યા છો એ તમે જાણતા નથી, કઈ વસ્તુ તમને હડસેલી રહી છે, એ પણ તમે જાણતા નથી. આ અવસ્થા સાચે જ સુખદાયી હોતી નથી.” આમાં તો આપણે પ્રકૃતિની શક્તિઓના ગુલામ જ હોઈએ છીએ. તો પછી આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા શું કરવું?

આ માટે શ્રીમાતાજી સભાન બનવાનું કહે છે. તો પ્રશ્ન એ ઉઠે છે કે સભાન બનવું એટલે શું? સભાન બનવું એટલે આપણા સ્વરૂપને જાણવું. આપણા સ્વરૂપના અનેક અનેક ભાગો રહેલા છે, એના વિશે સભાન બનવું. આપણે શા માટે આ વસ્તુ કરીએ છીએ અને પેલી વસ્તુ કરતા નથી, એ જાણવું. આપણા વિચારોને, આપણી લાગણીઓને આપણાં કાર્યોને જાણવાં જોઈએ. આપણે શા કરી શકીએ છીએ તે જાણવું જોઈએ. પોતાના વિશે જાણવું જ પૂરતું નથી. પણ પછી એ જ્ઞાન દ્વારા આપણે આપણી જાત ઉપર કાબૂ મેળવવો જોઈએ.

જ્યારે આપણો આપણી જાતને ઓળખવાનો અને સભાન બનવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણાને ખબર પડે છે કે આપણે જેને આપણી માનીને વળગી રહ્યા છીએ, એમાંની કોઈ વસ્તુ આપણી નથી. બધી બહારના વાતાવરણમાંથી આપણી અંદર આવેલી છે. બહારના વાતાવરણમાંથી રોજેરોજ આપણા ઉપર કેટકેટલી વસ્તુઓ ફેંકતી જ રહે છે. શ્રીમાતાજી કહે છે, “આખું વાતાવરણ જેરથી ભરેલું છે. એમાં પ્રત્યેક શાસમાં તમે શંકા, અવિશ્વાસ, કોષ, હિંસા, ઈર્ષા વગેરેને તમારી અંદર લેતા હો છો. પરિણામે તમે જે નથી હોતાં, તે બની રહો છો. આમાંથી છૂટવા માટે અને પોતે જે છે, તે જ બની રહેવા માટે, અને પોતે જે ઈચ્છે તે જ કરી શકવા માટેનું એક જ સૂત્ર છે કે સભાન બનો અને તમારી જાતને જાણો.”

આ માટે આપણો આપણી જાતનું અવલોકન કરવું જોઈએ. તે માટે આપણી દસ્તિ સ્પષ્ટ હોવી જોઈએ. આપણો માર્ગ નિશ્ચિત હોવો જોઈએ. આપણે ક્યાં જઈએ છીએ, કેમ જઈએ છીએ, ત્યાં જઈને પછી આપણે શું કરવાનું છે, બીજાઓ સાથે આપણો શો સંબંધ છે, તે બધું જ આપણે જાગતા હોવા જોઈએ. શ્રીમાતાજી કહે છે, “પછી એક ક્ષણ એવી આવે છે કે જ્યારે તમે ટક્કાર ઉભા રહો છો, ઉપર શું છે તે તમે જોઈ શકો છો, તદ્વપ્ત થઈ શકો છો, જગત પ્રત્યે જાણો તમે કોઈ અનંત ઊંચાઈવાળા શિખર પરથી નીચે જોતા હો એમ જોઈ શકો છો. તમે તમારો માર્ગ પસંદ કરો છો, અને તેને અનુસરો છો. આ એક સુખદાયી અવસ્થા છે અને એના માટે તો તમે પૃથ્વી ઉપર છો.”

આપણો આપણી જાતનું સતત અવલોકન કર્ય રીતે કરી શકીએ? સતત જગૃત કર્ય રીતે રહી શકાય? આ વિશે માર્ગદર્શન આપતાં શ્રીમાતાજી કહે છે, “એ માટે તમારી પાસે દરેક સ્થળે એન્ટેનાઓ હોવા જોઈએ. જે તમારી સાચી ચેતનાના કેન્દ્રની સાથે તમને સતત સંપર્કમાં

રાખે. એમાં તમે દરેક વસ્તુની નોંધ લેતા રહો છો. દરેક વસ્તુને સંગઠિત કરતા રહો છો. આ રીતે તમને કોઈ અસાવધ દશામાં પકડી શકતું નથી. કે તમે છેતરાઈ જતાં નથી. એમાં તમારે જે કહેવું હોય, એથી બીજી કોઈ વસ્તુ કહેતા નથી. પણ કેટલા માણસો આવી સ્થિતિમાં હોય છે ભલા? હું જ્યારે સભાન બનવાનું કહું છું ત્યારે મારે બરાબર આ જ વાત કહેવી છે. તમારી આસપાસ જે પરિસ્થિતિ અને સંજોગો હોય તેમાંથી તમારે વધુમાં વધુ લાભ મેળવવો હોય તો તમારે પૂરેપૂરા જાગૃત રહેવું જોઈએ. તમને કોઈ અચાનક ઝડપી લે તેમ ન થવું જોઈએ.

સભાન બનવા માટે શ્રીમાતાજીએ એક નાનકી કસરત આપી છે કે દિવસના આરંભમાં તમે એમ કહો કે ‘હું જે કંઈ બોલીશ તે વિચાર કર્યા વગર બોલીશ નહીં.’ પછી આખો દિવસ અને અનુસરો ત્યારે તમને અનુભવ થશે કે મોટેભાગે તમે જે બોલવા ઈચ્છતા નથી એવા જ શબ્દો બહાર આવવા માટે તૈયાર થઈને બેઠેલા હોય છે. એક બે દિવસમાં કંઈ આમાં સફળતા મળતી નથી. પણ રોજેરોજ આનો અભ્યાસ કરતા રહેવાથી પછી વાળી ઉપર પ્રભુત્વ આવે છે અને પછી તો આપણા મુખમાંથી આપણી ઈચ્છા વગર એક પણ શબ્દ બહાર નીકળી શકતો નથી. આ જ રીતે આપણે આપણી લાગણીઓ, આવેગો અને વૃત્તિઓ ઉપર પ્રભુત્વ મેળવી શકીએ છીએ. તો સભાનતા પછી પ્રાણશક્તિની તાલીમનું બીજું સોપાન છે, આત્મપ્રભુત્વ.

### આત્મપ્રભુત્વ :

આત્મપ્રભુત્વ એટલે આપણે આપણી જાતના સ્વામી હોવું. આપણી જાતના સ્વામી ત્યારે જ બની શકાય કે જ્યારે આપણે આપણા અંદરના સ્વામી એવા આત્મા સાથે એકરૂપ હોઈએ. આત્મસભાનતા વગર આત્મપ્રભુત્વ આવી શકતું નથી. આત્મપ્રભુત્વ વગર વૃત્તિઓ પર નિયંત્રણ પણ આવી શકતું નથી. વાતવાતમાં ઉશ્કેરાઈ જનારા પોતાનાં ચાલો, જીવનને આનંદમય બનાવીએ

આવેગો અને વૃત્તિઓ ઉપર કાબૂ નહીં રાખી શકનારા મનુષ્યો દુર્ભળ હોય છે. બહારના નાના નાના બનાવો પણ તેમને કૃષ્ણ કરી દેતા હોય છે. એમનાં જીવન ખરાબે ચેતલાં વહાણ જેવાં હોય છે. જે પ્રમાણેનો પવન કુંકાય એ હિશામાં ઘસડાયે જતાં હોય છે. એમાં શાંતિ હોતી નથી. સ્થિરતા કે સલામતી પણ હોતી નથી. પોતાને ખળખળાવનાર વૃત્તિઓ અને આવેગોને વશમાં લીધા વગર કઈ રીતે અંકુશમાં રાખવા ?

સર્વ પ્રથમ, તો વ્યક્તિને પોતાના સ્વભાવની કઈ કઈ ખામીઓ છે, તેની જાગ હોવી જોઈએ. એ પછી એ નબળાઈને દૂર કરવા જગૃતપણે પ્રયત્ન શરૂ કરી દેવો જોઈએ. ધારો કે, કોઈ વ્યક્તિમાં ગુસ્સાની લાગણી વારંવાર ઊઠ્યા કરે છે. અને તે કોધના આવેગમાં ન બોલવાનું બોલી નાંખે છે. પાછળથી આ આવેગ શરીર જતાં તેને પસ્તાવો પણ થાય છે. પણ દરેક વખતે ઈચ્છવા છતાં ગુસ્સો તેના કાબૂમાં રહેતો નથી. તો શું કરવું ? એક રસ્તો એ છે કે એને દબાવી દેવો. કોઈપણ સંજોગોમાં પ્રગટ ન કરવો. એ સ્થળ છોડીને ચાલ્યા જવું. આથી તત્કષણ ગુસ્સો કાબૂમાં તો આવી જશે. પણ એથી બીજી પરિસ્થિતિમાં દબાવી રાખેલો ગુસ્સો બમણા વેગથી પ્રગટ થશે અને પરાણો બાંધેલી સંયમની પાળ આ ધસમસતા પૂરમાં ક્યાંય વહી જશે. વૃત્તિઓ અને આવેગો ઉપર દમન કર્યું, નિયંત્રણ મૂક્યું, એથી પ્રભુત્વ આવતું નથી. પ્રભુત્વ મેળવવા માટે જ્ઞાન જરૂરી છે. ગુસ્સાવાળો માણસ વારંવાર પોતાની જાતને કહેતો રહે કે આ ગુસ્સાથી સામા માણસને તો કંઈ થતું નથી. એ સાંભળી લે છે, અને કોને ખબર કદાચ સાંભળતો પણ ન હોય, અને મનમાં મનમાં એમ કહેતો હોય કે ‘ભલેને બબડાટ કરે એમાં મારે શું ?’ અને ‘સાચી વાત છે, એમાં એને શું ?’ નુકસાન તો મને જ થાય છે. પછી આખો હિવસ મારું મન બગડેલું રહે છે. હું ઉશ્કેરાટમાં રહું છું. એની અસર મારાં પત્ની ને બાળકો પર પણ થાય છે. તેઓ બિચારાં ફંડતાં

રહે છે. મારું કામ પણ સારી રીતે થતું નથી. આવો ગુર્સો મને કોઈ રીતે ફાયદાકારક નથી. આવી સમજણ જાગૃત થાય એટલે ગુર્સાનો પ્રભાવ ઓછો થઈ જાય છે. અને પછી એનું જોર રહેતું નથી. અને પછી તે વ્યક્તિ ગુર્સા ઉપર વિજય મેળવી લે છે. આમ સમજણ અને જ્ઞાનથી પ્રભુત્વ મેળવી શકાય છે. દમનથી નહીં. દરેક વૃત્તિઓ અને આવેગો ઉપર આ રીતે જ્ઞાનદંસ્થી કામ કરવાથી ચોક્કસ પરિણામ આવે જ છે.

પ્રભુત્વ મેળવવાનો બીજો અસરકારક માર્ગ છે, ચેતનામાં ઉપર ચડવાનો. આવેગો અને વૃત્તિઓથી ભરેલી આપણી નિમ્ન પ્રાણમય ચેતના છે, તેમાં ને તેમાં જ જો રહીએ તો ક્યારેય પ્રભુત્વ મળી શકતું નથી. પણ એ ચેતનામાંથી ઉપર ઊઠીએ અને ઊર્ધ્વચેતનામાં પહોંચીએ તો આ બધી વૃત્તિઓની અસર થતી નથી. સામાન્ય રીતે પણ આપણે જેમ જેમ ઉપર ચડીએ છીએ, પર્વત ઉપર જઈએ તો નીચેની વસ્તુઓ નાની અને નાની બનતી જાય છે અને પછી તો તે દેખાતી જ નથી. એમ ચેતનામાં ઊંચે ચડતા નિમ્ન ભૂમિકાની વસ્તુઓ છૂટતી જાય છે. અને પછી તો તે સ્પર્શી પણ શકતી નથી. આમ કૂટેવો, નિમ્ન આવેગો અને વૃત્તિઓમાંથી છૂટવાનો અસરકારક ઉપાય છે ‘ચેતનામાં ઊંચે ચડવું’ આથી જે પ્રભુત્વ મળે છે, તે હંમેશ માટેનું હોય છે. કેમ કે ચેતનાનો સ્તર જ બદલાઈ ગયો હોય છે. એમાં દમનની કે પરાણે સંયમની આવશ્યકતા જ રહેતી નથી.

જેમણે પોતાના પ્રાણમય સ્વરૂપ ઉપર પ્રભુત્વ મેળવી લીધું હોય છે, તેઓ જ પોતાના અંતરમાં શાંત અને સુસ્થિર રહી શકે છે. પછી બહારનાં પરિબળો તેને ચલિત કરી શકતાં નથી. તેની આંતરિક સ્વસ્થતાને કોઈ લેદી શકતું નથી. આવી વ્યક્તિ એક પણ શર્ષના આદાનપ્રદાન વગર પોતાની આસપાસના વાતાવરણ ઉપર પોતાનો પ્રભાવ પાડી શકે છે. અશાંત વાતાવરણને તે શાંત અને સ્થિર કરી શકે

છે. વિક્ષુબ્ધ હૃદયોને સ્થિરતા આપી શકે છે. અન્યના કોધને દૂર કરી તેમાં શાંતિ સ્થાપી શકે છે. એ જ રીતે દુઃખને સ્થાને આનંદને મૂકી શકે છે. શ્રીમાતાજી કહે છે કે “એવા તો બહુ જ ઓછા લોકો હોય છે કે જેઓ પોતાની સાથે શાંતિને, આનંદને અને વિશ્વાસને પ્રસરાવતાં વાતાવરણને લઈ જતાં હોય છે. બહુ જ ઓછા પણ તેઓ જ સાચી રીતે માનવજીતનું કલ્યાણ કરનારા લોકો છે અને તેમને પોતાનું મોં ખોલવાની કોઈ જ જરૂર પડતી નથી. કેમ કે તેઓ પોતાના જીવનની પ્રત્યેક પળે પોતાના વિશે અને આસપાસના વાતાવરણ વિશે સભાન હોય છે.”

આ રીતે સભાન બનીને, આપણા જીવનના સ્વામી બનીને, આપણે આપણા જીવનને જ નહીં પણ આપણા સંપર્કમાં આવનાર સર્વના જીવનને આનંદથી ભરી દઈ શકીએ છીએ.



“તમારી ચેતનાને તમારા હૃદયના કેન્દ્રમાં એકાગ્ર કરો. તમારા હૃદયની અંદર ઉત્તરો. એમાં જેટલા જવાય તેટલા ઊંડા ઉત્તરો. જ્યાં સુધી જઈ શકો ત્યાં સુધી એમાં ડૂબકી મારો. ચારે બાજુ પ્રસરી રહેલી તમારી ચેતનાને એકાગ્ર કરો. અને પછી તમારા અંતરાત્માની નીરવતામાં ભૂસકો મારો. એમાં ડૂબી જાઓ. ત્યાં અંતરના ઊંડાણની ગહન શાંતિમાં એક અઞ્જિ ચેતે છે અને તે અઞ્જિ એ જ તમારી અંદર રહેલો ભગવાનનો દિવ્ય અંશ અને તે જ છે ચૈત્યપુરુષ. તેનો સાદ સાંભળો અને તેના આદેશને અનુસરો.”

- શ્રીમાતાજી

## મનબી શક્તિ અને તેનો ઉપયોગ

ભૌતિક શરીરને પ્રાણશક્તિ પછી કાર્યમાં પ્રેરનારું મહત્વનું સાધન તે મન છે. અત્યારની આપણી મનોમય ચેતનાની સ્થિતિ છે, તેમાં મન એ સર્વોપરી સાધન છે. આપણે મનુષ્યો મનથી પ્રેરાતા પ્રાણીઓ છીએ. પ્રાણશક્તિ કરતાં મનની શક્તિ ઊંચી છે. પણ તેમ છતાં એ પૂર્ણ નથી. મન હકીકતોને લેગી કરીને ટુકડે ટુકડે જ્ઞાન મેળવે છે. પણ એ જ્ઞાન પૂર્ણ હોતું નથી. મન પોતે જ અજ્ઞાનને આધીન હોઈને એ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરે છે, પણ સત્યનું પૂર્ણ દર્શન કરી શકતું નથી. જ્ઞાન કદી મનમાં પ્રગટ થતું નથી. અલબત્ત, મન જ્ઞાનવાની કોણિશ કરે છે. તેમાં જ્ઞાનવાની જિજ્ઞાસાવૃત્તિ છે. પણ એ માત્ર ઉપરછલું, સપાઠી પરનું જ્ઞાન, એ પણ આંશિક રૂપે જ જ્ઞાણી શકે છે. ખરું જ્ઞાન મનમાં નહીં પણ હૃદયમાં પ્રગટે છે અને તે વિચારોમાં નહીં પણ સીધા દર્શનમાં પ્રગટે છે અથવા તો સ્વયં સ્કુરિત થાય છે.

મનની પ્રકૃતિ ચંચળ છે. તે સહેલાઈથી સ્થિર થઈ શકતું નથી. એક ક્ષાણ પણ શાંત રહી શકતું નથી. અહીંથી તહીં ભટક્યા જ કરતું હોય છે. મનમાં વિચારોની આવન જાવન તો સતત ચાલુ જ હોય છે. વિચારો તો જાણે સમુદ્રમાંથી ઊઠતાં અનંત મોજાંઓ. ક્યાંથી આવતો હશે આ બધા વિચારો? ઘણ્ણીવખત તો એકબીજા વિચારોને કોઈ જ સંબંધ હોતો નથી એવા એવા વિચારો મનમાં આવતા હોય છે. શ્રીમાતાજી કહે છે કે “આ બધા વિચારો મનોમય સૂક્ષ્મ વાતાવરણમાંથી આવે છે. આ વાતાવરણ વિચારોનું જ ભરેલું છે. એમાં અસંખ્ય વિચારો ઘૂમતા હોય છે. રસ્તામાં આપણે જતાં હોઈએ અને જેમ માણસો મળે તેમ માર્ગમાં ભ્રમણ કરી રહેલા વિચારોમાંથી કેટલાક વિચારો આપણા મગજમાં

પ્રવેશી જાય છે. પણ આપણે જાગૃત નથી હોતાં એટલે બહારથી વિચારો આપણી અંદર પ્રવેશે છે, તેની ખબર પડતી નથી. માણસનું મન ચોરા જેવું છે. જેમાં અનેક પ્રકારના લોકો આવતા - જતા હોય છે. વિચારોનું પણ એવું જ છે. એમાં અનેક વિચારો આવતા - જતા હોય છે. આમાં વિચારોને એકબીજા સાથે કોઈ સંબંધ હોતો નથી. માથામેળ વગરના વિચારો મગજમાં અથડાતા રહે છે અને મગજમાં અશાંતિ ઊભી કરી દે છે.”

માણસના મનમાં અનેક પ્રકારના વિરોધી વિચારો પણ રહેલા હોય છે. તેમનું મન ધૂંધળું અને અસ્પષ્ટ હોય છે. એમાં વસ્તુઓ વિશેની ધૂંધળી છાપ હોય છે. કોઈ સ્પષ્ટ દર્શન હોતું નથી. આવું મન કોઈ ચોક્કસ વિષય પર સ્પષ્ટ વિચાર કરી શકતું નથી. શ્રીમાતાજી આવા મનવાળા લોકોને રેશમ જેવા પોચા લોકો કહે છે. તેઓ નિશ્ચિત વિચાર કરી શકતા નથી. તેમના જીવનમાં જો કોઈ નાની સરખી મુશ્કેલી આવે તોપણ તેઓ ગલ્બરાઈ જાય છે. અને બેબાકળા બની આમતેમ દોડાદોડી કરી મૂકે છે. તેમની ચેતના વિભરાયેલી હોય છે. શ્રીમાતાજી કહે છે તેમ તેમના મનમાં અનેક કરોળિયાઓ દોડાદોડ કરતા હોય છે. તેથી તેઓ કોઈપણ પ્રશ્નનો ઉકેલ મેળવી શકતા નથી. આવા લોકોનું આખું જીવન અનિશ્ચિતતામાં - દ્વિધામાં વીતતું હોય છે.

આપણા મનનું જો આપણે નિરીક્ષણ કરીએ તો આપણને ત્રાસ થઈ જાય તેવી ધમાચકડી મનમાં ચાલતી હોય છે. આ વિશે શ્રીમાતાજીએ જણાવું હતું કે “તમારા મગજમાં જે ચાલતું હોય એની તમને યાદ આવે તોપણ ત્રાસ થઈ જાય તેવું હોય છે. બધા વિચારો તમારા મગજમાં એક સાથે અથડાતા હોય છે. નાચતા, કૂદતા, રાસડા લેતા હોય છે. એ તો પાગલખાના જેવું હોય છે. જાણો તમે એકસાથે બધી બાજુએ દડા ફેંકી રહ્યા હોય તેવું હોય છે.” આવા મનમાં શાંતિ ક્યાંથી હોય? મગજમાં

સતત ભટકતા વિચારોથી થાક લાગે છે. મગજ ચકાવે ચડી જાય છે. ભમી જાય છે. ગુંચવાડો ઊભો થાય છે. અવ્યવસ્થા સર્જાય છે. પોતાના અંતરમાં અને બહાર પણ એથી વિસંવાદ ઊભો થાય છે. અને તેની અસર શરીર પર પડે છે. શરીર અસ્વસ્થ બને છે. તેમાં પછી રોગ પ્રવેશી જાય છે. એટલે જ શરીરની તંદુરસ્તીનો આધાર મન પર રહેલો છે, એમ કહેવામાં આવે છે. શ્રીમાતાજી કહે છે, “આ શરીરનો - ભૌતિક સ્વરૂપનો સ્વામી મન છે. શરીર તો બિચારું નથી અને આજ્ઞાપાલક સેવક છે. પણ લોકોને મનનો સહૃપયોગ કરતાં આવડતું નથી. તેનો દુરૂપયોગ જ કરતાં રહે છે અને તેથી શરીર માંદું પડે છે.”

અત્યારની આપણી સ્થિતિમાં મન રાજા તો છે પણ એક ગંડુ રાજા જેવો છે. ઘડીકમાં રીજે અને ઘડીકમાં ખીજે, તેનું કંઈ જ ઠેકાણું નથી. કઈ પરિસ્થિતિમાં ક્યારે કેમ વર્તશે તેની પણ ખબર પડતી નથી. આવા અસ્થિર અને અજ્ઞાની રાજાના હુકમનું પાલન કરતાં કરતાં આપણું આખું જીવન ખલાસ થઈ જાય છે, તોય આનંદ મળતો નથી. ને શાંતિની તો વાત જ થઈ શકતી નથી. તો પછી કરવું શું ? બળવો પોકારવો ? નાસી જવું ? મનને મારી નાંખવું ? આમાંનું કંઈ આપણે કરી શકીએ તેમ નથી. કારણ કે અત્યારની કક્ષામાં મન વગર આપણને ચાલવાનું નથી. મનની સામે બળવો પોકારવાથી તો મન વધારે ઉંડ થશે. નાસી જવાથી, મન જ્યાં જઈશું ત્યાં એવું ને એવું જ બેગું આવશે. અને તેને મારી નાંખવાથી તે કંઈ મરતું નથી પણ તે જડ જેવું થઈ જાય છે અને તેથી જીવનના રસ કસ ઊરી જાય છે. આથી એક જ રસ્તો છે કે મનને કેળવવું. તેને પદ્ધતિસરની તાલીમ આપવી. નિયમિત તાલીમથી સિંહવાધ જેવાં ડિસ્ક પશુઓ પણ સરકસમાં પાળેલાં પ્રાણીઓની જેમ કામ આપે છે. એ જ રીતે મનને નિયમિત એકધારી તાલીમ આપવાથી તે શિસ્તબદ્ધ બને છે. તેની શક્તિઓ એકાગ્ર બનતાં તે ઘણાં ઉમદાં કાર્યો

કરી શકે છે. સ્વામી વિવેકાનંદ આ સંદર્ભમાં કહે છે, “અનિયંત્રિત અને અવ્યવસ્થિત મન આપણને હંમેશાં નીચે ને નીચે જ ખેંચશે, આપણને ચારી નાંખશે. મારી નાંખશે, જ્યારે નિયંત્રિત અને વ્યવસ્થિત મન આપણો ઉદ્ધાર કરશે. આપણને મુક્ત બનાવશે.” આમ આપણી સ્થિતિનો, ગતિનો, શક્તિનો અને મુક્તિનો આધાર આપણું મન છે. જેવું આપણું મન હશે, તેવું આપણું જીવન બનશે. આથી જીવનને ઉત્કૃષ્ટ બનાવવું હોય તો સર્વપ્રથમ મન ઉપર ધ્યાન આપવું જોઈએ. મનની તાલીમમાં જે મહત્વની પાંચ બાબતો છે, તે હવે આપણે જોઈએ.

### મનને જાણવું :

સર્વપ્રથમ તો આપણને મન શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે, તેનું પ્રાથમિક જ્ઞાન હોવું જરૂરી છે. જો મનની જ ખબર ન હોય તો તેને કેવી રીતે ઘડી શકાય? મનની પ્રકૃતિ, તેની કાર્ય કરવાની રીત, તેના મિજાજો, વિચારો, ઘ્યાલો, તેની લાક્ષણિકતાઓ આ બધાંની જાણકારી મેળવી લેવી જોઈએ. આના માટે કંઈ મનોવિજ્ઞાનનાં મોટાં મોટાં પુસ્તકો વાંચવાની કે મનોવૈજ્ઞાનિકો પાસે અભ્યાસ કરવાની જરૂર નથી. જરૂર છે ફક્ત શાંત બનીને આપણા મનને જોવાની. તેનું અવલોકન કરવાની. તે કઈ રીતે વર્તે છે તેનું તટસ્થતાપૂર્વક નિરીક્ષણ કરવાનું છે, પણ શરૂઆતમાં આ પણ ભારે મુશ્કેલ લાગે છે. મન વારંવાર છટકી જાય છે. એટલે પછી વક્તિ કંટાળીને છોડી હેઠળ પણ ચંચળ મનની છટપટવાની વૃત્તિથી ગભરાવાની જરૂર નથી. એ ભલે છટકે અથવા તેને જ્યાં બ્રમજા કરવું હોય ત્યાં કરતું રહે, પણ આપણે તેને શાંતિપૂર્વક જોવા કરવાનું છે. થોડા દિવસ એકધારું નિયમિત રીતે આમ કરવાથી મન શાંત થઈ જશે. પછી એ શાંત મનમાં મનની પ્રકૃતિ અને તેની કાર્યપદ્ધતિ આપોઆપ સમજાવા લાગશે. એકવાર મનને જોતાં આવડી ગયું, એટલે મનનું અડધું જોર તો ઓછું થઈ જાય છે. અને પછી મન શાંત અને સ્થિર

થવા લાગે છે.

## મનનો વિકાસ કરવો :

મનને જાણ્યા પછી તેને એવું ન રહેવા દેવાનું નથી. એનો વિકાસ કરવાનો છે. શ્રીમાતાજી ચિત્તવિકાસને મનની કેળવણીનું અગત્યનું પાસું ગણાવે છે. અત્યારે આપણું વૈયક્તિક મન સીમિત છે. તેના વિચારો મર્યાદિત છે. તે જડ માન્યતાઓમાં, સમાજનાં રીતરિવાજોના ચોકઠામાં, રૂઢિઓના બંધનમાં, કૌટુંબિક પ્રણાલીઓમાં પણ સીમિત છે. પણ વાસ્તવમાં આપણું મન ખરેખર નાનકું નથી. એ તો વૈશ્વિક મનનો એક ભાગ છે. તેથી તે અસીમ છે. જો આપણો આપણા વૈયક્તિક મનને તેણે માની લીધેલા મર્યાદિત સ્વરૂપમાંથી બહાર કાઢીને તેના વૈશ્વિક સ્વરૂપ સાથે જોડી શકીએ તો પછી મનને કોઈ મર્યાદા રહેતી નથી. પરંતુ એ માટે નિયમિત ધ્યાન કરવું જરૂરી છે. આ ઉપરાંત મનના વિકાસ માટે પૌષ્ટિક ખોરાકની પણ જરૂર રહે છે. જેમ શરીરને આપણે પૌષ્ટિક ખોરાક આપી બળવાન બનાવી શકીએ છીએ એમ મનને પણ સુગ્રાવ્ય, સાત્ત્વિક ખોરાકની જરૂર રહે છે. અને તે ખોરાક સત્તસંગ, સદ્ગુરૂ, વાંચન, મનન અને ચિંતન દ્વારા મળે છે. પરંતુ શરીરને આપણે રોજેરોજ બેધી ત્રણ વખત ખોરાક આપીએ છીએ અને વચ્ચમાં વચ્ચમાં ચાપાણી ને નાસ્તો પણ આપતાં રહીએ છીએ. આવી રીતે મનને ખોરાક આપીએ છીએ ખરાં ? બહુ જ ઓછા લોકો આ રીતે પોતાના મનને રોજેરોજ સાત્ત્વિક પોષણ આપતા હોય છે. તેવા લોકોના મન ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચલિત ન બને તેવા સુદૃઢ બની જાય છે. પણ સત્ત્વશીલ ખોરાકથી વંચિત મન પોતે જ દુર્બળ હોઈને જરા અમસ્તી મુશ્કેલીથી ભાંગી પડે છે.

આમ, મનના વિકાસ માટે સત્તસંગ અને સદ્ગુરૂ, વાંચન ખૂબ જ જરૂરી છે. પણ ફક્ત સત્તસંગ કે સદ્ગુરૂ, વાંચન કરવાથી પણ કંઈ વળતું નથી.

ચાલો, અવનને આનંદમય બનાવીએ

એમ તો કેટલાય લોકો મંદિરોમાં કથા સાંભળવા જાય છે. સારાં પુસ્તકો પણ વાંચતા હોય છે. પણ એની અસર બહુ બહુ તો બેચાર દિવસ રહે છે, પછી તેઓ જે કરતા હતા તે જ કરવા લાગે છે. મન બદલાતું નથી. પ્રકૃતિ બદલાતી નથી. જીવનમાં પરિવર્તન આવતું નથી. એને માટે તો સત્સંગનાં વચ્ચેનો કે સદ્ગુરુનાં વાક્યોને મનમાં ધારણા કરવાં જોઈએ. તેનું વારંવાર ચિંતન કરવું જોઈએ. તેના ઉપર જીવનનું ઘડતર કરવું જોઈએ. સંતો કે શાસ્ત્રોનાં બે ચાર વાક્યો પણ જીવનમાં ઊતરી જાય અને તે પ્રમાણે જીવાય તો સમગ્ર જીવનને ઊંચે ઉઠાવવા માટે તે પર્યાપ્ત બને છે. એકવાર મનને પરિસ્થિતિ સમજાઈ જાય છે, પછી તે બહુ ઉત્પાત કરતું નથી. મનમાં શાંતિ રહેતાં ગમે તેવી જટિલ સમસ્યા પણ ઉકેલી શકાય છે.

જેમ જેમ મનનો વિકાસ થતો જાય છે, તેમ તેમ તે વિશાળ બને છે. આવા મનને પછી બાધ બનાવો ક્ષુબ્ધ કરી શકતાં નથી. મન વિશાળ થતાં ઊડી સમજ આવે છે. મનમાં પ્રકાશની અનુભૂતિ થાય છે. એટલે પહેલાં જે નહોતું સમજાતું તે સમજાવા લાગે છે. પહેલાં જે નહોતું દેખાતું તે દેખાવા લાગે છે. પહેલાં જે સમસ્યાઓ વિષમ લાગતી હતી, તે હવે વિષમ લાગતી નથી. પહેલાં પીડાદાયક લાગતી બાબતો હવે ધ્યાન આપવા જેવી જ લાગતી નથી. જીવન અને જગત પ્રત્યેની દસ્તિ બદલાઈ જાય છે. હવે ચિંતા, ઉપાધિ, ઉચાટ રહેતાં નથી. પણ એક સ્વસ્થ શાંતિનો અનુભવ થાય છે. આમ, મનની સમસ્યાઓના ઉકેલનો એક જ રસ્તો છે મનને વિશાળ કરવાનો. મનને વિશાળ કરવા માટેનો ઉપાય છે ધ્યાન અને એકાગ્રતા કરવી.

### ધ્યાન અને એકાગ્રતા :

ચારે બાજુ ભટકતા મનને કોઈ એક વિષય, વસ્તુ કે વ્યક્તિ ઉપર

કેન્દ્રિત કરવું એનું નામ છે ધ્યાન. પણ વાંદરાની જેમ કુદાકૂદ કરતાં ચંચળ મનને કોઈ એક વિષય પર એકાગ્ર કરવું ખૂબ જ મુશ્કેલ છે. સામાન્ય રીતે જ્યારે માણસ કોઈ એક વિષય પર એકાગ્રતા કરવાનો પ્રયત્ન કરે ત્યારે ન જાણે ક્યાંયથી અસંખ્ય વિચારોનાં ટોળેટોળાં એના ઉપર સવાર થઈ જાય છે અથવા તે સમયે જ તેને બીજાં અગત્યનાં કામો યાદ આવે છે અને તેની એકાગ્રતા ક્યાંય તૂટી જાય છે. અને જો તે મનમાંથી વિચારોને હાંકી કાઢવાનો પ્રયત્ન કરે તો તો તે થાકી જ જાય છે. કેમ કે વિચારો તો એક પછી એક આવ્યા જ કરતા હોય છે. અને મન એ રીતે કદી ખાલી થતું નથી. ઊલટાનું વધારે પ્રમાણમાં વિચારો આવતાં માણસ થાકી, કંટાળીને ધ્યાનનો પ્રયત્ન જ છોડી દે છે.

પરંતુ શરૂઆતમાં દરેકને આવો અનુભવ થતો હોય છે. કેમ કે મન પોતે જ ચંચળ છે. છટપટવું એ એનો સ્વભાવ છે. એ કેવી રીતે એક વસ્તુ પર એકાગ્ર બની શકે? પણ જો પ્રયત્ન જ ન કરીએ, તો તો પછી મન ક્યારેય એકાગ્ર નહીં બની શકે. એટલે પ્રયત્ન તો કરવો જ જોઈએ અને એ પ્રયત્નમાં શરૂઆતમાં ભલે જરા પણ સફળતા મળતી ન જણાય તો પણ ચાલુ જ રાખવો જોઈએ. જેના પર ધ્યાન કરવાનું છે, અથવા તો જે વિષય પર એકાગ્રતા કરવાની છે, એના પર જેવું થાય તેવું ધ્યાન કે એકાગ્રતા કરતા રહેવી. વિચારો આવે તો ભલે આવે, એના ગ્રત્યે બિલકુલ ધ્યાન દેવાનું નહીં, એ તો આવતા રહે ને જતા રહે. આમ કરવાથી તોફાની બાળકની જેમ મનને પણ એવું સ્પષ્ટપણે સમજાઈ જાય છે કે અહીં હવે છટપટ કરવાથી ચાલશે નહીં એટલે પછી તે શાંત થવા લાગે છે. શાંત મન કોઈપણ બાબતમાં બહુ ઝડપથી એકાગ્ર થઈ શકે છે. મન જો એકવાર શાંત બની જાય તો પછી તે કોઈપણ પરિસ્થિતિમાં શાંત રહી શકે છે. તેની શાંતિ તે ગુમાવતું નથી. પણ આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે રોજેરોજ નિયમિત રીતે મનને એકાગ્ર કરવાનો

પ્રયત્ન કરતા રહેવો જરૂરી છે.

આ પ્રયત્ન માણસ ત્યારે જ કરી શકે કે જ્યારે તેણે આ માટે પ્રબળ સંકલ્પ કર્યો હોય. માણસને અંદરથી એમ થવું જોઈએ કે હવે આ મનની દોડધામ બંધ થવી જ જોઈએ. આનાથી તો હવે ત્રાસી ગયા છીએ. હવે તો હદ થઈ ગઈ. મનની દખલ હવે ચલાવી શકાય તેમ નથી. ત્યારે માણસના અંતરમાંથી મનની શાંતિ પ્રાપ્ત કરવાની સાચી ઝંખના ઊઠે છે અને પછી પ્રયત્ન કરવાથી તે મેળવી શકે છે. આ વિશે માર્ગદર્શન આપતાં શ્રીમાતાજી કહે છે, “એ પછી ઘોંધાટ કરનારા માણસોને તેમે કહો છો, તેમ જ્યારે તમારું મન તમને અનેક સૂચનો આપતું હોય, ત્યારે તમારે તેને કહેવું જોઈએ, ‘શાંત રહે. શાંતિ રાખ.’ મનની વાત તમારે બિલકુલ સાંભળવી ન જોઈએ. છતાં તે બહુ ઘોંધાટ કરે તો કરડાકીથી કહી દેવું કે ‘ચૂપ રહે, શાંત થા.’ પણ તમારે એની સાથે ઘોંધાટ કરવો નહીં.” બહુ તોફાન કરતા બાળકની આપણે જેમ ઉપેક્ષા કરીએ છીએ, તેવી જ રીતે આપણે અશાંતિ ઊભી કરતા આપણા મનની ઉપેક્ષા કરવાની છે. પણ જો તેના વિચારો પ્રત્યે ધ્યાન આપ્યું કે ઝઘડો કર્યો તો તે બમણા જોરથી ફૂદકા મારશે. આથી પ્રથમ ઉપાય છે ઉપેક્ષા કરવાનો.

બીજો ઉપાય બતાવતાં શ્રીમાતાજી કહે છે, “તમે તમારી ચેતનાને સામાન્ય મનથી ઉપરના પ્રદેશમાં ઉઠાવી દો તો પ્રકાશ પ્રત્યે તમારું મન ખુલ્લું થતાં એ પ્રકાશ તમારા મનને શાંત કરી દે છે. પછી એ દોડધામ કરતું નથી.” આમ, બીજો ઉપાય ચેતનામાં ઊંચે ચડીને પ્રકાશ પ્રત્યે મનને ખુલ્લું કરવાનો છે.

ત્રીજો ઉપાય જેમાં મનને એકાગ્ર કરવાનું છે, તેમાં રસ જાગૃત કરવાનો છે. જે કાર્યમાં રસ અને રૂચિ હોય તો તેમાં એકાગ્રતા આપોઆપ આવે છે. છિમાલય પરનું ચડાણ કેટલું મુશ્કેલ અને ખતરનાક હોય છે. તેમાં કેટલી બધી એકાગ્રતા અને ચોકસાઈ રાખવી

પડતી હોય છે. પરંતુ જેમને એવરેસ્ટ શિબર સર કરવામાં રસ છે, તેમને આ કાર્યમાં મુશ્કેલી જણાતી નથી કે તેમની એકાગ્રતાનો ભંગ થતો નથી. આમ, જો કાર્ય કે વિષયમાં રસ જાગૃત કરવામાં આવે તો એકાગ્રતા જરા પણ મુશ્કેલ નથી. પરંતુ મનને બધી જ બાબતોમાં રસ હોતો નથી. એટલે તે એકાગ્ર થઈ શકતું નથી અને તેને કંટાળો આવે છે. થાક લાગે છે. દરેક કાર્યમાં રસ પડે તે રીતે મનને કેળવવું જોઈએ.

જેમને ધ્યાનનો અભ્યાસ છે, તેઓ કોઈપણ કાર્યમાં તરત જ એકાગ્ર થઈ શકે છે. એમની ચેતના વેરવિખેર હોતી નથી. નિયમિત ધ્યાનના અભ્યાસથી મન સ્થિર થઈ જાય છે. મન સ્થિર થતાં તેની અવલોકનશક્તિ, સ્મૃતિશક્તિ અને એકાગ્રતાની શક્તિ વધે છે. સામાન્ય મન કરી શકે તેનાં કરતાં અનેકગણું વધારે કામ તે કરી શકે છે. આથી દરેકે ધ્યાનનો અભ્યાસ કરવી જોઈએ. શરૂઆતમાં કંટાળાજનક લાગતું ધ્યાન પછીથી મનની શાંતિ અને એકાગ્રતાના રૂપમાં અનેકગણું વળતર આપી દે છે.

### મનને સંગઠિત કરવું :

આપણા મનના તાણાવાણા અનેક દિશાઓમાં વિખરાયેલા હોય છે. એક ક્ષણમાં અહીં તો બીજી ક્ષણમાં તે અમેરિકા પહોંચી ગયું હોય છે. એટલે જ એની ગતિ પવનથી પણ તેજ માનવામાં આવી છે. એનાં બ્રમણો અનંત છે. સ્થળ કે કાળની કોઈ સીમા એને નડતી નથી. તે આખાય બ્રહ્માંડમાં મુક્ત રીતે ફરી શકે છે. વળી તે કોઈપણ કાળમાં જઈ શકે છે. ક્યારેક ભૂતકાળમાં રમતું હોય છે. તો તેમાંથી છલાંગ લગાવીને તે સીધું ભવિષ્યમાં પહોંચી જાય છે. તો વળી વર્તમાનમાં પણ કૂદકા મારવા લાગે છે. આ રીતે મન ક્યારે ક્યાં હશે, તે કહી શકતું નથી. આવા વિચિન્ન મનથી નથી સારી રીતે અભ્યાસ થઈ શકતો કે નથી સારી રીતે કાર્ય થઈ શકતું કે નથી સારી રીતે ભોગો ભોગવી શકતા.

ટી.વી.ના પડદા પર સુંદર નૃત્ય ચાલી રહ્યું હોય, પણ એનો આનંદ મળતો નથી. કેમ કે ત્યારે મન તો ઓફિસની ફાઈલોમાં જઈને બેસી ગણું હોય છે ! થાળીમાં સુંદર સ્વાદિષ્ટ વાનગીઓ પીરસેલી હોય અને જમવાનું ચાલુ હોય પણ ત્યારે મન બજારમાં સોંદા કરી રહ્યું હોય ને શું ખાઈ રહ્યા છે, એની પણ ખબર ન હોય તો વાનગીનો સ્વાદ ક્યાંથી આવે ? આવા મનથી કોઈ પ્રકારનો આનંદ મળતો નથી. કેમ કે એ જ્યાં હોવું જોઈએ ત્યાં હોતું નથી. આવા મનને સંગઠિત કરવાનું છે. સંગઠિત મન એટલે માણસ જ્યાં હોય ત્યાં તેનું અસ્તિત્વ હોય અને તે જે કાર્ય કરતો હોય તે કાર્યમય બની ગયો હોય એવી મનની સ્થિતિ. આપણે જે કાર્ય કરતાં હોઈએ તે કાર્ય સાથે એવી તદ્વાપતા કે જાણો બીજા કશાયનું અસ્તિત્વ નથી અને કોઈ વિચારો આવતા નથી. એ કાર્યમાં જ મન ઓતપ્રોત બની જાય છે. આ છે સંગઠિત મન. જેનું મન આ રીતે સંગઠિત બને છે, તેમની નિર્ણયશક્તિ દઢ હોય છે. તેઓ ધારેલાં કામો સફળતા-પૂર્વક પાર પાડી શકે છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લઈ શકે છે. તેમનો આત્મવિશ્વાસ પ્રબળ હોય છે. ગમે તેવું મુશ્કેલ કામ પણ તેઓ સહેલાઈથી પાર પાડે છે.

શિથિલ મનને સંગઠિત કરવું અધરું તો છે પણ અશક્ય નથી. માનસિક તાલીમ, સતત અભ્યાસ અને કઠોર શિસ્તપાલન દ્વારા મન જરૂર સંગઠિત થઈ શકે છે. મનને સંગઠિત અને સુદૃઢ કરવા માટે શ્રીમાતાજીએ કોઈ ઉચ્ચ તેજોમય વિશ્વબ્યાપી વિચારની આસપાસ પોતાના વિચારોને ગોઠવવાની પદ્ધતિ બતાવી છે. દા.ત. આપણે એક વિશ્વબ્યાપી તેજોમય વિચાર લઈએ કે “દરેક વ્યક્તિના અંતરમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. એ દિવ્યતાને જીવનમાં અભિવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે.” પછી આ કેન્દ્રવર્તી વિચારની આસપાસ જ આપણે આપણાં વિચારોને, લાગણીઓને, ભાવનાઓને અને કાર્યોને

ગોઠવતાં રહેવું. એ પ્રમાણે કરતાં મનમાંથી અસંખ્ય નકામી અને ધ્યેયથી દૂર લઈ જનારી બાબતો નીકળતી જશે. મનમાં રહેલો કચરો આ એક તેજસ્વી વિચારને કેન્દ્રમાં ગોઠવી દેવાથી દૂર થઈ જશે. મન પણ તેજસ્વી બનવા લાગશે. સંગઠિત બનશે. સુદૃઢ બનશે.

પરંતુ આવા પ્રકાશવર્તી વિચારની આજુબાજુ પોતાના વિચારોને ગોઠવવાની તાલીમ જો નાનપણથી મળી ન હોય તો મોટી ઉભરે વિચારો દફ અને પક્વ થઈ જતાં મુશ્કેલ બને છે. મોટા માણસોનાં મન જડ ઘ્યાલો, માન્યતાઓ, પૂર્વગ્રહોથી ભરાઈ ગયેલાં હોય છે. એવા મનમાં આવો પ્રકાશમય વિચાર પ્રવેશી શકતો નથી. અને પ્રવેશે છે તો ટકી શકતો નથી. એ માટે આકરી શિસ્તનું પાલન કરી મનને બદલવું પડે છે. ભલે મોટી ઉભરે મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. માણસ ઈર્ઝે તો ગમે તે વધે પોતાના મનને કેળવી શકે છે. પણ ખંતપૂર્વક મંજ્યા રહેવું પડે છે. શ્રીમાતાજી કહે છે, “માણસે પોતાની વિચાર કરવાની રીત વ્યવસ્થિત કરવા માટે, એક નાની સરલ વસ્તુની સફળ રચના કરવા માટે વર્ષો સુધી સંભાળ રાખવી પડે છે. ખૂબ ચોક્કસ બનવું પડે છે. સમજદાર રહેવું પડે છે. પસંદગી કરવી પડે છે. ઘડતર કરવું પડે છે.” પણ આ મહેનત કરવાથી મનુષ્ય પોતાના મનનો રાજા બની શકે છે. આત્મપ્રભુત્વ પ્રાપ્ત કરી શકે છે.

### ખરાબ વિચારો પર કાબૂ મેળવવો :

ભગવાન બુદ્ધ કહે છે કે “મનુષ્ય આજે જે કંઈ છે તે તેણે ભૂતકાળમાં કરેલા વિચારોનું પરિણામ છે.” એટલે કે મનુષ્ય જેવા વિચારો કરે છે, તેવો તે બને છે. વિચારોમાં રૂપોનું સર્જન કરવાની શક્તિ રહેલી છે. શ્રીઅરવિંદ પણ કહે છે કે “મનુષ્ય જે વિચારે છે, તે વિચારની હકીકતના પરિણામ રૂપે તે બની શકે છે.” આ રીતે જોતાં મનુષ્યે વિચારોની બાબતમાં ખૂબ સાવધ રહેવું જોઈએ. આ તો ખાલી વિચારો

જ છે, એમ કહીને ગમે તેવા વિચારો કરવા ન જોઈએ. પરંતુ માણસે પોતાના વિચારો પ્રત્યે ઘણું કરીને જાગૃત હોતો નથી. તે આડાઅવળા વિચારો કરતો જ રહે છે. પરસ્પર વિરોધી વિચારો પણ તેના મનમાં અથડાતા હોય છે. તેના પરિણામે તેના જીવનમાં અવ્યવસ્થા ને વિસંવાદિતા ઊભી થાય છે. પણ તે જાણતો નથી કે તેનાં મૂળ તેણે કરેલા વિરોધી વિચારોમાં રહેલાં છે. દુષ્ટ, હલકા, વિરોધી વિચારો પ્રત્યે સાવધાન કરતાં શ્રીમાતાજી કહે છે, “આપણા અસ્તિત્વનો વિનાશ કરે તેવા કોઈપણ વિચારને આપણે મનમાં દાખલ થવા દેવો જોઈએ નહીં. આપણે જે નથી બનવું તેની રચના વિચાર રૂપે પણ આપણી અંદર થવા દેવી જોઈએ નહીં. વિનાશકારી સૂચનો, અસદ્ભાવના વિચારો, પિક્કારો, હિંસા વગેરેના કોઈપણ વિચારોને આપણી અંદર પ્રવેશવા દેવા ન જોઈએ. કેમ કે એનો વિચાર કરવાથી એને સિદ્ધ થવાની શક્તિ મળી જાય છે. આમાં શું ? આ તો ખાલી વિચારો જ છે. એમ કહીને માણસે પોતાની અંદર ખરાબ વિચારોને પ્રવેશવા દેવા ન જોઈએ. આવા વિચારો તો વિનાશનાં હથિયારો છે. જો તેમને વિનાશ કરવા દેવો ન હોય તો આ ખરાબ વિચારોને માણસે પોતાની અંદર બિલકુલ દાખલ થવા દેવા જોઈએ નહીં.”

ખરાબ વિચારોથી પોતાનું અનિષ્ટ થાય છે, અને બીજા માટે કરેલા ખરાબ વિચારોથી બીજાનું અનિષ્ટ પણ થાય છે. આ સંદર્ભમાં શ્રીમાતાજી કહે છે, “ખરાબ વિચાર ખરાબ કૂત્ય કરવા જેટલો જ ભયાનક છે. લોકો આ વસ્તુ જાણતા નથી. કોઈ માટે કોઈ વ્યક્તિએ અશુભ વિચાર્યુ હોય અને તે વ્યક્તિનું કંઈ ખરાબ થાય તો અશુભ વિચારનારની ખરાબ કાર્ય કરવા જેટલી જ જવાબદારી બની જાય છે. અને એ ખરાબ કૂત્યનું ફળ એણે ભોગવવું પડે છે ! પરંતુ કેટલાક માણસોનો સ્વભાવ જ એવો હોય છે કે બીજાઓ વિશે ખરાબ

વિચારવામાં અને વાતાવરણમાં એવા અનિષ્ટ વિચારો પ્રસરાવવામાં તેમને એક જાતનો વિકૃત આનંદ આવતો હોય છે. પણ પછી એ વિકૃત આનંદના માટાં ફળ એણો ભોગવવાં જ પડે છે.

ધાર્ષાવાર એવું પણ બને છે કે મનમાં કશું જ ન હોય અને એકાએક ખરાબ વિચારો ચડી આવે છે. ભયના, શંકાના, અનિષ્ટના વિચારો એકાએક કેવી રીતે આવતા હશે? આવા પ્રશ્નના ઉત્તરમાં શ્રીમાતાજીએ કહ્યું હતું, “દરેક ખરાબ વિચારને આવવાનું તેનું પોતાનું કારણ રહેલું હોય છે. તે ખરાબ સંગતને કારણો, ખરાબ સ્વભાવને કારણો, હલકી લાગણીઓને કારણો, તમને ચીડવવા, તમે બોલાવતા હો તો, તમે એના પ્રત્યે ખુલ્લા હો તો, આવી શકે છે.” આ ઉપરાંત પણ ખરાબ વિચારો વાતાવરણમાં ફરતા હોય છે. પણ મનુષ્યની અંદર તેને આકર્ષે એવું જો કંઈ જ ન હોય તો તે ખરાબ વિચારો મનુષ્યની અંદર પ્રવેશી શકતા નથી. આ વિશે શ્રીમાતાજીએ જણાવ્યું હતું; “ખરાબ વિચારો તો વાતાવરણમાં બધે જ રહેલા છે. પણ જો તમારી અંદર એને સુસંગત એવું કંઈ જ ન હોય તો તમે તેને પસાર થતાં જોઈ શકો પણ તે તમારી અંદર પ્રવેશી શકે નહીં.” મોટેભાગે માણસની અંદર ભય, ચિંતા, અનિષ્ટની આંશંકાઓ વગેરે થોડેઘણો અંશે તો રહેલાં હોય છે જ. તેથી બહારના આવા વિચારો તેની અંદર પ્રવેશીને તેનો કબજો જમાવી લે છે. પછી કેમેય પીછો છોડતા નથી.

આ ખરાબ વિચારોમાંથી કેવી રીતે મુક્ત થવું? આ માટે માર્ગદર્શન આપતાં શ્રીમાતાજી કહે છે કે “માણસની ચેતનાએ ગળણીનું કામ કરવું જોઈએ. ચેતના દ્વારા વિચારો ગળાઈ જવા જોઈએ. જે જરૂરી હોય, કામના હોય તેટલા જ વિચારો અંદર પ્રવેશે અને બાકીના કૂચાની જેમ બહાર રહી જાય તેવી ચેતનાની સ્થિતિ બનાવી લેવી જોઈએ.”

બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની કે આપણે જેનો વિચાર

કરતાં હોઈએ. અનો જ વિચાર કરવાનો. બીજી નકામી વસ્તુઓને અંદર આવવા ન દેવી. વિચારોને પૂરા ચકાસી લેવા. વિચારો આવે કે તરત જ કાર્યમાં ધસી પડવું ન જોઈએ. સામાન્ય રીતે માણસો પોતાને આવેલા વિચારો પર ચિંતન ભાગ્યે જ કરતા હોય છે. અને તરત જ તેનો અમલ કરવા માંડતા હોય છે. આવું ઉતાવળે કરવાથી એનાં પરિણામો જિંદગી સુધી ભોગવવાં પડે છે. વિચારોને તરત જ લાગણીમાં કે કાર્યમાં પરિણત કરવા ન જોઈએ. પૂરો વિચાર કર્યા પછી જ તેનો અમલ કરવામાં આવે તો ઘણાં અનિષ્ટોમાંથી બચી શકાય છે.

આ ઉપરાંત પણ શ્રીમાતાજીએ ખરાબ વિચારોમાંથી મુક્ત થવા માટે બીજી ચાર પદ્ધતિઓ બતાવી છે. તેનો અમલ કરવાથી પણ ખરાબ વિચારો દૂર થઈ જાય છે.

પ્રથમ પદ્ધતિ છે, અન્ય મનપસંદ કાર્યમાં મન પરોવી દેવું. ખરાબ વિચારો સત્તાવતા હોય તો, દુઃખી થઈને તેને પકડીને બેસી રહેવાને બદલે મનગમતું કોઈ એવું કામ કે જેમાં આ વિચારોને કંઈ લેવાદેવા ન હોય તે હાથમાં લઈ લેવું. મનપસંદ કામ હોવાથી રસ પડે છે, તેમાં ઓતપ્રોત થઈ જવાથી અણગમતા વિચારો ક્યાંય જતા રહે છે. ખબર પણ પડતી નથી. આ સહેલી પદ્ધતિ છે, અને કોઈપણ મનુષ્ય એ સહેલાઈથી અમલમાં મૂકી શકે છે.

બીજી પદ્ધતિ વિચારનો ત્યાગ કરી દેવાની છે. જેમ નકામી વસ્તુઓને આપણે ફેંકી દઈએ છીએ. તેમ નકામા વિચારોને મનમાંથી ફેંકી દેવાના છે. આ પદ્ધતિ થોડી અધરી છે, પણ અત્યાસથી તે સિદ્ધ થઈ શકે છે. અને પછી તેમાં વિચારો ઉપર કાબૂ આવી જાય છે.

ત્રીજી પદ્ધતિ યૌગિક પદ્ધતિ છે. તેમાં ઊર્ધ્વમાં આરોહણ કરવાનું છે. અણગમતા, ખરાબ વિચારો અજ્ઞાન અને અંધકારને પરિણામે આવે છે. એ નિભન્ન ભૂમિકાના વિચારો છે. ઊર્ધ્વમાં પ્રકાશ રહેલો છે, ચેતનાને

ઉંચે ઉઠાવતાં એ પ્રકાશમાં આ વિચારો ટકી શકતા નથી. ઉર્ધ્વમાં વિચારોની સમગ્ર ભૂમિકા જ બદલાઈ જાય છે. તાં આ વિચારોને સ્થાન જ નથી હોતું. આ પદ્ધતિ અજમાવવા માટે સાધના કરવી પડે છે. ચેતનાની ભૂમિકા બદલવી પડે છે, પણ જો એ કરી શકાય તો સમગ્ર જીવન બદલાઈ જાય છે.

ચોથી પદ્ધતિ વિચારોના સ્વામી બનવાની છે. એમાં સંકલ્પબળ દ્વારા મનનાં મિથ્યાચારી બ્રમણોને અટકાવી દેવામાં આવે છે. મનને હુકમ કરવામાં આવે છે કે “આવા નકામા વિચારોનો ગણગણાટ બંધ કરી દે.” જેમને ધ્યાનની ટેવ હોય છે, તેઓ તો મનના આ ખરાબ વિચારોને આવતા જ અટકાવી દે છે અને પોતાને જેવા જોઈએ તેવા વિચારોને વાતાવરણમાંથી ભેંચી લઈ શકે છે. જેમણે વિચારો પર પ્રભુત્વ મેળવ્યું છે, તેઓ તો પોતાને અનુરૂપ વિચારોને વાતાવરણમાંથી લઈ શકે છે અને સમસ્યાઓનો ઉકેલ પણ એ રીતે મેળવી શકે છે. જે રીતે સૂર્યપ્રકાશ બધાંને માટે સુલભ છે, એ રીતે બધા જ પ્રકારના વિચારો પણ બધાંને માટે સુલભ છે. વિચારો કોઈ એક મનુષ્યની માલિકીના નથી, પણ તે તો સામૂહિક મિલકત છે. વૈશ્વિક વાતાવરણમાં રહેલા ઉત્કૃષ્ટ અને મહાન વિચારો પણ કોઈને જોઈતા હોય તો તે લઈ શકે છે. પણ તેના માટે ધ્યાન, એકાગ્રતા અને ચિંતનની ટેવ હોવી જરૂરી છે. શ્રીમાતાજી કહે છે કે “સાચો લેખક, સાચો વિચારક કે સાચો વક્તા વિચારોને પોતાના મસ્તિષ્કમાં ઘડતો નથી. પણ તે માટેની તે ઉર્ધ્વમાંથી પ્રેરણા મેળવે છે. અને તેના મનમાં એ પ્રવેશ કરતી વખતે શબ્દોમાં કંડારાય છે. પણ તેનું મૂળ તો ઉર્ધ્વમાં રહેલું છે.”

આમાંની કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરીને વ્યક્તિ ખરાબ વિચારોમાંથી મુક્તિ મેળવી શકે છે. પોતાના મનનાં બ્રમણોને અટકાવી શકે છે. મનને શાંત અને નીરવ બનાવી ઉર્ધ્વમાંથી આવતા દિવ્ય

શક્તિઓના પ્રવાહને જીલીને પોતાના જીવનને ચૈતન્યથી ભરપૂર બનાવી શકે છે.

## મનનું વલણ બદલવું :

માણસનાં સુખદુઃખનો આધાર તેના મનોવલણ ઉપર રહેલો છે. જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે માણસ એમ વિચારે કે આ મુશ્કેલીઓથી મારી સંકલ્પશક્તિ દઢ થાય છે. વિરોધોની વચ્ચે કામ કરવાથી મારી આંતરશક્તિઓ જાગૃત થાય છે. તેથી તો હું જડપથી વિકાસ કરી શકીશ. તો પછી મુશ્કેલીઓ આશીર્વાદમાં ફેરવાઈ જાય છે. સાચે જ મુશ્કેલીઓને લઈને તેની પ્રગતિ જડપી બની જાય છે. પરંતુ આના બદલે જો તે આવું વલણ દાખવે કે “અરેરે, આ મુશ્કેલીઓ મારો પીછો છોડતી નથી. હવે તો હું સાવ થાકી ગયો છું. હારી ગયો છું. આ મુશ્કેલીઓએ મને ભાંગી નાંખ્યો છે, હવે હું કશા કામનો રહ્યો નથી.” તો તેના આવા વલણને પરિણામે તે સાચે જ નિરાશાના ગર્તમાં ફેરાઈ જાય છે અને પછી તે કશાય કામનો રહેતો નથી. આથી માણસે હંમેશાં વિધેયાત્મક વલણ રાખવું જોઈએ. જો તેનું મનોવલણ સાચું હશે તો ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ તે ટકી શકશે અને વિકાસ પણ કરી શકશે.

ઘણા લોકો જાણે દુઃખનો અંયળો ઓઢીને ફરતા હોય તેવા દેખાતા હોય છે. એમને દરેક પરિસ્થિતિમાં કંઈ ને કંઈ ખામી દેખાતી હોય છે. લોકોમાં, વસ્તુઓમાં તેમને ખામી દેખાતી હોવાથી તેઓ સતત ફરિયાદ જ કર્યા કરતા હોય છે. આવા લોકોને કોઈપણ મનુષ્ય, વસ્તુ કે પરિસ્થિતિ સુખ-સંતોષ આપી શકતાં નથી. ખુદ ભગવાન પણ એમને સંતુષ્ટ કરી શકતા નથી. દુઃખ વસ્તુઓમાં કે સંજોગોમાં નથી પણ એ માણસના મનમાં રહેલું છે. જ્યારે માણસો વેકેશનમાં બહાર ફરવા જાય છે ત્યારે ટ્રેનમાં અપાર ગિરદીમાં બેસવાની પણ જગ્યા મળતી નથી. ઘણી વખત તો યાત્રાના સ્થળે હોટલમાં સારી રૂમ પણ મળતી નથી, અને

આવાનું પણ બરાબર હોતું નથી, આમ ચારે બાજુ અગવડ જ છે અને છતાંય તેમાં કેટલો બધો આનંદ મળે છે ! એમાં ક્યાંય દુઃખ કે અભાવ કે મુશ્કેલી લાગતાં નથી. પણ ઘેર જો પથારી સરખી થઈ ન હોય કે ઓશીકું બદલાઈ ગયું હોય કે જમવાનું મોહું થયું હોય તો દુઃખી થઈ જવાય છે. આટલી બધી સુવિધાઓ વચ્ચે પણ ધરમાં દુઃખ જણાય છે અને બહાર આટલી અગવડો વચ્ચે પણ આનંદ અનુભવાય છે. એમ કેમ ? એનું કારણ એ છે કે સુખ દુઃખ પરિસ્થિતિ કે સગવડઅગવડમાં નથી. એ તો મનનાં વલણમાં રહેલાં છે.

મોટાભાગના મનુષ્યો એવું માનતા હોય છે કે બંગલા, મોટર, વિપુલ સંપત્તિ હોય તો સુખ મળે છે. વિપુલ સંપત્તિ હોય પણ મનમાં સંતોષ ન હોય, બીજાં પોતાનાં કરતાં વધારે સંપત્તિવાન બની ન જાય એ માટે તેઓ રાતદિવસ મહેનત કરતા હોય છે. પોતાનું એક નંબરનું ધનાઢ્યનું સ્થાન ટકાવી રાખવા કેટકેટલી મહેનત કરવી પડતી હોય છે. એમાં સુખશાંતિ ક્યાંય હોતાં નથી. અને પછી એ સંપત્તિ ભોગવી પણ શકાતી નથી, એને છોડીને ચાલ્યા જવાનો વિચારમાત્ર દુઃખદાયી બની રહે છે. જો મનમાં અસંતોષની જવાળાઓ ભભૂકતી હોય તો મહેલ પણ સુખશાંતિ આપી શકતો નથી. આથી ફરિયાદ કરવાને બદલૈ પોતાને જે સંજોગો મળ્યા છે તેનો સ્વીકાર કરીને પોતાના મનોવલણને બદલવાનું છે, જે કોઈ ફરિયાદો કરે છે, તે જિંદગી આખી ફરિયાદો જ કરતું રહે છે. પણ જે પરિસ્થિતિનો સ્વીકાર કરીને પોતાના મનને બદલીને આગળ વધે છે, તે જીવનમાં સફળતા મેળવે છે. મનુષ્ય તાત્કાલિક પોતાના સંજોગોને તો બદલી શકતો નથી. પણ પોતાના મનના વલણને તો જરૂર બદલી શકે છે. એમાં કોઈ કષ્ટસાધ્ય સાધના કરવાની નથી. ફક્ત પરિસ્થિતિને જોવાની દસ્તિ જ બદલવાની છે. એ દસ્તિ બદલાતાં અંદરની ચેતના બદલાય છે. અને પછી પરિસ્થિતિ પણ બદલાય છે.

બે કારીગરો પથ્થર ટાંચી રહ્યા હતા. તેમાંના એકને પૂછ્યું કે શું કરો છો ? તો કહે, “જોતા નથી આ પથ્થર ટાંચું છું.” બીજાને પૂછ્યું તો કહે, “જુઓને, હું મારા પ્રભુની મૂર્તિ ઘરી રહ્યો છું.” એના ચહેરા ઉપર આનંદ હતો. પ્રભુની મૂર્તિ ઘડવાના કાર્યનો સંતોષ હતો. જ્યારે પહેલા કારીગરના ચહેરા પર અણગમો અને થાક હતા. તેના અંતરમાં ઉદાસીનતા હતી. કામ તો બંને એક જ કરી રહ્યા હતા પણ એ કામ એકને પરમાત્માના સાંનિધ્યમાં મૂકી આપતું હતું. જ્યારે બીજાને એ પથ્થર ફોડાવતું હતું ! જો મનના ભાવને બદલી નાંખવામાં આવે તો પ્રત્યેક કાર્ય પૂજા બની જાય છે અને તે ભગવાનના સાંનિધ્યમાં મૂકી આપે છે. શ્રીમાતાજી કહે છે, “મનુષ્યે હંમેશાં પોતાના સાચા મનોવલણમાં રહીને કાર્ય કરવું જોઈએ.”

આ સાચું મનોવલણ કઈ રીતે પ્રાપ્ત કરવું ? આ વિશે માર્ગદર્શન આપતાં શ્રીમાતાજીએ કહ્યું હતું, “આમાં તમારી મર્યાદામાં જે સર્વોચ્ચ ચેતના હોય તેના સંપર્કમાં તમારે તમારી ચેતનાને મૂકી દેવી. કોઈપણ સંજ્ઞેગોમાં તમે જો આ કરી શકો, તો તે સંજ્ઞેગોમાં જે કંઈ તમારા માટે બજશે તે ઉત્તમ જ બજશે. ધારો કે કોઈ માણસ તમારી હત્યા કરવા આવે અને તમે બેબાકળા કે વિહ્લવળ બની જાઓ અને સામાન્ય ચેતનામાં ઊતરી પડો તો તે સફળ થાય પણ તમે એક ક્ષણ પણ તમારી ચેતનામાંથી ઉંચે ચડો, ભયભીત સ્થિતિમાં પણ તમે ભગવાનને પોકાર કરો તો તે વ્યક્તિ તમને કંઈ વધુ ન કરી શકે. સહેજ-સાજ ધા પહોંચાડે અને જો તમે સાચી ચેતનામાં, સાચા મનોવલણમાં ભગવાનની ભરી ભરી ચેતનામાં હો તો તમને એક આંગળી પણ ન અડાડી શકે.”

જ્યારે મનુષ્ય ભગવાનની ચેતના સાથે એકરૂપ બને ત્યાર પછી દુઃખનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. કેમ કે એ ચેતના તો સદાય આનંદમય છે. પરંતુ જ્યાં સુધી એ સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મનુષ્યે જગૃત

રહીને, પ્રભુનો પ્રકાશ પોતાના મનમાં ઉત્તરે અને મનને શાંત અને સ્થિર કરી દે તેવી પ્રાર્થના કરવી જોઈએ. તો પછી ધીમે ધીમે મનમાં પ્રકાશની અનુભૂતિ થવા લાગે છે અને પછી તો બધું જ બદલાઈ જાય છે અને જીવન બની જાય છે ક્ષણે ક્ષણે થતો આવિર્ભાવ.



“આંતરિક વિકાસ ડેટલો સુંદર અને અનેકવિધ સંભાવનાવાળો હોય છે તેનો તમને ખ્યાલ છે? કદાચ નથી. કારણ કે આ દિશામાં ખૂબ ઓછા લોકોએ ખેડાણ કર્યું છે. આ અંતઃસોતની શક્તિ છે, એની હસ્તી વિષે પણ આપણે જાણતા નથી, તો એના રૂપનું વૈવિધ્ય આપણી પાસે ક્યાંથી ખૂલ્યું હોય? આપણને હજુ તેના સ્વરૂપનું જ આકલન નથી થયું. આ આત્મશક્તિને વિકસાવવાની ખૂબ જરૂર છે. માણસ કરું કરે નહીં, બોલે પણ નહીં અને છતાંય એ બીજા માણસ પર પોતાની અસર મૂકતો જાય, એ અસરોમાંથી એ છટકી શકે નહીં. માત્ર પ્રતીતિ થતી રહે કે આ માણસની અસર મારા ચિત્ત પર અંકિત થઈ રહી છે. પ્રત્યેક માણસમાં આ આત્મશક્તિ પડેલી છે. એને જાગૃત કરીને વિકસાવવાની જરૂર છે.”

- રાલ્ફ વાલ્ડો ટ્રાઈન

## આચા માલિકનો મેળાપ

ભૌતિક શરીર, પ્રાણશક્તિ અને મન એ તો કાર્ય કરવા માટે આપણને મળેલાં સાધનો છે. અલબત્ત, એ સાધનોનો યોગ્ય ઉપયોગ કરવાથી જીવન સુંદર અને આનંદમદબની શકે છે. પણ આખરે સાધનો એ સાધનો જ છે. મૂળ માલિક તો જુદો જ છે. મૂળ માલિકની ગેરહાજરીમાં તેના નોકર-ચાકરો માલિક કરતાં ય વધારે રોફ જમાવતા હોય છે, એટલે ઘણા લોકો આવા નોકરોને માલિક માની લેવાની ભૂલ કરી બેસે છે. એવું જ અહીં પણ છે. મૂળ માલિકની ગેરહાજરીમાં મન અને પ્રાણ ફાવે તેમ વર્તે છે, અને જાણે પોતે જ સર્વેસર્વા હોય એવો રોફ જમાવે છે. તેના પરિણામે અભ્યવસ્થા ને ગોટાળાઓ સર્જય છે. મૂળ માલિક ગેરહાજર હોય ત્યારે તો આવું જ બધે થતું હોય છે. આપણી અંદર પણ સુભેણ, સુસંવાદિતા સ્થાપવા, આ સાધનોનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવા, પોતાના અતુલિત પ્રભાવથી આ સાધનો પર નિયંત્રણ રાખવા મૂળ માલિક - સર્વસત્તાધીશ એવો આપણો રાજવી આત્મા પ્રગટ થવો જોઈએ. એના પ્રભાવ વગર મન, પ્રાણ અને શરીરને સ્થાયીપણે કેળવી શકતાં નથી. નિયંત્રિત કરી શકતાં નથી. એના પ્રકાશ વગર અંદરનાં અજ્ઞાન અને અંધકાર કાયમી રીતે દૂર થતાં નથી. એની હાજરી વગર સાચો આનંદ કાયમ મળી શકતો નથી. આથી આપણાં બાધ્ય કરણો શરીર, પ્રાણ અને મનની તાલીમ સાચા આનંદમય જીવનની પ્રાપ્તિ માટે પૂરતી નથી. એ તાલીમની સાથે સાથે આપણી અંતર ગુફામાં છુપાઈને રહેલો આપણો આત્મા પણ પ્રગટ થવો જોઈએ. તેનો પ્રભાવ ને પ્રકાશ આપણા સમગ્ર ચરિત્રત્વ પર છવાઈ રહેવો જોઈએ. એ આત્મપ્રકાશમાં જીવાતું જીવન જ સાચું જીવન છે.

પરંતુ ગ્રશે એ છે કે આ મૂળ માલિકનો મેળાપ કેવી રીતે કરવો? એ તો બધાય દરવાજા બંધ કરીને છુપાઈને ક્યાંય બેઠા છે. અને બહાર બધું જેમ ચાલે છે, તેમ ચાલવા હે છે અને બધાંને તો કંઈ મળતા પણ નથી. અરે, ઘણાંને તો ખબર પણ નથી હોતી કે મૂળ માલિક બીજા છે, અને અંદરમાં ક્યાંક બેઠેલા છે! જો એની શોધ કરીશું તો જરૂર મળશે! આવી જાણકારી ન હોવાથી કેટલાય લોકોનાં જીવન તો એમ ને એમ અંધકારમાં પૂરાં થઈ જતાં હોય છે. પણ કેટલાક એ જાણો છે. પણ શોધવાનો પ્રયત્ન કરતા નથી, તો એમનું જીવન પણ એમ જ પસાર થઈ જાય છે. પણ કેટલાક જાણો છે, અને એમને મળવા માટે કટિબદ્ધ થઈને અંતરયાત્રામાં નીકળી પડે છે, તો એમને એ મૂળ માલિકનો ચોક્કસ મેળાપ થાય છે અને ત્યારે ખબર પડે છે કે “ઓહ, તેઓ આટલા બધા નજીક છે અને મને તેની ખબરેય ન હતી!”

આ શોધ માટેનો સરળ રસ્તો બતાવતાં શ્રીમાતાજી કહે છે, “તમે તમારી ચેતનાને હૃદયના કેન્દ્રમાં એકાગ્ર કરો. તમારા હૃદયની અંદર ઉડિ ઉડિ ઉતરો. જેટલા ઉડિ જવાય ત્યાં સુધી જાઓ, જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી એમાં દૂબડી મારો. તમારી ચેતનાના જે તાંત્રણાઓ સર્વત્ર પ્રસરી રહ્યા છે, તેને એકાગ્ર કરો. અને તેમાં દૂબી જાઓ. ત્યાં અંતરના ઊડાણમાં તમે જોશો કે એક હિંય અંગિ રહેલો છે. એ જ તમારામાં રહેલા પ્રભુનો અંશ છે. એ જ તમારી સાચી સત્તા છે. એના સાદને સાંભળો અને તેના આદેશને અનુસરો.”

મનુષ્યને જો એકવાર પણ પોતાના સાચા સ્વરૂપનો પરિચય થઈ જાય છે તો પછી તે કદી અજ્ઞાન કે અંધકારમાં રહી શકતો નથી. પણ એનો મેળાપ સહેલાઈથી થતો નથી. સામાન્ય અધિકારીને મળવા માટે આપણે કેટલી તૈયારી કરવી પડે છે? કેટલી મહેનત કરવી પડે છે? જેમ અધિકારીનું પદ ઊંચું તેમ તેને મળવા માટે વધારે મહેનત કરવી પડે.

તો આ તો સર્વાચ્ય અધિકારી છે. સર્વસર્વા છે. એને મળવા મહેનત તો કરવી જ પડેને ! પણ એ ખૂબ દયાળુ છે. આપણી નિષ્ઠાપૂર્વકની રોજેરોજની મહેનતથી એ રાજ થઈને એને મળવાના માર્ગ તરફ અદશ્ય રીતે આપણને દોરી જાય છે. અને ક્યારેક તો પોતાના પ્રેમાળ હાથોથી આપણને ખબર પણ ન પડે તેમ ઊંચીને એની પોતાની સમીપમાં મૂકી દે છે ! અને એ સાચા માલિકને મજ્યા પછી તો સમગ્ર જીવન એના જ આવિર્ભાવ રૂપ બની જાય છે. બેદ ભૂંસાઈ જાય છે. દાઢિમાં એ જ આવીને બેસી જાય છે એટલે સર્વત્ર એ જ દેખાય છે. અને પછી શરૂ થાય છે એની સાથેનું જીવન. એના પ્રેમ, પ્રકાશ અને આનંદમાં જીવાતું જીવન. આ જ આપણું સાચું જીવન છે, એની પછી સતત અનુભૂતિ થતી રહે છે.

આમ, નાનકડી શરૂઆત, થોડોક સાચો પ્રયત્ન કરવામાં આવે તો એ પ્રયત્નમાં જ આનંદ રહેલો છે. પછી એની પ્રાપ્તિના આનંદની તો કોઈ કલ્પના જ ન કરી શકે. શ્રીમાતાજી કહે છે, “એ પ્રયત્નમાં અદ્ભુત આનંદ રહેલો છે. જીવનમાં પ્રયત્ન કરવા જેવી એકમાત્ર વસ્તુ આ જ છે. હું મારા અંગત અનુભવથી કહું છું કે પોતાની અંદર ભાગવતૂ સંકલ્પની અભિવ્યક્તિ કરનાર વ્યક્તિ બનવું એ જ પ્રયત્ન કરવા જેવી વસ્તુ છે. આખી દુનિયામાં એનાથી રસપ્રદ બીજી કોઈ વાત જ નથી. સામાન્ય માણસની જિંદગીનો ઓછામાં ઓછો ત્રીજો ભાગ કહું છું, પણ કેટલાકની તો બે તૃતીયાંશ ભાગની જિંદગી શુષ્ણ અને કંટાળાભરેલી વ્યતીત થઈ જાય છે. પણ આ પ્રયત્નથી બધું જ વરાળ થઈને ઊરી જાય છે. અને પછી દરેક ચીજ, નાનામાં નાની વસ્તુ, નાનામાં નાનો સંપર્ક, ઓછામાં ઓછા શબ્દોની વાતચીત, કોઈ વસ્તુનું અમસ્તું અસ્થાને હોવું-બધું જ સજીવન અને રસપ્રદ બની રહે છે !”

આમ, પ્રલુબુ સાથે જીવાતા જીવનમાં બસ આનંદ, આનંદ અને

આનંદ જ મળે છે. આ આનંદ ક્યારેય વાસી થતો નથી. ઓછો થતો નથી. બગડતો નથી. પણ સદાય નિત્યનૂતન, તાજગીભર્યો, વૃદ્ધિ પામતો રહે છે. પરમાત્મા એવું ઈચ્છે છે કે એનાં લાડકાં સંતાનો મજુસ્ય આ આનંદની પ્રાપ્તિ કરી પૃથ્વી પર સ્વર્ગ સમું જીવન જીવે.



પ્રભુને અંદર શોધવો એટલે અંધકારમાં ફાંકાં મારવાં એવું હરગિજ નથી. ઈશ્વરનો સાક્ષાત્કાર એટલે પ્રભુનું સ્પષ્ટ-સુરેખ દર્શન ! જેમાં નિઃસ્વાર્થતા, નિઃશેષ સમર્પણ અને પરિપૂર્ણ ગુણસંપન્નતાનો સમાવેશ થાય છે.

નકામી ચિંતામાં સમય વેડફિવાને બદલે જો હકારાત્મક વલણ સાથે મૌનપૂર્વક, અખૂટ વિશ્વાસ સાથે ઈશ્વરી કૃપા યાચીએ તો આપણાને પરમકૃપા અચૂક આવી મળશે અને આપણે ચિંતામુક્ત ગગનવિહારી પંખી બની શકીશું.

ચૈતન્યના મહાસાગર સાથે અનુભવેલું થોડુંક તાદાત્મ્ય જીવનમાં અમૃત વરસાવશે. જો આપણે સંનિષ્ઠ હોઈશું તો આપણા જીવનની આ એક અણમોલ સંપદા બની જશે.

- રાફ વાલ્ડો ટ્રાઇન

## આનંદમય જીવન જીવવા માટેની સામાજિક ભાબતો

જીવનમાં કેટલીક સામાન્ય ભાબતો પ્રત્યે જો ધ્યાન આપવામાં આવે તો કેટલાય કલહ-કંકાસ ઓછા થઈ જાય છે અને જીવન સુમેળ અને સંવાદિતાભર્યું બની જાય છે. એ માટે નથી કોઈ કિમત ચૂકવવાની કે નથી કોઈ વિશિષ્ટ સાધના કરવાની. ફક્ત નાની નાની ભાબતો પ્રત્યે જાગૃત બનીને પોતાની અંદર પરિવર્તન કરવાનું છે. એમાંની મુખ્ય ભાબતો આ પ્રમાણે છે :

### અંતરમાં ફેરફાર કરો :

આપણું જીવન તો છે આનંદની કુટિયા. એમાં આનંદ ને ફક્ત આનંદ જ રહેલો છે. પણ ભાગ્યે જ કોઈને એ આનંદ મળતો હોય છે. કેમ કે આ આનંદની કુટિયામાં મનુષ્યે પોતાના હાથેથી દુઃખને ઠાંસી ઠાંસીને ભરી દીધું છે. અપૂર્વા ઈચ્છાઓ, અધૂરા આવેગો, સત્તાની ભૂખો, ઈર્ધાની આગ, મોહ અને રાગની અતુપ્ત તરસો, કોધ અને લોભની આસુરી વૃત્તિઓ - આ બધાંથી ભરાઈ ગયેલી આ કુટિયામાં આનંદ તો ક્યાંય દટાઈ ગયો છે. એ આનંદને ફરીથી ઉપર લાવવાનો છે. એ માટે સર્વપ્રથમ મનુષ્યે પોતાની અંદર અવલોકન કરવું પડશે.

શ્રીમાતાજી કહે છે, “સધળી પરિસ્થિતિનું મૂળ તમારી અંદર જ છે. આજુબાજુનાં માણસો, સંજોગો, પરિસ્થિતિ એ તો દર્પણ છે.” આ દર્પણમાં આપણને આપણું પોતાનું જ પ્રતિબિંબ દેખાય છે. બહાર કોઈ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ હોય, તો ફરિયાદ કરવાને બદલે, દોડાદોડી કરવાને બદલે, માણસે પોતાની અંદર ઊતરીને તપાસવું જોઈએ કે ગૂંચ

ક્યાં રહેલી છે. જો જાતને ધાર્વાદી વગર સચ્ચાઈપૂર્વક માણસ અંદરમાં તપાસ કરે તો તેને ચોક્કસ ખબર પડે કે મુશ્કેલી અંદરમાં જ રહેલી છે. બહારની વિકટ પરિસ્થિતિનું કારણ બહાર નહીં પણ અંતરમાં જ રહેલું છે અને પછી અંદર ફેરફાર કરવાથી બહારની સ્થિતિ પણ બદલાઈ જાય છે. ધારો કે કોઈ માણસ આપણાં કાર્યોનો વારંવાર વિરોધ કરતો હોય, પ્રગતિમાં અવરોધ ઉભો કરતો હોય તો તેની સાથે ઝડપવાને બદલે આપણે આપણી અંદર જોવું જોઈએ તો અંદરમાં તેના પ્રત્યેનો અસદ્ભાવ આપણામાં ક્યાંક ઉડી રહેલો દેખાશે. પછી એને દૂર કરી તેના સ્થાને આપણે તેના માટે શુભેચ્છા મૂકી આપીએ તો એ વ્યક્તિ પછી આપણા બાધ્ય પ્રયત્નો વગર પણ બદલાઈ જશે અને તેનો વિરોધ પણ શરીરી જશે. આ રીતે આપણી અંદર ફેરફાર કરવાથી આપણે તો ચેતનામાં ઊંચે ચડીશું પણ સામેની વ્યક્તિ પણ એની ચેતનામાં ઊંચે ચડશે.

બીજું, દુઃખ અને મુશ્કેલીઓ માણસને જીવનમાં શીખવવા આવે છે. શ્રીમાતાજી કહે છે કે “તમારે જે શીખવાનું છે, તે તમે શીખી લો, જે મુશ્કેલીઓ પાર કરવાની છે, તે તમે પાર કરી લો તો પરિસ્થિતિ બદલાઈ જશે. દુઃખ આપોઆપ ચાલ્યું જશે. કોઈપણ મુશ્કેલી કે દુઃખ કાયમ ટકતાં નથી, એ સ્વીકારીને દુઃખથી હતાશ થયા વગર તેનો સામનો કરીને, તેમાંથી શીખવાનું શીખીને માણસ પોતાના અંતરમાં વિકાસ સાધે તો પછી બહારના સંજોગો તેની આંતર ચેતનાને અનુરૂપ બની રહે છે.

ઘણા માણસો એવી ફરિયાદ કરતાં હોય છે કે અમારે પણ જીવનમાં ઘણું ઘણું કરવું હતું, પણ અમને તક જ ન મળી. અમારા સંજોગો જ એવા પ્રતિકૂળ હતા કે કંઈ કરી શક્યા નહીં. આવી ફરિયાદ એ સ્વબચ્ચાવનું બહાનું છે. પોતાની જડતા અને આળસને ઢાંકવાનું

સારામાં સારું આવરણ છે. જેમને પોતાનું જીવન બનાવવું છે, જીવનમાં મહાન ધ્યેયને સિદ્ધ કરવું છે તેઓ સાનુકૂળ સંજોગોની ક્યારેય રાહ જોતા નથી. તેઓ તો પોતાને જે પરિસ્થિતિ મળી છે, એ પછી ગમે તેવી પ્રતિકૂળ કેમ ન હોય, તેમાંથી જ આગળનો પોતાનો રસ્તો બનાવે છે. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ કહે છે, “ફરિયાદ કરવાને બદલે તમારી અંદરની દિવ્યતાને પ્રગટ કરો, પરિસ્થિતિ આપોઆપ બદલાઈ જશે.” વળી તેઓ એમ પણ કહે છે, “તમારા ભાગ્યના ઘડવૈયા તમે પોતે જ છો. બધી જ સહાય અને શક્તિ તમને તમારી અંદર આપવામાં આવેલી છે. તેનો ઉપયોગ કરી તમારા ભાગ્યને તમે જ સરજો.” આમ, મનુષ્યે પોતાની અંદર રહેલી વૃત્તિઓ અને શક્તિઓ પ્રત્યે સજાગ બનવાનું છે. પોતાની અંદર રહેલી દિવ્યતાને પ્રગટ કરવાની છે. આ દિવ્યતા એ કંઈ દૂરની વસ્તુ નથી. એ આપણું પોતાનું જ સાચું સ્વરૂપ છે. એ સ્વરૂપ આનંદ, મેમ, શાન અને શક્તિથી સભર છે. પણ એ ઢંકાયેલું છે અને એને આપણે આપણા જીવનમાં પ્રગટ કરવાનું છે. એ પ્રગટ થયા પછી દુઃખ આપોઆપ ચાલ્યું જશે. કેમ કે દુઃખ એ બહારનું છે. આપણું પોતાનું નથી. થોડો પણ સાચા દિલથી મ્રયલ કરતાં આપણને આપણી પોતાની એવી વસ્તુઓ કે જે સમગ્ર જીવનને આનંદથી ભરી દે છે, તે મળી જાય છે.

## વર્તમાનમાં જીવો :

જીવનની પ્રત્યેક ક્ષણ નિત્યનૂતન છે. અનોખી છે. એક ક્ષણ જેવી જ બીજી ક્ષણ હોતી નથી. સમગ્ર વિશ્વમાં ક્ષણો ક્ષણો પરિવર્તન થતું રહે છે. એક મિનિટ પહેલાં જગત જ્યાં હતું ત્યાં એક મિનિટ પછી હોતું નથી. નદીના વહેતા પાણીમાં આપણે થોડીવાર ઊભા રહીએ તો તેટલામાં કેટલું બધું જળ વહી જાય છે ! એ કંઈ પાછું આવતું નથી. તેમાં દરેક ક્ષણો નવું જ જળ આવે છે. એટલે જ એમાં તાજગી છે. ચૈતન્ય છે.

આપણા જીવનનું પણ એવું જ છે. પ્રત્યેક ક્ષણે એનું જળ પણ બદલાતું રહે છે. એટલે કે ક્ષણ પહેલાં આપણે જે હતા તે ક્ષણ પછી નથી હોતા. અલભત આપણાં બાધ્ય સ્વરૂપમાં દેખીતો એવો ફેરફાર જગતાનો નથી પણ સૂક્ષ્મ રીતે તો એમાં પણ ફેરફાર થતો હોય છે. અને ચેતનામાં તો ઘણું બધું પરિવર્તન થઈ જતું હોય છે. જેમને આ ચૈતન્યના વહેતા પ્રવાહમાં તરતાં આવે છે, એટલે કે જેમને પ્રત્યેક ક્ષણમાં જીવતાં આવે છે, તેઓ જીવનનો ભરપૂર આનંદ લઈ શકે છે.

ક્ષણમાં જીવવું એટલે શું ? આમ તો આપણે આપણી અંદર યુગોને લઈને જીવીએ છીએ. આપણી અંદર જન્મોજન્મના સંસ્કાર રહેલા હોય છે અને આખી શાશ્વતી આપણી અંદર પડેલી છે. તો પછી એને ક્ષણમાં કેવી રીતે બાંધી શકાય ? અને ક્ષણમાં કેવી રીતે જીવી શકાય ? ઉંડો વિચાર કરવાથી એ ક્ષણ પણ શાશ્વતીની જ ક્ષણ છે, કોઈ અલગ સમયખંડ નથી એવું લાગે છે. તો ક્ષણમાં જીવવું એનો અર્થ એ કે પ્રત્યેક ક્ષણમાં અસ્તિત્વનો આનંદ લેવો. આપણે જે કાર્ય કરતાં હોઈએ તે મય બની રહેવું. એ કાર્યમાં આપણી સમગ્ર ચેતના રેડી દેવી. એ રીતે કાર્ય કરવાથી કાર્યનો આનંદ મળે છે. ચેતનાના વિકાસનો આનંદ મળે છે.

ક્ષણમાં જીવવું એનો બીજો અર્થ એ કરી શકાય કે આપણે જ્યાં હોઈએ ત્યાં જ પૂરેપૂરા હોવું. આપણું સમગ્ર અસ્તિત્વ અખંડપણે એ જ સ્થળે હોય, ત્યારે આપણે એ ક્ષણમાં પૂરેપૂરા જીવતાં હોઈએ છીએ. પણ મોટેભાગે આવું બનતું હોતું નથી. આપણી ચેતના અખંડ હોતી નથી. સ્થળે સ્થળે વિખરાયેલી હોય છે. વિદ્યાર્થીઓ બેઠા હોય છે વર્ગમાં, પણ એમનું ચિત્ત તો કિકેટના મેદાનમાં હોય છે. નોકર ઘરમાં કામ કરે છે પણ યંત્રવત્ત, એનું ચિત્ત એની ઝૂંપડીમાં હોય છે. આ રીતે દરેક મનુષ્ય મોટેભાગે વહેંચાયેલો જ હોય છે. આથી તેને અખંડિતતાનો અને કાર્યની

પૂર્ણતાનો આનંદ મળતો નથી.

કાણમાં જીવવું એનો ત્રીજો અર્થ એ કરી શકાય કે એ જ કાલખંડમાં પૂરેપૂરું હોવું. એ કાણમાં જ સમગ્ર અસ્તિત્વથી હોવું. મોટેભાગે મનુષ્ય એ કાણમાં અખંડપણે હોતો નથી. કાં તો એ ભૂતકાળમાં હોય છે. કાં તો ભવિષ્યકાળમાં, કેટલો બધો ભૂતકાળ માણસના નાનકડા મનમાં સંગ્રહાયેલો હોય છે ! ભૂતકાળની સુખદ સ્મૃતિઓને વાગોળવામાં આનંદ લે છે તો દુઃખદ સ્મૃતિઓથી દુઃખી પણ થતો રહે છે. ભૂતકાળનો આટલો બધો ભાર મનમાં રહેતો હોય તો એ મન તાજું કેવી રીતે રહી શકે ? ભૂતકાળ ભલે ગમે તેટલો ભવ્ય અને મહાન હોય પણ તે શેરડીનો રસ કાઢી લીધેલા કૂચા જેવો જ બની જાય છે. માણસો એ કૂચામાંથી રસ મેળવવા ફરી ફરી ચૂસ્યે જાય છે અને વર્તમાન હાથમાંથી સરતો જાય છે. અલબતા, ભૂતકાળમાંથી મનુષ્યે બોધપાઠ જરૂર લેવાનો છે. પણ એમાં જ ડુબેલા રહેવાનું નથી. તેણે વર્તમાનનાં કાર્યો દ્વારા ઉજજવળ ભવિષ્યનું નિર્માણ કરવાનું છે. ઘણા માણસો ભવિષ્યની રંગીન કલ્યનાઓમાં રાચતા હોય છે. અલબતા, ભવિષ્યનાં કાર્યોનું આયોજન કરવું ખૂબ જરૂરી છે. એથી સાધન, સમય ને શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરી શકાય છે. પણ એનાં સ્વભાંઓમાં રાચવું અને વર્તમાનમાં કાર્યો ન કરવાં એ અક્ષમ્ય છે. મનુષ્ય પાસે જે છે, તે વર્તમાન કાણો જ છે. ભૂતકાળ પસાર થઈ ગયો છે. ભવિષ્ય તેના હાથમાં નથી. તો પછી જે હાથમાં છે, તેનો જ શ્રેષ્ઠતમ ઉપયોગ તેણે કરી લેવો જોઈએ.

ઘણીવાર ભૂતકાળમાં બગડેલા સંબંધો યાદ રાખીને માણસો પોતાના જીવનમાં કડવાશ ઊભી કરી દેતા હોય છે. ભૂતકાળમાં કોઈએ કહેલા આકરા શબ્દો માણસ જિંદગીભર પોતાના મનમાં સંગ્રહી રાખે છે અને સમયે સમયે તેનો ઉપયોગ કરતો રહે છે. કેટકેટલી કડવાશ,

ગાંઠો, પૂર્વગ્રહો મનુષ્ય પોતાના મનમાં સંગ્રહતો રહે છે. જાણો મન એ તો ભૂતકાળના કચરાને સંગ્રહવાનું સ્થળ ! જ્યાં આવો કચરો સંગ્રહાયેલો હોય ત્યાં તાજગી અને આનંદ કેવી રીતે ઉદ્ભલવે ? ભૂતકાળમાં કોઈએ આપણને કંઈ કહ્યું હોય, તો તે ક્ષણ પૂરતું એ બરાબર હોય. પણ પછી દરેક વખતે એ યાદ રાખીને એનું અને આપણું મન બગાડ્યા કરવાનું ? હકીકતમાં તો તે અને આપણો - કહેનાર અને સાંભળનાર બંને બદલાઈ ગયાં હોય છે. એના એ હોતાં જ નથી તો પછી શબ્દોને પકડીને દુઃખી શા માટે થવું જોઈએ ? આથી જો જીવનમાં સાચી રીતે સુખશાંતિ જોઈતાં હોય તો ભૂતકાળનો ભાર ખંખેરી નાંખવો જોઈએ. ભવિષ્યની નિરર્થક ચિંતાઓ દૂર કરી દેવી જોઈએ. પોતાની ચેતનાની કક્ષા અનુસાર થઈ શકે તેટલો વર્તમાનનો શ્રેષ્ઠ ઉપયોગ કરી ચૈતન્યના નિરંતર વહેતા પ્રવાહમાં વહ્યાં કરવું જોઈએ. તો નિત્યનૂતન તાજગી અને પ્રકુલ્પિતતા મળે છે.

### બીજાંઓમાં રસ લો :

જીવનને સ-રસ અને સુમધુર બનાવવું હોય તો બીજાંઓનાં જીવનમાં રસ લેવો જોઈએ. જેઓ બીજાઓના જીવનમાં રસ લે છે. બીજાંઓના વિકાસમાં સહાય કરે છે, તેમના રસનાં ઝરણાં ક્યારેય સુકાતાં નથી. તેમની આંતરિક સહાયના સોતો ક્યારેય અટકતા નથી. રસથી છલકાતા, પ્રેમથી ભરપૂર, ચૈતન્યથી તરબોળ એવા જીવનનો આનંદ સ્વાર્થી અને સ્વકેન્દ્રી મનુષ્યો લઈ શકતાં નથી. જેઓ ફક્ત પોતાનો જ સ્વાર્થ જુએ છે, પોતાનું જ છિત વિચારે છે. તેમની દસ્તિ સંકુચિત જ રહે છે. તેમની ચેતનાનો પરિધ એમના નાનકડા અહુ પૂરતો જ મર્યાદિત રહે છે. એમની આંતર શક્તિઓ સીમિત જ રહે છે અને પ્રભુની સમૃદ્ધિના દરવાજાઓ એમના માટે બંધ જ રહે છે. સ્વાર્થી મનુષ્યો દુન્યવી રીતે પોતાનો સ્વાર્થ સાધવામાં સફળ બની સમૃદ્ધ

મેળવી શક્યા હોય, પણ આંતરિક રીતે તો તેઓ દરિદ્ર જ રહે છે. ભલે તેમની પાસે બાધ્ય સત્તા કે સંપત્તિ હોય, પણ પોતાનું દિલ ખોલી શકે તેવા મિત્રો તેને મળતા નથી. કોઈ તેનો વિશ્વાસ કરતું નથી. ઘરના સભ્યો પણ નહીં. કોઈનો સાચો પ્રેમ સ્વાર્થી મનુષ્યો મેળવી શકતા નથી. આવા મનુષ્યો એકલતાથી પીડાતા હોય છે. તેમનું આંતરિક જીવન સત્ત્વહીન હોય છે. આવા જીવનમાં ક્યારેય સાચું સુખ મળતું નથી.

જેઓ નિઃસ્વાર્થ ભાવે બીજાંઓની સેવા કરે છે, તેમની આંતરચેતનાનો આપોઆપ વિસ્તાર થાય છે. સ્વનો વિસ્તાર એટલે સેવા. જેઓ બીજાંઓના દુઃખને દૂર કરવા માટેનો પ્રયત્ન કરે છે, એમના જીવનના દુઃખો ભગવાન દૂર કરી દે છે. એટલે સેવા કરનારાઓ અનેક પ્રકારના દુઃખોમાંથી, એમને પોતાને પણ ખબર ન પડે તે રીતે ઊગરી જાય છે. જેઓ બીજાંના જીવનને આનંદથી ભરી દેવા માટે પોતાનાં તન, મન અને ધનનો ઉપયોગ કરે છે, એમને પોતાને આનંદ મેળવવાના કોઈપણ બાધ્ય પ્રયત્ન કર્યા વગર આપોઆપ આનંદ મળે છે. સૂક્ષ્મ જગતનો એ નિયમ છે કે વ્યક્તિ બીજાને જે આપે છે, તે પોતાને મળે છે. કેમ કે ચેતનાની દસ્તિએ તો અલગતા છે જ નહીં, આમ આનંદ તો મળે જ છે, પણ સાથે સાથે નિઃસ્વાર્થ સેવાના ફળરૂપે તેની પોતાની ચેતનાનો વિકાસ થાય છે. તેની આંતરશક્તિઓ ખીલે છે. આંતરિક જીવન સમૃદ્ધ અને ભર્યું ભર્યું રહે છે.

કદાચ બીજાંઓની નિઃસ્વાર્થ સેવા કરવાનો સમય કે શક્તિ ન હોય, તો જે કોઈ આવાં શુભ કાર્યો કરી રહ્યાં હોય તેમને શુભેચ્છાઓ આપી, તેમને શક્ય તેટલી મદદ કરી શકાય. ઉપરાંત બીજાંઓનાં સદ્ગાર્યોને બિરદાવી શકાય.

કોઈ આગળ વધવા પ્રયત્ન કરી રહ્યું હોય તેને ગ્રોત્સાહન આપીને તેના આગળ વધવાના માર્ગમાં બળ પૂર્ણ પાડી શકાય, કોઈએ

સારું કાર્ય કર્યું હોય તો તેની કદર કરી શકાય, અભિનંદન પાઠવી શકાય. વળી કોઈ દુઃખમાં કે મુશ્કેલીમાં હોય તો સાંત્વના આપી શકાય. આ બધું કરવામાં કોઈ ખર્ચ થતો નથી. એટલો સમય પણ આપવો પડતો નથી. પણ તેમાં મનની વિશાળતા, હૃદયની ઉદારતા અને ચિત્તની પ્રસન્નતા જોઈએ. જેઓ આ રીતે બીજાંઓમાં રસ લઈ અન્યના વિકાસમાં સહાયભૂત થાય છે, તેઓનું જીવન આનંદ અને ઉલ્લાસથી ભર્યું ભર્યું બની જાય છે.

### સાચાં બનો :

સાચો આનંદ મેળવવા માટે સાચાં બનવું જોઈએ. અને સાચાં બનવું એટલે પોતાની જાતનો ઢાંકપિછોડો કરવો નહીં. જાતને છાવરવી નહીં. પોતે જેવાં હોય તેવાં જ દેખાવું. બહાનાં બતાવવાં નહીં. પોતે કરેલાં ખોટાં કામને સાચું ઠેરવવા દલીલો કરવી નહીં. પોતે ન હોય છતાં મોટાઈ બતાવવાનો પ્રયત્ન કરવો નહીં. આ છે સાચાં બનવું.

વાસ્તવમાં માણસોને દેખાવ કરવો ખૂબ જ ગમતો હોય છે. પોતે જે છે, એના કરતાં વધારે શ્રીમંત, વધારે મહાન કે વધારે વિદ્વાન દેખાય તે માટે સતત પ્રયત્ન કરતાં રહે છે. જે નથી તે બતાવવા માટે માણસોનો ઘણો સમય અને શક્તિ ખર્ચાઈ જતાં હોય છે. એ માટે તેમને અનેક પ્રયત્નો કરવા પડતા હોય છે. એ માટે એમને કાવાદાવા ને પ્રપંચો આચરવા પડે છે. શ્રીમાતાજી કહે છે, “માણસોના વ્યવહારમાં ધોર અસર્યાઈ રહેલી હોય છે.” કહેવું કંઈક અને કરવું કંઈક, એક કામ કરવાનો દેખાવ કરવો ને કરવું કંઈક બીજું જ કામ, પોતાની ઈચ્છા ન હોય કે પોતાને ગમતું ન હોય અને છતાં પોતાને બહુ જ પસંદ છે ને પોતાની ખૂબ જ ઈચ્છા છે, એમ કહેવું. - આ બધું સર્યાઈથી વેગળું છે. આ રીતે જોતાં તો મોટાભાગના માણસોમાં કયાંક નાની સરખી પણ અસર્યાઈ રહેલી જોવા મળે છે.

સાચાં કેવી રીતે બની શકાય ? એ માટેનું માર્ગદર્શન આપતાં શ્રીમાતાજી કહે છે, “પોતાની જાતને છેતરવા કદી પ્રયત્ન ન કરવો. તમારા સ્વરૂપના બીજા કોઈપણ ભાગને સમજાવી દેવાની રીત શોધી કાઢવા રજા ન આપવી. પોતાને જે કરવું હોય તે કરવા માટે બીજાને અનુકૂળતાથી સમજાવવા માટે કોઈ બહારનું તૈયાર ન રાખવું. કોઈ વસ્તુ અણગમતી બને ત્યારે પોતાની આંખોને બંધ ન રાખવી. કોઈપણ વસ્તુને એવી રીતે ધ્યાન બહાર જવા ન દેવી, એમ કહીને કે આ બહુ અગત્યનું નથી. પછીથી વધારે સારું કરીશ.” - આટલી બાબતોનું ચોકસાઈથી પાલન કરવાથી મનુષ્ય સાચા દિલનો બની શકે છે. આવા મનુષ્યને ક્યાંય કશું છુપાવવાનું હોતું નથી. કોઈ દેખાવ કરવાનો હોતો નથી. કંઈ બનવાનું હોતું નથી. એટલે તે સહજપણો આનંદથી જીવે છે. શ્રીમાતાજી કહે છે કે ‘સાચાં બનવામાં એક અદ્ભુત આનંદ રહેલો છે. સચ્ચાઈપૂર્વક કરેલા દરેક કાર્યમાં તેનું પારિતોષિક રહેલું છે. વિશુદ્ધિની, ઉર્ધ્વમાં ઉડ્યનની અને મુક્તિની લાગણી રૂપે તો એ પારિતોષિક છે જ પણ અસત્યના એક નાનકડા અંશને દૂર કર્યાનો પરમ સંતોષ મળે છે. અને જીવનમાં ઉત્તરી આવતી પ્રભુની હાજરી એ તો મોટામાં મોટું પારિતોષિક છે.

### શાંત રહો :

શાંત રહેવું એટલે કોઈપણ પરિસ્થિતિમાં વ્યગ ન બનવું. બહાર ગમે તેવું તોફાન હોય, પણ અંતરમાં સહેજ પણ ખળખળાટ કે કોઓ ન થાય, તેવી આંતરિક સ્થિતિને શાંત રહેવાની સ્થિતિ કહી શકાય. પણ સામાન્ય રીતે મનુષ્યોનો સ્વભાવ નાની નાની બાબતોમાં ચિંતા કરવી, ધાર્યું ન થાય તો ગુસ્સે થઈ જવું, બીજાં કંઈ બોલે તો બેચેન બની જવું. - આવા પ્રકારનો હોય છે. આવો સ્વભાવ હોય તો મનુષ્યો પોતાની અંદર શાંત કે સ્થિર રહી શકતા નથી. તેઓ પોતે તો અશાંતિને લઈને

હુઃખી થતા રહે છે, પણ બીજાંઓને પણ હુઃખી કર્યા કરે છે. પરંતુ વારંવાર ગુસ્સો કરવો, અશાંત બની જવું, વ્યગ્ર બનવું એ સ્વભાવની મોટામાં મોટી નબળાઈ છે. નબળા મનના અને ભીરુ પ્રકૃતિના લોકો જ વારંવાર ઉશ્કેરાઈ જતા હોય છે. જ્યારે શક્તિશાળી અને સુદૃઢ મનવાળા લોકો પોતાનાં વાણી અને વર્તન પર કાબૂ ધરાવી શકે છે. અશાંત મનવાળા મનુષ્યોનું જીવન પણ અસ્થિર હોય છે. તેઓ કોઈનો વિશ્વાસ પણ સંપાદન કરી શકતાં નથી. આથી સર્વપ્રથમ જરૂરિયાત છે શાંત બનવાની.

શાંત બનવા અંગે શ્રીમાતાજી કહે છે, “શાંત બનો એમ હું જ્યારે કહું છું ત્યારે મારા કહેવાનો ભાવાર્થ એ હોય છે કે ઉશ્કેરાટભર્યા, બેચેનીવાળા, કૃષ્ણ કરે તેવા વિચારો બંધ કરવાની કોણિશ કરો. મનને શાંત કરો. તમારી સર્વ પ્રકારની કલ્પનાઓમાં, માનસિક રચનાઓમાં ભટકતા મનને અટકાવી દો.” પરંતુ મન સહેલાઈથી શાંત થતું નથી. પ્રયત્ન કરવો પડે છે. અને મન શાંત થયા પછી પ્રાણમય સ્વરૂપમાં શાંતિ સ્થાપવાની છે. આવેગો, કામનાઓ, ભૂખો - આ બધું પ્રાણમય સ્વરૂપમાંથી ઉપર આવ્યા જ કરતું હોય છે. એના પ્રમાણે વર્તન કરવાથી માણસની સ્થિતિ પવનથી ઊરી રહેલાં પાંદડાં જેવી થાય છે. જે દિશામાં આવેગનો પવન ઘસડી જાય એ દિશામાં એ ગતિ કરે છે. આવા તરંગો પરના અસ્થાયી જીવનમાં કશી પ્રગતિ થઈ શકતી નથી. કોઈપણ પ્રકારની સફળતાનો પાયો શાંતિમાં રહેલો છે.

પરંતુ આ શાંતિ ઉપર ઉપરથી સ્થપાયેલી કે બહારના ભયથી લાદેલી ન હોવી જોઈએ. ઘણી વખત માણસ ઉપરથી તો શાંત દેખાતો હોય છે. પણ અંદરથી ધૂંધવાતો હોય છે, ખળખળતો હોય છે. તો આ સાચી શાંતિ નથી. શાંત રહેવાનો માત્ર દેખાવ જ છે. સાચી શાંતિ તો આપણી ચેતનાની એક સ્થિતિ છે. એ પ્રાપ્ત કર્યા પછી બહારનાં કોઈ

પરિબળો અને ખળભળાવી શકતાં નથી. આ સંદર્ભમાં શ્રીઅરવિંદ કહે છે, “શાંતિ અને નીરવતા અંતરના ઊંડાણમાં સ્થાપિત થવાં જોઈએ જેથી બહારથી કંઈ આવે તે સપાટી પરથી પસાર થઈ જાય. અંદરમાં દફપણે સ્થપાયેલી શાંતિને બિલકુલ અસર ન કરી શકે.” આવી શાંતિ કેવી રીતે સ્થાપી શકાય? એ માટે સર્વમથમ તો આપણાને એ શાંતિની જરૂરિયાત જણાવી જોઈએ. ખાલી વાતોમાં નહીં, ઉપર ઉપરથી પણ નહીં. પણ આપણા સમગ્ર અસ્તિત્વમાંથી એ શાંતિ માટેની જંખના ઊઠવી જોઈએ. આ સ્થિતિમાંથી આપણે જો શાંતિ માટે પોકાર કરીએ તો તે આપણા અંતરમાંથી જ પ્રગટ થાય છે. શ્રીમાતાજી કહે છે કે “જો તમે તમારા અંતરમાં શાંતિ માટેની માંગણી કરશો તો તે જરૂર આવશે. કેમ કે, એ તમારા સ્વરૂપના ઊંડાણમાં રહેલી છે. તે તમારા સમગ્ર સ્વરૂપમાં રહેલી છે. છેક સ્થૂલ શારીરિક ચેતના સુધી.” પણ તે માટેની તીવ્ર જરૂરિયાત હોવી જોઈએ. અને તો પછી આપણે જેમ મિત્રને બોલાવીએ તેમ શાંતિને બોલાવવી જોઈએ. તો તે જરૂર આવે છે. તેમ શ્રીમાતાજી કહે છે. પછી આપણે તેને આપણી અંદર ટકાવી રાખવી જોઈએ. પછી તે આપણી ચેતનાનો ભાગ બની જાય છે, અને ક્યારેય આપણાને છોડી જતી નથી. જેમને આ અનુભવ થાય છે, તેઓને પછી બહારના કોઈપણ સંજોગો વિચલિત કરી શકતા નથી. આથી શ્રીમાતાજી કહે છે, “હંમેશાં સ્થિર અને શાંત રહેવાનો પ્રયત્ન કરો. તમારા સ્વરૂપમાં વધુ ને વધુ શાંતિનું સ્થાપન થવા દો. મનને વધારે સક્રિય ન બનાવો. ગોટાળામાં જીવન ન જીવો. વસ્તુઓના બાબુ આભાસો પરથી નિર્ણયો બાંધવાના કૂદકાન મારો. એકાગ્ર બનો.” આથી સાચી શાંતિની સ્થિતિ પ્રાપ્ત થશે. એ સ્થિતિના આનંદની વાત કરતાં શ્રીઅરવિંદ કહે છે, “આ શાંતિમાં જે આનંદ રહેલો છે, તે બહારનો કોઈપણ પદાર્થ આનંદ આપી શકે તે કરતાં ઘણો વધારે છે. આ આનંદની સરખામણી બીજા કોઈ આનંદ સાથે કરી શકાય નહીં.”

## હઠી જવું :

હઠી જવું એટલે ચેતનાની જે સ્થિતિમાં હોઈએ તેનાથી ઉપર ચાલ્યા જવું કે અંતરમાં ઉતારી જવું. સામાન્ય રીતે સામૂહિક જીવનમાં પરસ્પર વ્યવહારમાં મનુષ્યોને એકબીજા સાથે મતભેદ, બોલાચાલી, ઉગ્ર ચર્ચાઓ અને સંઘર્ષથતાં હોય છે. ક્યારેક તો નાની એવી બાબતમાં મોટો ઝડપો થઈ જાય છે અને સંબંધો કાયમના તૂટી જાય છે, ક્યારેક એક માણસ ગુસ્સે થઈને ન બોલવાના શબ્દો બોલે છે અને તેની પ્રતિક્રિયારૂપે સામો માણસ પણ ઉગ્ર બની બોલવા મંડે છે ને વાગ્યુદ્ધ શરૂ થાય છે. આવા સમયે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે શ્રીમાતાજીએ એક સૂત્ર આપ્યું છે કે - હઠી જતાં શીખો - એટલે કે તમે એ પરિસ્થિતિથી અલગ થઈને તમારા અંતરમાં ચાલ્યા જાવ. અંતરમાં શાંતિ, પ્રેમ, સંવાદિતા છે, ત્યાં તમે થોડી કાણો ડૂબકી લગાવી દો. પછી પાછા તમે જ્યારે સપાટી ઉપર આવશો ત્યારે તમારી સ્થિતિ બદલાઈ જતાં બહારની પરિસ્થિતિનું જોર ઓછું થઈ ગયું હશે. તમારા ઉપર એની કંઈ અસર નહીં થાય. અને તમે કોઈ પ્રતિક્રિયા નહીં આપો એટલે સામી વ્યક્તિ પણ શાંત થઈ જશે. પરિસ્થિતિ કાબૂમાં આવી જશે. તમારા શાંતિનાં અને સંવાદિતાનાં આંદોલનોની અસર સામેની વ્યક્તિ ઉપર થશે. આમ, કોઈ ગુસ્સો કરે, દ્વેષ કરે, ખરાબ બોલે ત્યારે સામો એ જ રીતનો પ્રતિભાવ આપવાને બદલે હઠી જવું. એટલે કે અંતરમાં ચાલ્યા જવું. આથી વિખવાદને બદલે સુમેળ, સંઘર્ષને બદલે શાંતિ સ્થપાશે.

આ ઉપરાંત કોઈપણ પ્રકારનો નિર્ણય લેવો હોય તોપણ અંતરમાં ઉત્તર્યા વગર, એમ ને એમ ઉતાવળે લેવો નહીં. અંતરને પૂછજ્યા વગર નિર્ણય લેવો નહીં. અલબત્ત, અંતરમાંથી જવાબ મેળવવા માટે ખૂબ શાંતિ અને ધીરજ રાખવાં પડે છે. પણ એકવાર શાંતિનું સ્થાપન થઈ ગયા પછી અંતરમાંથી દરેક બાબતના જવાબ મળતા રહે છે. પણ

ઘણીવાર આ જવાબ આપણા સપાઈ પરના મનને ન રૂચે તેવા પણ હોય છે. અને મન અનેક બહાનાં બતાવી એ જવાબનો અસ્વીકાર કરવા પણ આપણને સમજાવતું રહે છે. પણ જેઓ સભાન છે તેમને મન છેતરી શકતું નથી. અંતરમાંથી આવતા જવાબો હંમેશાં આપણું હિત કરનારા જ હોય છે. એ પ્રમાણે આચરણ કરનારને ક્યારેય પસ્તાવું પડતું નથી. આ રીતે કેટકેટલી વિટંબણાઓમાંથી બચી જવાય છે. અને જીવન ઘણું જ સરળ અને સંવાદિતાબર્યું બની જાય છે.



“જે માણસો હંમેશાં પ્રસન્નચિત રહે છે તે આધ્યાત્મિક દસ્તિથી વધુ પરિપક્વ હોય છે. પોતાના પ્રત્યેક કદમ અંગે તેઓ શ્રદ્ધાવાન હોય છે. તેમનું મધુર સ્મિત તેમને મળવા આવનાર વ્યક્તિ પર જાહુઈ અસર કરે છે.

પ્રસન્ન મન તથા સમતોલ સ્વભાવવાળી વ્યક્તિઓને પોતાનું ડગ પાછું ભરવાનો પ્રસંગ જ નથી આવતો. કેમ કે તેઓ તો જાતે જ જીવનના આનંદની ખોજમાં વ્યસ્ત હોય છે અને તેઓ ઉત્કટપણે ઈચ્છાતા હોય છે કે અન્ય વ્યક્તિઓ પણ તેમને અનુસરે. નિશ્ચિત રૂપથી તેમને એકાંતમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો અવસર મળે છે. પણ જ્યારે તેમના ધ્યાનનો સમય પૂરો થઈ જાય છે ત્યારે તે ભગવાનને એક ખૂણામાં ધૂપદાનીની રાખ પાસે છોડી દેતા નથી પણ સમાજમાં પોતાના વ્યવહારમાં સદાયે તેમની પોતાની સાથે રાખે છે. એમની ચમકતી આંખો, હસતો અને પ્રેમાળ ચહેરો હજારો ધાર્મિક ઉપદેશોની સરખામણીમાં આધ્યાત્મિક તથનું કાંઈક વધુ સ્પષ્ટતાપૂર્વક વિવરણ કરે છે.”

- મોન્ટી કોકિન

## આનંદમય જીવન માટે ત્યાગ કરવાની બાબતો

જીવનને કેવું બનાવવું એ દરેક વ્યક્તિના પોતાના હાથની વાત છે. એમાં જરૂર છે ફક્ત જાગૃત દસ્તિ અને આંતર સૂજાની. આનંદમય જીવન માટે આપણો જીવનમાં અપનાવવા જેવી છ સામાન્ય બાબતો જોઈ. પણ ઘણી નકામી વસ્તુઓથી આપણી ચેતનાને જો ખાલી કરી દઈએ તો આનંદ અને શાંતિ આપણા જીવનમાં સ્થાયી બને. આ સંદર્ભમાં એક સૂઝી ગુરુની કથા છે. ગુરુ પાસે શિષ્ય જ્ઞાન લેવા આવ્યો. ગુરુ જ્ઞાની હતા. શિષ્યને જોઈને જ અની કક્ષા જાણી ગયા. એમણે શિષ્યને પોતાની સાથે ચા પીવા બેસાડ્યો. પહેલાં પોતાનો ખાલો ભર્યો અને પછી શિષ્યનો ખાલો ભર્યો. એ ભરાઈ ગયો, તોપણ તેઓ તેમાં ચા રેડતા જ રહ્યા. શિષ્યે તેમને રોકતાં કહ્યું, “ખાલો ભરાઈ ગયો હવે ચા ઢોળાઈ જાય છે.” ત્યારે ગુરુએ તેને કહ્યું, “તું પણ આ ખાલાની જેમ જ ભરેલો છે, હું તને શું જ્ઞાન આપું ?” આપણી ચેતનામાં પણ અનેક નકામી વસ્તુઓ ભરેલી હોય તો દિવ્ય વસ્તુઓ શી રીતે આવે ? દિવ્ય વસ્તુઓને ઉતારવા માટે આપણો નિઝન વસ્તુઓનો ત્યાગ કરવો પડે છે. જેમાંની મુખ્ય આ પ્રમાણે છે.

### આણસનો ત્યાગ કરવો :

જીવનની પ્રગતિમાં મોટામાં મોટું અવરોધક પરિબળ હોય તો તે આણસ છે. આણસ એટલે શક્તિ હોવા છતાં કંઈ જ ન કરવાની વૃત્તિ. પડ્યા રહેવાની વૃત્તિ. શ્રીમાતાજી કહે છે કે “આણસુપણામાં એક જાતની અશુભ ભાવના રહેલી હોય છે. પ્રયત્ન કરવાનો ઈન્કાર રહેલો

છે. તેમાં પ્રગતિનો વિરોધ છુપાયેલો છે. તેમાં એક જાતની શિથિલતા રહેલી છે. તમસ છે.” આળસુ મનુષ્યની પ્રકૃતિ તમોગુણી હોય છે. તેથી તેમને કંઈ પણ કામ કરવું ગમતું નથી. બસ પડ્યા રહેવું ગમે છે. વળી આ આળસ શરીરમાં જ રહેલી છે, એવું નથી એ મનમાં અને પ્રાણમાં પણ રહેલી હોય છે. તેથી તેમનામાં કોઈ જાતનો ઉત્સાહ હોતો નથી. એવું નથી કે કાર્ય કરવાથી પોતાને મળનારા લાભોની તેમને ખબર નથી. પણ જાણતા હોવા છતાં તેઓ કંઈ કરતા નથી. જો કંઈ કામ કરવાનું આવે તો તેઓ પરાણો ન છૂટકે કરે છે. અને જેમ તેમ પૂરું કરી નાંખે છે. તેમને મહેનત કરવી બિલકુલ ગમતી નથી. એટલે જીવનમાં તેઓની પ્રગતિ અટકી જાય છે. આળસની સામે ચેતવણી આપતાં શ્રીમાતાજી કહે છે, “જો તમે આળસુ હશો તો તેનાં માઠાં પરિણામ તમારે ભોગવવાં પડશો. આળસુ લોકોને જીવનમાં બીજાં કરતાં દશ ગણું વધારે વૈતરું કરવું પડે છે. કારણ કે તેઓ દરેક કામ ખરાબ રીતે કરતા હોય છે. તેથી એ કામ એમને ફરીથી કરવું પડે છે.”

આપણાં શાસ્ત્રોમાં આળસને મનુષ્યની અંદર રહેલા શત્રુ સમાન ગણી છે. જેમ દુશ્મન પોતાના શત્રુને બંદી બનાવીને કિલ્લામાં કેદ કરી તેની શક્તિઓને કુંઠિત કરી નાંખે છે, એમ આળસ માણસને જડતાના કિલ્લામાં પૂરીને એવો બંદી બનાવીને તેની શક્તિઓ હણી લે છે કે પછી તેનામાં ઊભા થવાની પણ હોંશ રહેતી નથી. તમસમાં પુરાયેલાં જીવનમાં ઉજાસ આવતો નથી અને એમાંથી બહાર નીકળવાની તમના પણ રહેતી નથી. વળી આળસ અજગર જેવી છે. તે મનુષ્યને એવો ભરડો લે છે કે પછી જીવનભર એમાંથી છૂટી શકતું નથી. આથી કોઈપણ રીતે મનુષ્યે પોતાની અંદર રહેલા આ શત્રુને હાંકી કાઢવો જ જોઈએ. એ માટે સરળ રસ્તો બતાવતાં શ્રીમાતાજી કહે છે, “જો તમારી પ્રકૃતિ તામસિક હોય તો તમારે આ રીતે કરવું, તમારી જાતને ઢંઢોળો, સાટકો

લગાવો અને કહો, ‘તારે આગળ વધવાનું છે’ અને જો તમારી આજસ તમને એમ કરવાની ના પાડે તો તમારે એનાથી વધારે થકાવનારી કોઈ વસ્તુ કરવી અને તમારી જાતને કહેવું, ‘એમ તારે આ કસરત નથી કરવી ? તો ઠીક છે. તારે બે કિલોમિટર દોડવું પડશે. તારે આ ચોપડી નથી વાંચવી ? તો ઠીક છે, આનાથી વધારે અધરી આ ચોપડી વાંચવી પડશે.’ આમ આજસુ પ્રકૃતિ ગમે તેટલો વિરોધ કરે, તોપણ તેને ગણકાર્યા વગર, પોતાની જાત ઉપર ખોટી દયા રાખ્યા વગર જો તેને કામે લગાડી દેવામાં આવે તો જડતા અને તમસ ઓછાં થવાં લાગે છે, અને આજસ દૂર થાય છે. આજસ દૂર થતાં જીવનમાં ઉત્સાહ આવે છે. કાર્યો સફળ થાય છે અને પ્રગતિનો આનંદ મળતાં જીવન સાર્થક જણાય છે.

## ઈર્ધા અને દ્વેષનો ત્યાગ :

અન્યનો ઉત્કર્ષ જોઈને દુઃખી થવાની અને એ ઉત્કર્ષમાં અવરોધ ઊભો કરવાની જે વૃત્તિ મનુષ્યની અંદર રહેલી છે, તેનું નામ ઈર્ધા. ઈર્ધા અજિન છે. જેનામાં એ પ્રવેશે છે, તેને એ બાણે છે. અને તેનાં સુખશાંતિ હરી લે છે. મોટેભાગે એક યા બીજા પ્રકારની ઈર્ધા માણસની અંદર દેખીતી રીતે કે અદશ્ય રીતે રહેલી હોય છે જ. પડોશીના સુખની ઈર્ધા, પોતાની સાથે કામ કરનારની આવડતની ઈર્ધા, ધંધામાં એક ઉદ્ઘોગપતિની સફળતાની બીજા ઉદ્ઘોગપતિને થતી ઈર્ધા, રાજકારણમાં એક નેતાને બીજા નેતાની લોકપ્રિયતાની થતી ઈર્ધા - આમ ઈર્ધા દરેક ક્ષેત્રમાં રહેલી છે. માનવહૃદયમાં રહેલી ઈર્ધા જ્યારે પ્રગટ રૂપે બ્યક્ત થાય છે, ત્યારે માણસ અન્યનું કાસળ કાઢવા પણ તૈયાર થઈ જાય છે. પછી એનું પરિણામ ભલે પોતાને ગમે તે ભોગવવું પડે. ‘પણ એકવાર તો એ માણસને પાડી દેવો’ આ હીન વૃત્તિથી પ્રેરાયેલો માણસ બીજાનું ખરાબ કરે છે અને તેથી પોતાનું જીવન પણ બરબાદ કરે છે.

ઈર્ધા એ પેટમાં રહેલાં કરમિયાં જેવી છે. પેટમાં કરમિયાં હોય તો શરીર વધતું નથી. બધું સત્ત્વ એ કરમિયાં ખાઈ જાય છે. એમ મનમાં ઈર્ધા હોય તો મનનો વિકાસ થતો નથી. મનનું સત્ત્વ અને મનના પ્રકાશને ઈર્ધા ખાઈ જાય છે. ઈર્ધાનું વિષ ધીમે ધીમે માણસના જીવનમાં વ્યાપીને તેના સમગ્ર જીવનને વિષમય બનાવી દે છે. ઈર્ધાળું વ્યક્તિને કદી શાંતિ મળતી નથી. સુખ સંતોષ મળતાં નથી. સ્વામી વિવેકાનંદે જીવનને મહાન બનાવવા માટે મુખ્ય ત્રણ બાબતોનું પાલન કરવાનું કહ્યું છે, તેમાં સહૃદ્દુ પ્રથમ છે, શુભમાં શ્રદ્ધા રાખવી. અને બીજી બાબત છે ઈર્ધા. અને દ્વેષનો સંદર્ભ ત્યાગ કરવો. જેમણે આ બે બાબતોનું પાલન કર્યું હોય તેઓ ત્રીજી બાબતનું આપોઆપ પાલન કરવા લાગે છે. એ ત્રીજી બાબત છે, “જે કોઈ સારું થવાને પ્રયત્ન કરતું હોય તેને સહાય કરવી.” ઈર્ધાળું વ્યક્તિ કદી બીજાને સહાય કરી શકતી નથી. એ તો હંમેશાં બીજાનું ખરાબ કરવા જ તત્પર હોય છે. અને એમાં એમને પોતે માની લીધેલો આનંદ મળતો હોય છે. પરંતુ વાસ્તવમાં એ આનંદ હોતો નથી. આસુરી વૃત્તિની વિકૃત લાગણી જ હોય છે. સાચો આનંદ કેવો હોય એની ઈર્ધાળું અને દ્વેષથી ભરેલી વ્યક્તિઓ સ્વખનમાં પણ ઝાંખી કરી શકતી નથી.

ઈર્ધાવશ મનુષ્ય કેવું આચરણ કરી બેસે છે, અને તેનું કેવું પરિણામ પોતાને ભોગવવું પડે છે તેનો એક કિસ્સો ફેન્ચ પત્રકાર પોલ બ્રાન્ટને પોતાના ભારતભ્રમણ દરમિયાન નજરે જોયેલો હતો તે નોંધેલો છે. એક સિદ્ધ યોગી દિવસો સુધી સમાધિમાં રહેતા હતા. પણ જ્યારે તેઓ સમાધિમાંથી જાગૃત થતા ત્યારે એમને એક ડોલ ભરીને દૂધ પીવા જોઈતું. શિષ્યો એમને માટે એ તૈયાર રાખતા. આ મહાત્માને બધા લોકો ખૂબ ચાહતા. તેમને માન આપતા. દૂર દૂરથી લોકો તેમનાં દર્શને આવતા. હવે એમના એક શિષ્યને ગુરુની ઈર્ધા થઈ કે “લોકો ગુરુને

જ માન આપે છે. મારી સામે તો કોઈ જોતું નથી.” આ ઈર્ષાની જ્વાળા વધતી ગઈ. આખરે તેણે તેનો ભાગ ભજવી લીધો. ગુરુ સમાધિમાંથી જાગ્યા ત્યારે દૂધને બદલે ચૂનાના પાણીથી ભરેલી ડોલ આપી. મનમાં માની લીધું કે ગુરુ પી જશે, સમાધિમાંથી ઉક્ખા છે એટલે એમને કંઈ ખબર નહીં પડે અને બધું પતી જશે. કોઈનેય ખબર નહીં પડે કે શું થયું છે, અને પોતે ગુરુના સ્થાને આવી જશે ! અને ગુરુ પણ શાંતિથી જાણે દૂધ જ પીવે છે, એમ ચૂપચાપ બધું પી ગયા અને પાછા ધ્યાનમાં ઉત્તરી ગયા. થોડીવાર થઈ ત્યાં તો શિષ્યને પેટમાં ભારે બળતરા થવા લાગી. પછી તો આખા શરીરમાં લાય બળવા લાગી. એવી અસહ્ય બળતરા થતી હતી કે તે ધૂળમાં આળોટવા લાગ્યો. પછી તેને ભાન આવ્યું કે આવું કેમ થાય છે, તે ગુરુના ચરણમાં આળોટીને આકંદ કરવા લાગ્યો : “મને ક્ષમા કરો. ક્ષમા કરો. મેં કેવું કુકર્મ આચર્યું છે કે હું ક્ષમાને લાયક પણ નથી. પણ મારી આ બળતરા શાંત કરો.” ગુરુએ આંખો ખોલી કહ્યું, “બેટા, આપણે એક જ છીએ, એ તને ખબર નથી ? તે જે મને આચ્યું એ તને મળ્યું છે !” પણ પછી શિષ્યનો તીવ્ર વલોપાત જોઈને ગુરુએ વમન કરી નાંખ્યું અને તેની બળતરા શાંત કરી દીધી ! ગુરુ વૈશિક ચેતનામાં જીવતા હતા એટલે તેઓ પ્રત્યક્ષ રૂપે આ કરી શક્યા. આપણે જીવીએ છીએ તો એ જ ચેતનામાં પણ આપણે જાગૃત નથી. પણ ભલે જાગૃત ન હોઈએ તો પણ એકબીજાથી અલગ નથી જ. આથી જેવું બીજાને આપીએ છીએ તેવું આપણને મળે છે. બીજાની લીટીને નાની કરીને પોતાની લીટી મોટી કરનારની લીટી વાસ્તવમાં નાની થઈ જાય છે. કેમ કે, બે જુદી જુદી દેખાતી હોવા છતાં લીટી એક જ છે. આથી જે બીજાની લીટીને મોટી કરે છે, તેની પોતાની લીટી આપોઆપ મોટી થઈ જાય છે.

ઈર્ષામાંથી મુક્ત થવા માટે માણસે શું કરવું જોઈએ ? સર્વપ્રથમ તો માણસે પોતાની અંદર રહેલી ઈર્ષાવૃત્તિને જાગ્યવી જોઈએ. પછી

અમાંથી મુક્ત થવા સંકલ્પ કરવો જોઈએ. જ્યારે પોતાની અંદર ઈર્ષાનો સળવળાટ થતો દેખાય ત્યારે તેના ઉપર શુભ સંકલ્પનું દબાણ મૂકવું જોઈએ. જેના પ્રત્યે એ ભાવ જાગે છે, એ વ્યક્તિ પ્રત્યે પોતાના હદ્યમાંથી પ્રેમ અને સદ્ગ્રાવની લાગણી જાગૃત કરવી જોઈએ. થોડો સમય સભાનપણે આ રીતે કરતાં પછી ઈર્ષા ઓગળી જાય છે અને તેના સ્થાને સર્વ પ્રત્યે પ્રેમ અને સદ્ગ્રાવ આવે છે. જ્યારે માણસ ઈર્ષામાંથી મુક્ત થાય છે, ત્યારે જ એને જાણ થાય છે કે ઈર્ષાથી જે નહોતું મળી શક્યું, એ પ્રેમ અને ત્યાગથી સાવ સહજમાં મળી ગયું છે. તેથી જીવનમાં વિશાળતા આવે છે. અને એવું જીવન સર્વને આનંદ આપનારું બની રહે છે.

### શંકા અને અવિશ્વાસનો ત્યાગ કરવો :

શંકા એટલે કોઈપણ પ્રકારની સફળતામાં અવિશ્વાસ. શંકા એટલે કોઈપણ હકીકત, વસ્તુ કે વ્યક્તિની સચ્ચાઈમાં અવિશ્વાસ. જેમને બધાંમાં અવિશ્વાસ છે, તેમને ખરેખર તો પોતાનામાં જ વિશ્વાસ હોતો નથી. તેઓ કોઈપણ કાર્ય શરૂ કરે તે પહેલાં જ શંકાશીલ હોય છે કે ‘આ કામ સફળ નહીં થાય તો’ એટલે મોટેભાગે તો તેઓ શંકાને લઈને કામ શરૂ કરતા જ નથી હોતા. શંકાથી શરૂ કરેલું કામ પછી સફળ નથી થતું એટલે પછી કહે છે કે મને તો ખાતરી જ હતી કે ‘આ કામ નહીં થાય.’ આમ પછી નકારાત્મક વલણ વધતાં શંકાશીલ વ્યક્તિ પોતાના જીવનમાં પણ સફળતા મેળવી શકતી નથી.

બીજો પ્રકારની શંકા ભગવાનના અસ્તિત્વ વિશેની હોય છે. તેઓ ભગવાનના અસ્તિત્વ વિશે શંકા કર્યા કરતા હોય છે. ‘ભગવાન હોય તો દેખાવા જોઈએ.’ એમ દલીલો કરીને પોતાની નાસ્તિકતાને પોષતા રહે છે. આવી દલીલોને શ્રીમાતાજી માનવમનની રોગિઝ ટેવ કહે છે. તેઓ કહે છે, “શંકા કરવી, દલીલો કરવી અને નાસ્તિકતા સાથે

માનસિક રીતે રમત કરવી, એના કરતાં વધારે જોખમકારક બીજી કોઈ વાત નથી. આ ત્રણ વસ્તુઓ એ માનવજાતના શત્રુઓ જ નથી પણ પતનના ખાડા છે. એકવાર એમાં પડ્યા પછી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે.”

દલીલો કરનારને, તર્ક કરનારને માણસો બુદ્ધિશાળી માને છે અને જેઓ શંકા કર્યા વગર કોઈ વાતને શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લેતા હોય છે, તેમને તેઓ મૂર્ખ માનતા હોય છે. આ બાબતમાં સાવધાન કરતાં શ્રીમાતાજી કહે છે, “જો તમે શંકા અને નાસ્તિકતાનાં સૂચનો સાંભળશો તો તમે સ્થૂલ અજ્ઞાનમાં ગબડી પડશો. સાચા માર્ગથી દૂર ચાલ્યા જશો. ગુંચવાડામાં પડી જશો. વિરોધમાં અટવાઈ પડશો અને તમારા અંતરાત્માથી એટલા બધા દૂર ફેંકાઈ જશો કે તમને પછી સત્ય દેખાશો જ નહીં અને તમે તમારા આત્માનો સંપર્ક ગુમાવી દેશો.”

ત્રીજા પ્રકારની શંકા તે અન્ય વ્યક્તિઓ વિશેની શંકા છે. આ શંકા પડા ખતરનાક છે. સામાન્ય જીવનમાં પણ આ શંકાનો કીડો ભર્યા ભર્યા સંસારને નષ્ટબ્રષ્ટ કરી નાંબે છે. પતિની નિર્દ્દેશ પત્નીના ચારિત્ર્ય પરની શંકા તેના મહેકતા સંસારબાગને વેરાન કરી નાંબે છે. જ્યાં શંકા આવી ત્યાં પ્રેમ અને વિશ્વાસ ટકતાં નથી. પ્રેમ વગરનો સંસાર રગણિયા ગાડાની જેમ ચાલતો રહે છે. પણ એમાં જીવનનો આનંદ રહેતો નથી. પિતાને પુત્ર પરનો અવિશ્વાસ, શેઠને નોકર પરનો અવિશ્વાસ, ધંધામાં ભાગીદારોને એકબીજા પરનો અવિશ્વાસ - આમ પરસ્પર શંકા અને અવિશ્વાસમાંથી સંબંધોમાં તિરાદ પડે છે અને એકબીજાના વર્તન પર છૂપી નજર રાખવામાં આવે છે. આમ, નાની એવી શંકાને લઈને કુટુંબો ભાંગે છે. ધંધાઓ ભાંગે છે. અનેકના જીવન બરબાદ થાય છે.

શંકાશીલ માણસ કળાણમાં ખૂંપેલા મનુષ્યની માફક જેમ તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે તેમ તેમાં વધારે ને વધારે ખૂંપતો જાય ચાલો, જીવનને આનંદમય બનાવીએ

છે. આખરે પોતે નાશ પામે છે. અને બીજાંઓને પણ તેના છાંટા ઉડાડતો જાય છે. મનમાં પેઠેલી શંકા કીડા જેવી છે. જેમ કીડો અંદરથી ફળને કોતરી ખાય છે, તેમ શંકા પ્રથમ તો માણસને ખબર પણ ન પડે તે રીતે તેના મનમાં પ્રવેશે છે અને પછી ધીમે ધીમે તે બળવાન બનીને મનુષ્યના સમગ્ર જીવનને છિન્ન ભિન્ન કરી નાંબે છે. મહાન અંગેજ નાટકકાર શેક્સપિયરનું ઓથેલો નાટક શંકા દ્વારા પ્રેમમય સંસાર કેવો બરબાદ થઈ જાય છે તેનું ઉત્તમ દખ્યાંત પૂરું પાડે છે. ઓથેલો હબસી સેનાપતિ હતો. તેના પ્રેમમાં ડેસ્ટિમોના નામની સુંદર યુવતી પડી હતી. બંનેએ લગ્ન કર્યા. લગ્નજીવન પ્રેમથી ભર્યું ભર્યું હતું. પરંતુ ઈઆગોએ ઓથેલોના મનમાં શંકા જગાડી કે ડેસ્ટિમોના તો કેસિયો નામના યુવાનના પ્રેમમાં છે. તારા જેવા કુરુપને આવી સુંદર સ્ત્રી કદી પ્રેમ કરે જરી ? પછી ઓથેલો ડેસ્ટિમોનાને શંકાની દાઢિથી જ જોતો રહ્યો. તેનાં સર્વ કાર્યાને, વાતચીતને પણ એ જ રીતે મૂલવતો રહ્યો અને આખરે તેણે પોતાની પુષ્પ જેવી સુકોમળ અને નિર્દોષ પત્નીને ગળું દબાવીને મારી નાંખી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી. આમ, નાની એવી શંકા વધતાં વધતાં પોતાની જાળ કેવી ફેલાવે છે, અને એક પ્રેમસભર સંસારનો નાશ કરી દે છે, એ ફક્ત વાર્તાઓનાં પાનાં ઉપર જ જોવા નથી મળતું. પરંતુ વાસ્તવિક જીવનમાં પણ જોવા મળે છે.

આથી મનમાં સહેજ પણ શંકા પ્રવેશે ત્યારે જ તેને ખેંચીને કાઢી નાંખવી જોઈએ. કોઈ વ્યક્તિ પ્રત્યે મનમાં સહેજ પણ શંકા ઉઠે તો તેનાં વાણી-વર્તનને શંકિત નજરે જોવા કરતાં તેની પાસે બેસીને ખુલ્લા દિલે બધી વાત કરી સ્પષ્ટતા કરી લેવી જોઈએ. નિખાલસતાભરી વાત શંકાને નિર્મૂળ કરી દે છે.

શંકાને દૂર કરવા આપણી અંદરની શ્રદ્ધાને બળવાન કરવી જોઈએ. શ્રદ્ધા ટકી રહે તે માટે પ્રયત્ન કરવો જોઈએ. જેમ શ્રદ્ધાનો સૂર્ય

પ્રકાશતો જશે તેમ શંકાનાં વાદળો હટતાં જશે. તે ઉપરાંત બુદ્ધિના માપદંડથી માપવા કરતાં હદ્યથી કામ લેવું જોઈએ. સરળ અને નિખાલસ હદ્યમાં શંકા અને અવિશ્વાસ વધારે સમય ટકતાં નથી. આવાં જ હદ્યો આનંદને પોતાનામાં સ્થાયી ટકાવી શકે છે.

## ભયનો ત્યાગ :

ભય એટલે જીવનની અસલામતી જણાય કે ખતરો જણાય ત્યારે સમગ્ર અસ્તિત્વમાંથી ઉઠતી કંપનની લાગણી. જીવનું જોખમ હોય, ત્યારે માણસ બેબાકળો બની પ્રૂજી ઉઠે છે એ છે ભય. ભગવાને જીવંત પ્રાણીઓની ચેતનામાં એમની આત્મસુરક્ષા માટે આ ભય મૂકેલો છે. પરંતુ મનુષ્યે એ સાહજિક ભયને વધારે તીવ્ર બનાવ્યો છે અને તે પોતાના જીવન દરમિયાન અનેક પ્રકારના ભય અનુભવતો રહે છે. કોઈને રોગનો ભય હોય છે, તો કોઈને શત્રુનો, તો કોઈને સંપત્તિ ચાલી જવાનો, તો કોઈને ગ્રહોના નડતરનો, તો કોઈને દેવી - દેવતાઓના પણ ભય હોય છે. આમ મનુષ્યો એક યા બીજા પ્રકારના ભયથી દોરાયેલા હોય છે. આ સંદર્ભમાં શ્રીમાતાજી કહે છે, “સાધારણ માણસની સ્થિતિ ભય અને બીક ભરેલી હોય છે. તમે ફક્ત દસ જ મિનિટ તમારી અંદર ઊંડા ઉતરો અને તમારા ભૌતિક મનને તપાસો તો જણાશે કે દશ મિનિટમાંથી નવ મિનિટ તો ભયથી ભરેલી હોય છે.” નાનીમોટી, નજીકની દૂરની, દશ્યઅદશ્ય એમ જુદી જુદી અનેક વસ્તુઓની માણસને બીક લાગે છે. જાગૃત અવસ્થામાં ભલે તે દેખાતી ન હોય, પણ માણસના સ્વરૂપમાં ઊરિ ઊરિ તે રહેલી હોય છે.

ભયથી અનેક આપત્તિઓ, માંદગી, અક્સમાત સર્જાય છે. માણસો રોગથી મૃત્યુ પામે તેના કરતાં ભયથી વધારે મૃત્યુ પામે છે. આ વિશે એક પ્રતીકાત્મક વાર્તા છે કે દેવદૂતે મૃત્યુના દેવને પૂછ્યું કે તમે કહેતા હતા ને કે પ્લેગના રોગને લઈને પાંચ હજાર જ મનુષ્યો મૃત્યુ ચાલો, જીવનને આનંદમય બનાવીએ

પામ્યા છે. પણ હકીકતમાં તો પચાસ હજાર માણસો મૃત્યુ પામ્યા છે. ત્યારે મૃત્યુના દેવે કહ્યું, ‘મારી યોજના પ્રમાણે તો ખેગથી પાંચ હજાર જ મનુષ્યો મૃત્યુ પામ્યા છે. બાકીના તો ખેગના ભયથી જ મરી ગયા છે.’ આ રીતે ભય મૃત્યુનું કારણ બને છે. મનુષ્યની અંદર રહેલો ભય, સૂક્ષ્મમાંથી આપત્તિઓને આમંત્રણ આપે છે અને તેથી એ ભય પ્રમાણે બનવા લાગે છે. એમ બનતાં માણસ વધારે ભયભીત બને છે. આમ ભય અને આપત્તિઓનું વિષયક સર્જાતું રહે છે.

શ્રીમાતાજી કહે છે, “તમને જેનો ભય છે, તે વસ્તુઓ ફરી ફરીને તમારી સામે આવતી જ રહે છે. જ્યાં સુધી તમે એ ભયમાંથી સંપૂર્ણ મુક્તા ન થાઓ ત્યાં સુધી એ અનુભવો તમને ફરી ફરીને થયા કરે છે. દા.ત. તમે કોઈ માણસથી ડરતા હો તો એવા પ્રસંગો બનતા રહે છે કે તમારે એ માણસને મળવાનું વારંવાર થયા કરે છે. જ્યાં સુધી તમને એનો ડર નીકળી ન જાય ત્યાં સુધી ફરી ફરીને એ બનતું રહે છે.” ચેપી રોગોના ડરનું પણ એવું જ છે. માણસને રોગના ચેપનો ભય હોય છે. અને ભય એ એ રોગને આપેલું અદશ્ય આમંત્રણ છે. એટલે રોગ આવે છે !

માણસોને દેવીદેવતાઓનો પણ ભય લાગતો હોય છે. નૈવેદ્ય બરોબર નહીં ધરાય કે પૂજામાં ખામી આવી જશે તો કુળદેવી કોપાયમાન થશે અને હેરાનપરેશાન થઈ જઈશું કે આજે માતાજીનો મંગળવાર ભૂખ્યા રહેવાનો ભુલાઈ ગયો એટલે માતાજી કોપાયમાન થશે. આવા ભય પણ માણસની અંદર રહેલા હોય છે. માણસો ભગવાન ગુસ્સે ન થાય, તેમનો કોપ ન ઉતરે એ ભયથી પૂજાપાઠ કરતા હોય છે. આપણી સત્યનારાયણની કથામાં પૂજન બાદ કરતાં જે વાર્તા આવે છે તેમાં ભગવાનનું પૂજન નહીં કરવાથી જીવનમાં કેવી વિટંબણાઓ આવે છે, તે દર્શાવીને માણસના મનમાં ભગવાન પ્રત્યે ભય ઉભો કરે છે કે પૂજામાં કંઈ બાકી રહી ગયું કે પ્રસાદ નથી લીધો તો હવે શું થશે ? પરંતુ આ

તો ભગવાનનો મહિમા વધારવા માટે એમના ભક્તોએ કથાઓ રચીને ઉભો કરેલો ભય છે. એમાંથી ભગવાનને જેઓ ક્યારેય ન હતાં - એવા કઠોર - પૂજામાં એક પણ ભૂલ ન ચલાવી લે તેવા અસહિષ્ણુ બનાવી દેવામાં આવ્યા હોય છે. વાસ્તવમાં ભગવાન તો આપણી તમામ ભૂલોને માફ કરીને પ્રેમપૂર્વક આપણાને એમની સમીપ લઈ જઈ રહ્યા છે. પરંતુ દરેક ધર્મમાં કહેવાતા ધર્મગુરુઓ પોતાનો સ્વાર્થ સાધવા માટે ભગવાનનું બિહામણું ચિત્ર અને પરલોકની ભયાનક યાતનાઓનાં દશ્યોનું કાલ્યનિક વર્ણન કરી મનુષ્યોના મનમાં ભગવાનનો, મૃત્યુનો અને મૃત્યુ પછીના જીવનનો ભય ઉભો કરી દે છે. તેને લઈને માણસ આખી જિંદગી એ ભયમાં ફંડતો રહે છે.

મનુષ્યે બધા જ પ્રકારના ભયમાંથી મુક્ત થવું જરૂરી છે. પણ ભયમાંથી મુક્ત ત્યારે જ થઈ શકાય કે જ્યારે તે ભયને ઉત્પન્ન થવાનાં કારણો જાણતો હોય. ભય ઉત્પન્ન થવાનું પ્રથમ કારણ છે, આત્મ સુરક્ષાની ભાવના.

બીજું કારણ છે, ધૃત્યા અને તિરસ્કાર. જેમના પ્રત્યે વ્યક્તિને ધૃત્યા હોય છે. તેના પ્રત્યે ભય જાગે છે. જો કોઈ વ્યક્તિને સાપ પ્રત્યે ધૃત્યા હોય તો તેને સાપનો ભય લાગે છે. એ જ રીતે અમુક મનુષ્ય પ્રત્યે કોઈને અણાગમો કે તિરસ્કાર હોય તો પછી તેને તેનો ભય લાગે છે.

ભયનું ત્રીજું મુખ્ય કારણ અજ્ઞાન છે. મનુષ્યને દેવીદેવતાઓનું કે ભગવાનના સ્વરૂપનું સાચું જ્ઞાન નથી એટલે તેમનો ભય લાગે છે. પણ એકવાર પણ જેમને ભગવાનનાં દર્શન થયાં છે, તેમને કદી ભગવાનનો ભય લાગશે નહીં. અંધારામાં દોરડાને સાપ માનીને તેનો ભય લાગે છે. પણ ટોર્ચ ધરતાં ખબર પડે છે કે દોરડું છે, એટલે ભય જતો રહે છે. જેવું જ્ઞાન થાય છે કે ભય જતો રહે છે. જેમને સ્વરૂપનું જ્ઞાન થાય છે તેમને આ દુનિયામાં કોઈનોય ભય રહેતો નથી. કેમ કે અલગ

## હોય તેનો ભય લાગે, પણ જ્યાં બધું એક જ હોય, ત્યાં કોનો ભય લાગે? ભયમાંથી કેવી રીતે મુક્ત થવું ?

સૌપ્રથમ પદ્ધતિ એ છે કે જેનો ભય લાગે છે, તેનો બહાદુરીપૂર્વક સામનો કરવો. આ પાઠ સ્વામી વિવેકાનંદ પણ પોતાના જીવનના એક પ્રસંગ પરથી શીખ્યા હતા. તેઓ એક વખત યમુનાના કિનારે ફરતા હતા. ત્યારે વાંદરાઓ તેમની પાછળ પડ્યા અને સ્વામીજી દોડવા લાગ્યા, તો વાંદરાઓ પણ તેમની પાછળ દોડ્યા. દૂર ઊભેલા એક સાધુએ આ જોઈને બૂમ પાડી : “વત્સ, ભાગો મત, ખડે રહો ઔર સામના કરો” પછી સ્વામી વિવેકાનંદ સ્થિર ઊભા રહી ગયા અને વાંદરાઓની સામે જોવા લાગ્યા. તો વાંદરાઓ પણ ઊભા રહી ગયા. પછી સ્વામીજીને સ્થિર ઊભેલા જોઈને ધીમે ધીમે પાછા ફરી ગયા. સ્વામી વિવેકાનંદ જણાવ્યું છે કે “આ પ્રસંગે મને જીવનનું મોટામાં મોટું સત્ય સમજાવ્યું કે કોઈથી ડરીને ભાગવું નહીં. ભયજનક પરિસ્થિતિ હોય તો તેની સામે ઊભા રહી જવું ને તેનો સામનો કરવો.” જેવો આપણે સામનો કરીએ તો ભય પમાડતાં પરિબળોની શક્તિ ઓછી થઈ જાય છે અને આપણી શક્તિ વધી જતાં આપણે ભય પ્રેરનારાં પરિબળો ઉપર વિજય મેળવી શકીએ છીએ.

બીજું, જેનો ભય લાગે છે, તેની ચિંતા નહીં પણ ચિંતન કરવાનું, ચિંતન કરવાથી તેના સ્વરૂપનું દર્શન થતાં ભય જતો રહે છે. માણસને મોટામાં મોટો ભય મૃત્યુનો લાગે છે. તો મૃત્યુનું ચિંતન કરતાં, તેનું રહસ્ય સમજાય છે અને ભય જતો રહે છે. રમણ મહર્ષિને અગિયાર વર્ષની વયે મૃત્યુનો ભય લાગ્યો હતો. મૃત્યુ શું છે. એ જ્ઞાનવા માટે એના પર ચિંતન કરતાં કરતાં તેમણે મૃત્યુનો અનુભવ કર્યો અને પછી આત્મદર્શન થતાં મૃત્યુનો ભય ટળી ગયો.

ત્રીજું, ભયને દૂર કરવા માટે માણસે સંકલ્પ કરવો જોઈએ. એ માટેનું માર્ગદર્શન આપતાં શ્રીમાતાજી કહે છે કે “જીવનની નાનામાં નાની વસ્તુથી માંગીને મોટામાં મોટી વસ્તુઓ ભौતિક તેમ જ આધ્યાત્મિક વસ્તુનો સામનો કરવા શક્તિમાન થાઓ. જરાપણ પ્રુજારી થવા દીધા સિવાય, હદ્ય વધારે ધડકે નહીં તે રીતે, જ્ઞાનતંતુઓ કુંપે નહીં તે રીતે, અસ્તિત્વના કોઈપણ ભાગમાં ઉશ્કેરાટ કે લાગણી ઉત્પન્ન થવા દીધા સિવાય, ભગવાનને સંપૂર્ણ સમર્પણ કરીને, એ સંકલ્પમાં સમગ્ર અસ્તિત્વને એકાકાર કરીને દરેક વસ્તુનો સામનો કરો.” જો આ રીતે હિંમતપૂર્વક ભયનો સામનો કરવામાં આવે તો દુનિયામાં કોઈપણ ભય એવો નથી કે જેના ઉપર વિજય ન મેળવી શકાય. જેમણે ભયને જીતી લીધો છે, તેમના ચરણમાં વિશ્વ જૂકે છે. સ્વામી વિવેકાનંદ કહે છે, “કોઈ વસ્તુથી ડરો નહીં તો તમે અદ્ભુત કાર્ય કરી શકશો. જે ઘડીએ તમે ડર્યા, તે ઘડીએ તમે કશું જ નથી. આ દુનિયામાં દુઃખનું મોટું કારણ ભય છે. મોટામાં મોટો વહેમ હોય તો તે ભય છે. આપણી આપત્તિઓનું કોઈ કારણ હોય તો તે ભય છે. અને પળવારમાં અહીં સ્વર્ગ ખડું કરનાર કોઈ હોય તો તે નિર્ભયતા છે.” આમ, ભયનો ત્યાગ કરવાથી જીવનમાં સ્વર્ગ ખડું થઈ જાય છે.

### દંભનો ત્યાગ :

દંભ એટલે વાસ્તવમાં મનુષ્ય જે હોય તેના કરતાં જુદો દેખાવાની વૃત્તિ. સમગ્ર સૃષ્ટિમાં પશુ, પક્ષી, વનસ્પતિ, પ્રકૃતિનાં તત્ત્વો સાહજિક રીતે જીવે છે. એકમાત્ર મનુષ્ય પોતે જે હોય છે, તેને ઢાંકીને સારાપણાના દેખાવનું મહોદું પહેરીને ફરે છે. એટલે તેણે સાહજિકતા ગુમાવી દીધી છે અને દુઃખી થાય છે. મનુષ્યને ખોટો દેખાવ કરવો, પોતે હોય તેના કરતાં વધારે સારા, વધારે શ્રીમંત, વધારે સુંદર કે વધારે વિદ્વાન દેખાવું ગમે છે. એ માટે તે સતત પ્રવૃત્ત રહે છે. પણ વાસ્તવમાં ન હોય તેનો

દેખાવ કરવા માટે કેટલા બધા પ્રયત્નો કરવા પડે છે ! એમાં આંતર જીવન અને બાહ્ય જીવન બંને વિભક્ત થઈ જવાથી આંતરિક પ્રગતિ થઈ શકતી નથી. શ્રીમાતાજી કહે છે કે “દેખાવું એના કરતાં બનવું વધારે સારું છે. જેઓ સાચા છે, તેમને દેખાવ કરવાની કોઈ જરૂર જ હોતી નથી. જ્યારે વ્યક્તિ પોતાના સાચા સ્વરૂપમાં હોય છે, ત્યારે લોકો તેને શું કહેશે, કે લોકો તેના વિશે શું ધારશે તેની તેને લેશમાત્ર પરવા હોતી નથી, કેમ કે, તે તો લોકોના અભિપ્રાયોથી નિર્ણય રહીને પોતાના જીવનના મૂળભૂત સત્ય પ્રમાણે જીવન જીવતા હોય છે.”

પરંતુ મોટેભાગે માણસો પોતાના આંતર સત્ય પ્રમાણે જીવતાં હોતાં નથી. પોતે કંઈ ખોટું કામ કર્યું હોય તો તેને સાચું ઠેરવવા અથવા પોતાની ભૂલ હોય તો પોતે એ ભૂલ કરી નથી એ સાબિત કરવા અનેક સમર્થનો આપતા હોય છે. શ્રીમાતાજી આવાં વલાણને પણ દંબ કહે છે. તેઓ કહે છે, “માણસે ખોટું કામ કર્યું હોય, તો પણ મન એને અનુકૂળ સમજૂતીઓ આપે છે. જેથી એને આંતરકચ્ચવાટ ન થાય. પહેલાં તો માણસ પોતાની જાતને સમજૂતી આપે. અને તેના ઉપર જો સંજોગોનું દબાણ આવે તો તે બીજાં ઓને પણ સમજૂતી આપે છે કે એ તો એમ જ બનવાનું હતું. મેં ન કર્યું હોત તો પણ એમ બનત. એમાં મારો કંઈ વાંક નથી. અથવા તો સંજોગો જ એવા હતા કે મારે કરવું પડ્યું. એમાં હું શું કરું ? આ છે મનની દલીલો. જ્યારે સહજ સ્વીકારને બદલે મન અનેક દલીલો રજૂ કરી પોતે કરેલાં કાર્યને સાચું ઠેરવવા પ્રયત્ન કરે ત્યારે સમજ લેવું કે આ કામ ખોટું કર્યું છે. સાચા કાર્યને સાબિત કરવું પડતું નથી કે તે માટે કોઈ દલીલની જરૂર જ પડતી નથી. શ્રીમાતાજી આને જાતને છેતરવાની કિયા કહે છે. માણસનું મન આ કિયામાં ખૂબ પાવરધું છે. ખોટાંને સાચું બતાવવામાં તે ચતુર છે. તેઓ કહે છે, “માણસે પોતાની જાતને કદી છેતરવી જોઈએ નહીં. કેમ કે ચાલાકમાં ચાલાક અસુરો પણ

ભગવાનને છેતરી શકતા નથી. આ જાણવાં છતાંય તમારા જીવનમાં તમે દિવસમાં કેટલીય વાર તદ્દન સ્વાભાવિકપણે આપોઆપ જતને છેતરવાનો પ્રયત્ન કરતા હો છો. એને માટેના લાભદાયી ખુલાસા તમારી જતને આપો જ છો..... કંઈ ખોટું કામ થાય, ભૂલ થાય તો તેના માટે જવાબદાર બીજી જ વ્યક્તિઓ હોય છે.”

માણસને કંઈ કામ ન કરવું હોય તો ‘મારી ઈચ્છા નથી એમ કહેવાને બદલે જ્યારે કોઈ બહાનું શોધે, ત્યારે તેનામાંથી સંચાઈ ચાલી જાય છે અને દંબ આવે છે. દંબ આવતાં વિકૃતિ આવે છે. આ વિશે શ્રીમાતાજી કહે છે, “હું આ વસ્તુને દુષ્ટ અને અધમ કહું છું.” બાબત એ છે કે માણસ પોતાની જતને સિફતથી છેતરે છે. તેને જે ન કરવું હોય તેના માટે સુંદર તરકીબો શોધી કાઢીને અસરકારક રીતે રજૂ કરે છે. ઘણા ખરા માણસો તો એટલા બધા અચેતન હોય છે કે તેઓ સમજ્યા વગર જ આમ કરતાં હોય છે.

માણસો ભગવાનના નામે પણ દંબ આચરતા હોય છે. ઘણા માણસો ‘ભગવાનની ઈચ્છા હશે તો કામ થશે’ એમ માની નિષ્ઠિય બની બેસી જાય છે. પોતાની આળસને પોષે છે. આ પણ એક દંબ જ છે. અથવા તો પોતાને માન-સન્માન મળતું હોય, એટલે કામ કરતા હોય છે અને કહે છે તેમ કે ‘હું તો ભગવાનને માટે કરું છું. એમની સેવા કરું છું.’ આ પણ આત્મવંચના છે. આમ, દંબ એ માણસના સ્વરૂપમાં એવો વણાઈ ગયો છે, કે સૂક્ષ્મ જાગૃતિ વગર એ પારખી પણ શકતો નથી. પરંતુ જ્યાં સુધી માણસે દેખાવ માટે મહોરું પહેરેલું હોય છે, ત્યાં સુધી તે કદી આત્મપ્રકાશ મેળવી શકતો નથી. તેની આંતરિક શક્તિઓ કદી પ્રગટ થતી નથી. આથી મનુષ્યને પ્રભુની દિવ્ય બક્ષિસો પ્રાપ્ત કરવી હોય તો પોતાની અંદર દંબનો પડછાયો પણ રહેવા દેવો ન જોઈએ. તો એ માટે શું કરવું ?

દંભમાંથી મુક્ત થવાનો રસ્તો બતાવતાં શ્રીમાતાજી કહે છે,  
 “તમારે તમારી જાતનું અંતર નિરીક્ષણ કરવાનો અભ્યાસ કરવો  
 જોઈએ. જો તમે તમારી અંદર ઊંડાણપૂર્વક જોશો, તો તમને તમારી ભૂલ  
 સ્પષ્ટપણે જણાઈ આવશે, પછી તમારે તેનો સ્વીકાર કરી લેવો જોઈએ.  
 ધૂળી વખત આમાં તાત્કાલિક સફળતા મળતી નથી. વર્ષો વીતી જાય  
 છે. પણ જો માણસ આંતરિક શિસ્ત સ્થાપે, જાગૃતપણે રહેવાની ટેવ પાડે,  
 તો પોતાની અંદર ચાલતી તમામ કિયા-પ્રક્રિયાઓને તે તટસ્થ રીતે જોઈ  
 શકે છે અને ત્યારે તેને ખબર પડે છે કે ઓહ, તે પોતાની જાતને કેટલી  
 બધી છેતરતો હતો !”

જ્યારે માણસ પોતાની જાતને છેતરે છે, કે કંઈક ખોટું કામ કરતો  
 હોય છે, ત્યારે તેને પોતાના અંતરમાં બેચેની થાય છે. સામાન્ય ભાષામાં  
 ‘જીવ બળે છે.’ એમ કહેવામાં આવે છે, આવું બને ત્યારે માણસે પોતાની  
 ભૂલ શોધીને, ખોટું કામ કરતા હોય તો અટકી જઈને પોતાની અંદર  
 પ્રવેશોલા દંભને દૂર કરી દેવો જોઈએ. તો તે મહાપતનમાંથી ઊગરી જાય  
 છે. એની ચેતનામાં પડેલું એક નાનું સરખું છિદ્ર સહેલાઈથી પૂરી શકાય  
 છે. પણ માણસ જો પોતાના અંતરના અવાજને અવગણીને જાતને  
 છેતરતો જ રહે તો પછી ચેતનામાં એવડાં મોટાં ગાબડાં પડે છે, જે  
 ક્યારેય પૂરી શકાતાં નથી. આથી માણસને અંતરમાંથી ચેતવણી મળે  
 એ જ ક્ષણે એણે આ માર્ગ ગમે તેટલો લોભામણો લાગતો હોય તોપણ  
 પાછા વળી જવું જોઈએ. શ્રીમાતાજી કહે છે, “તમારા દંભ વિશે સભાન  
 બનો, પછી તમારે એક જ વસ્તુ કરવાની છે અને તે એ કે તમારે એક  
 લાલચોળ ગરમ લોઢું તેના ઉપર મૂંકવાનું. તમારી જાતને સર્યાઈવાળી  
 બનાવવા માટે તમારે આમ કરવું પડશે. તે સરસ રીતે બાળે છે. થોડો  
 વખત બળતરા થાય છે. પણ પછી સદાય ઠંડક રહે છે. માણસ શાંતિમાં  
 રહી શકે છે.” આ રીતે પોતાની જાત પ્રત્યે કડક વલણ દાખવીને માણસ

દંબમાંથી મુક્ત થઈ શકે છે.

આ રીતે આપણો જો આપણા જીવન પ્રત્યે જાગૃત બનીએ અને આપણી અંદર થોડા ફેરફાર કરીએ તો આપણનું જીવન બદલી શકાય છે અને જીવનનો સાચો આનંદ આપણો વધુ ને વધુ પ્રમાણમાં પ્રાપ્ત કરી શકીએ છીએ. શ્રીમાતાજી કહે છે, “આ પ્રયત્ન માણસ ગમે ત્યારે શરૂ કરી શકે છે. એમાં કદી વધારે પડતું મોહું થઈ જતું નથી. તમે તદ્દન નાનાં હો ત્યારે પણ તમારી જાતનો અભ્યાસ કરવો શરૂ કરી શકો છો. તમારી જાતને જાણવાનું અને તેના ઉપર થોડો થોડો કાબૂ મેળવવાનું કરી શકો છો. અને તમે લોકો જેને ઘડપણ કહો છો, તે અવસ્થામાં પહોંચ્યા હો, તમને ઘણાં વર્ષો થઈ ગયાં હોય ત્યારે પણ તમે તમારી જાતને જાણવા માટે પ્રયત્ન કરો, તમારી જાત ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરો. એમાં કદી પણ વધું પડતું મોહું થઈ જતું નથી.”

આમ, આપણો ગમે ત્યારે સાચી રીતે જીવન જીવવાનું શરૂ કરીને આપણા જીવનને પ્રભુના પ્રેમ, પ્રકાશ અને આનંદથી સભર બનાવી શકીએ છીએ.



“સૌ પ્રથમ તો તમે કોઈ અનુભવને ભૂલી જવાનો પ્રયત્ન કરજો. પછી એનું વિશ્લેષણ કરજો. એ પછી તમે એવી અનુભૂતિ કરજો કે એ અંગેની પ્રત્યેક વાતની મને ખબર છે. કોઈ અનિશ્ચિત બનશે એવી તમે કલ્યાના કરશો નહિ. એવો વિચાર તમારા મગજમાં પ્રવેશે તે પહેલાં જ તેને હાંકી કાઢજો. આ અંગેના તમારા વિચારો આ સીમા-મર્યાદાની અંદર રહેવા જોઈએ તેનું ખાસ ધ્યાન રાખજો.

આ મુજબ જો તમે ભયને ચારે બાજુથી ઘેરી લેશો તો તેના પરિણામની માત્રામાં, તેની અસરમાં જરૂર ઓછાપ વરતાશે.”

- ઈ. આર. ટોમસન

આપણને પ્રાપ્ત થતી આફતોનો મોટો ભાગ ધણુંખરું આપણાં કાર્યો ઉપરના આપણા કાબૂના અભાવને લીધે અને અન્યનાં કાર્યો વિષે આપણા પ્રત્યાધાતોને આભારી હોય છે.

આપણો સ્વભાવ અને આપણી નબળાઈઓને અનુલક્ષી આપણો આપણા ઉપર એક શિસ્ત લાદવી જોઈએ અને તેનું હંમેશાં પાલન કરવું જોઈએ. દાખલા તરીકે કદી પણ વાદવિવાદ ન કરવો; આપણને ન ગમતું હોય એવું કોઈ કહે અગર કરે ત્યારે કદી પણ જેવાબ ન આપવો; અને આપણો અસંમત હોઈએ તે પ્રસંગે કદી પણ ચર્ચા ન કરવી. આ તો ચોક્કસ સમજ રાખવું કે આપણો જે રીતે ઈચ્છીએ તે રીતે માણસો ન વર્તે અગર બનાવો ન બને ત્યારે આપણો કદી પણ ગુસ્સો ન કરવો.

સ્વાભાવિક છે કે જ્યારે આપણને આપણા સ્વભાવ ઉપર અંકુશ રાખવાની ટેવ ન હોય ત્યારે ઉપર્યુક્ત ટેવ પાળવાનું દુષ્કર બને છે. પરંતુ આપણે પ્રગતિ ઈચ્છતા હોઈએ તો આ ટેવ હોવી અત્યંત આવશ્યક છે. માર્ગ લાંબો છે અને તેથી જ આપણે ધીરજ રાખવી જોઈએ અને કદી દગ્દો ન હે એવી પોતાના પ્રત્યે આપણી પોતાની સર્વ્યાઈ હોવી જોઈએ.

બીજાની સાથે શાંતિમાં રહી શકાય તેટલા માટે આપણો આપણા ઉપર સંયમ હોવો અનિવાર્ય છે અને જેઓને રૂપાંતરની અભીસા ન હોય એવા બીજાઓએ પણ આ સંયમ કેળવવો જોઈએ.

- શ્રીમાતાજી

## (ટાઈટલ બીજાનું ચાલુ)

જ્યારે દિવસના પરિશ્રમ પછી શરીર અને મનને આરામ આપવા હું  
પથારીમાં પડું,

ત્યારે મને એવો પ્રકાશ બતાવ કે જેમાં દિવસભરમાં મેં ક્યાં શાશપણ  
વાપર્યું અને ક્યાં ભૂલો કરી તે જોઈ શકું અને તેની ઉપરથી બોધપાઠ  
લઈ શકું.

મનને પ્રકાશ આપ, પ્રભુ ! કે જેથી આવતી કાલની ગૂંઘવણો અને  
અનિશ્ચિતતાઓ, આઝિતો અને ઠોકરો વચ્ચેથી હું સત્ય પંથે ચાલી શકું.

મને વિજયમાં નમ્રતા અને પરાજયમાં હિંમત આપ,

અને પ્રભુ ! મને રાત્રે એવી શાંત અને સ્વસ્થ નિદ્રા આપ, કે જે ગ્રામાણિક  
પરિશ્રમનું મધુર ફળ છે.

પ્રભુ ! હું એવું કંઈ નથી માંગતી કે જે માંગતા શરમાવું પડે,  
મારી માંગણી બહુ નાનકડી છે.

હું થોડુંક વધુ માંગી લઉં ?

પ્રભુ ! મને સદ્ગુર્દ્ધિ આપો.

